



ગુવાહાટીમાં શિંદેનું 42 ધારાસભ્ય સાથે શક્તિપ્રદર્શન

PAGE NO. 14

પરદેશમાં દેશની મહેક એટલે



સ્વદેશ

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

FOR BUYING, SELLING & LEASING
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS
Free Home Staging Consultation
Professional Photography & Virtual Tour
Attractive Advertising
Social Media Marketing
Customized Feature Sheet
Weekly Open House
Assist in Mortgage & Legal Services

FOR BUYERS
Team of Strong Mortgage Brokers
Team of Lawyers
Professional Home Inspectors
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH
Sales Representative
Dir: 647-995-5640
amit@shahrealty.com

KOMAL SHAH
Sales Representative
Dir: 647-624-5640
komal@shahrealty.com

Homekey236@gmail.com
Web: www.amitshah.ca

FRIDAY, 24 JUNE, 2022 Vol. 19, No. 25 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

મહારાષ્ટ્રમાં ઉદ્ધવની સરકાર લઘુમતીમાં મૂકાયા બાદ શિવસેનાની શિંદ સામે શરણાગતિ અઘાડી સરકારમાંથી બહાર થવા શિવસેના તૈયાર

બળવાખોરોને મુંબઈ આવી ઠાકરે સાથે ચર્ચા કરવા રાઉતનું નિમંત્રણ : MLA ઈડીના દબાણ હેઠળ હોવાનો આક્ષેપ

મુંબઈ

મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં ગુરુવારે વધુ એક નવો વળાંક આવ્યો હતો. શિવસેનાના સાંસદ સંજય રાઉતે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, જો બળવાખોર ધારાસભ્ય ૨૪ કલાકમાં મુંબઈ પરત ફરશે તો, શિવસેના મહાવિકાસ અઘાડી સરકારમાંથી બહાર થવા તૈયાર છે. સંજય રાઉતના આ નિવેદનથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. કેમ કે, મહાવિકાસ અઘાડી સરકારને બચાવવા માટે કોંગ્રેસ અને એનસીપી સુપ્રીમો શરદ પવાર પણ સતત પ્રયાસો કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે, ધારાસભ્યોએ ગુવાહાટીથી વાતચીત ન કરવી જોઈએ. તેઓએ મુંબઈ પરત આવવું



જોઈએ અને આ મુદ્દે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી જોઈએ. જો આ તમામ ધારાસભ્યોની ઈચ્છા હશે તો, અમે એમવીએમાંથી બહાર થવા અંગે વિચારી શકીએ છીએ. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં મીડિયા સમક્ષ નીતિન દેશમુખ અને કેલાશ પાટિલને રજૂ કર્યા હતા. આ ઉપરાંત બળવાખોર ધારાસભ્યના લીડર એકનાથ શિંદે પર હુમલો કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે, આ લોકોમાં મુંબઈ આવવાની હિંમત નથી. હું કોઈ કેમ્પ વિશે વાત નહીં કરું. હું મારી પાર્ટી અંગે વાત કરીશ. આજના દિવસે પણ અમારી પાર્ટી મજબૂત છે. ૨૦ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેઓ જ્યારે મુંબઈ પરત ફરશે, ત્યારે તમને જાણ થશે. અમે ખુલાસો કરીશું. રાઉતે ઉમેર્યું કે કેટલાક ધારાસભ્યો પર ઈડીનું દબાણ છે.

અફઘાનિસ્તાનમાં 1000નાં મોત 6.1નો ભૂકંપ 1600 ઘાયલ



અફઘાનિસ્તાનમાં મંગળવારે મોડી રાત્રે આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે ૧૬૦૦થી વધુ લોકો ઘવાયા હતા. અનેકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. તાલિબાને સત્તા મેળવ્યા બાદ અનેક આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ અફઘાનિસ્તાન ખાલી કરી ચુકી છે જેને પગલે હાલ રેડક્રોસ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલી આવી રહી છે.



અંત સુધી ઉદ્ધવ ઠાકરે સાથે ઊભા રહીશું : પવાર

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCP ગઠબંધન સરકાર પરના સંકટ વચ્ચે શરદ પવારે મુંબઈમાં ચલ્હાણ સેન્ટરમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં શરદ પવારે નેતાઓને કહ્યું કે NCP મહાવિકાસ અઘાડી સાથે છે. છેલ્લી ઘડી સુધી લડશે. વિધાનસભામાં બહુમતી નક્કી થશે. ઉદ્ધવ ઠાકરે પાસે બહુમતી છે. સરકાર બચાવવા માટે તમામ પ્રયાસો કરશે. સંજય રાઉતના નિવેદન પર તેમણે કહ્યું કે તેમને જે કહેવું હોય તે (બળવાખોર ધારાસભ્યો) મુંબઈ આવીને બોલે. ઉદ્ધવ ઠાકરેએ પણ આ જ વાત કહી છે.

શિવસેનાના 17 સાંસદ પણ બળવાના મૂડમાં

એકનાથ શિંદે હજુ પણ અડગ છે અને આસામમાં પ-સ્ટાર ફોટલમાં બેઠા છે, જ્યાં તેમને મળતું સમર્થન પણ વધતુ જોવા મળી રહ્યું છે. શક્તિ પ્રદર્શનમાં શિવસેનાના ૩૫ અને અન્ય ૭ ધારાસભ્યો સાથે મળીને કુલ ૪૨ ધારાસભ્યો શિંદે સમૂહ સાથે જોવા મળ્યા હતા. જોકે હવે આશંકા છે શિવસેનાના સાંસદો પણ બળવાના મૂડમાં છે. શિવસેનાના ધારાસભ્યોની સાથે હવે સેનાના સાંસદોને પણ શિંદેનું સમર્થન મળી રહ્યું છે. હવે શિવસેનાના ૧૭ સાંસદોએ પણ શિંદેને સમર્થન આપ્યું છે. રિપોર્ટ અનુસાર ૧૭ સાંસદ એકનાથ શિંદેના સંપર્કમાં છે. ગુવાહાટીમાં થાણેના સાંસદ રાજન વિચારે હાજર છે. વસીમના સાંસદ ભાવના ગવલી, પલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, રામટેકના સાંસદ કૃપાલ, કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેને પણ પોતાનું સમર્થન આપ્યું છે. આ શક્તિપ્રદર્શન અને વધુ એક એમએલએ શિવસેનામાંથી તોડતા શિંદે આજે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

ABOWATH REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More info on PAGE 2 વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

✓ Residential
✓ New Condos
✓ Investments
✓ Commercial

દુશામાં ચાલે સખશો
Zakir Patel
Broker

Cell: 416-561-7973
Office : 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage

Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email : patelzakir82@gmail.com

છેલ્લા ૪૪ વર્ષથી ટોરન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

Need mortgage financing?
Look no further. Let me make it happen.

RBC Royal Bank

BHAVIN PATEL
Mobile Mortgage Specialist
Royal Bank of Canada

bhavin.patel@rbc.com
mortgage.rbc.com/bhavin.patel
Cell: 647-502-8069
Fax: 416-253-9461

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

ઈમિગ્રેશન માટે પડતર અરજીની સંખ્યા 2.4 મિલિયન થઈ ગઈ

એક્સપ્રેસ એન્ટ્રીની પ્રક્રિયા ઝડપી બનશે, જૂન સુધીમાં 522,047 વ્યક્તિઓની કાયમી રહેઠાણની અરજીઓ આવી

ઓન્ટેરિયો
IRCCનો ભરાવો વધીને 2.4 મિલિયન થઈ ગયો છે. પાછલા મહિનામાં ભરાવામાં 257,499 વ્યક્તિઓનો ઉમેરો થયો છે, જે મોટાભાગે અસ્થાયી રહેઠાણની અરજીઓમાં નોંધપાત્ર વધારાને કારણે છે. નાગરિકતાની યાદી માટે 1 જૂન સુધીમાં 394,664 અરજદારો હતા, જે 2 મેના રોજ 399,325 થયા હતા. 6 જૂન સુધીમાં 522,047 વ્યક્તિઓની

કાયમી રહેઠાણની અરજીઓ આવી છે. કામચલાઉ રહેઠાણની યાદી 6 જૂન સુધીમાં વધીને 1,471,173 વ્યક્તિઓની થઈ ગઈ છે. મીડિયાના અહેવાલો મુજબ 31 મેના રોજ ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ને આ નવા ડેટા માટે મીડિયાએ જ વિનંતી કરી હતી. તેને 15 જૂનના રોજ ડેટા મળ્યો હતો. IRCCએ રોગચાળા વચ્ચે ડિસેમ્બર 2020 માં FSWP અને



FSTP ઉમેદવારો માટેનો ડ્રો અટકાવી દીધો હતો અને સપ્ટેમ્બર 2021માં CEC ઉમેદવારો માટે પણ એમ જ કહ્યું હતું. તાજેતરના મહિનાઓમાં તેણે એક્સપ્રેસ એન્ટ્રી અરજીઓને અંતિમ

સ્વરૂપ આપવાને પ્રાથમિકતા આપી છે. જેથી તે જુલાઈની શરૂઆતમાં ત્રણેય કાર્યક્રમોના ઉમેદવારોને ફરીથી અરજી કરવા આમંત્રણ આપી શકાય. એકવાર આ ડ્રો ફરી શરૂ થઈ જાય પછી, IRCC એ છ મહિનાની અંદર મોટાભાગની એક્સપ્રેસ એન્ટ્રી અરજીઓ ઉપર પ્રક્રિયા કરવા માટે તેના પ્રી-પેન્ડેમિક સર્વિસ સ્ટાન્ડર્ડ ઉપર પાછા ફરવાનું વચન આપ્યું છે. ક્યૂબેકના કુશળ કામદારોની યાદી એપ્રિલના

અંતમાં 32,130ની સરખામણીમાં ઘટીને 27,146ની થઈ ગઈ છે. સ્થાનિક નોમિની પ્રોગ્રામ (PNP) અરજીઓ પણ 72,194 વ્યક્તિઓની સરખામણીએ ઘટીને 68,221 થઈ ગઈ છે. આ પહેલા કેનેડામાં લગભગ 90,000 ઉમેદવારોને કાયમી નિવાસ માટે અરજી કરવાની મંજૂરી આપવા માટે IRCC એ મે અને નવેમ્બર 2021ની વચ્ચે TR2PR પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું.

1983 પછી કેનેડામાં કુગાવાનો દર અત્યાર સુધીમાં સૌથી વધુ 7.7 ટકા

ખાદ્યપદાર્થોના ભાવો પણ ઉછાળા માટે એક મુખ્ય પરિબળ

ઓન્ટેરિયો
કેનેડાનો મે સુધીમાં કુગાવાનો દર લગભગ 40 વર્ષમાં તેની સૌથી ઝડપી ગતિએ વધ્યો છે. કારણ કે, લગભગ દરેક વસ્તુની કિંમતો ઝડપથી વધી રહી છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ બુધવારે અહેવાલ આપ્યો હતો કે, ગેસોલિનના ભાવમાં વધારો એ એક મુખ્ય પરિબળ છે. જેને કારણે કુગાવાનો દર 7.7 ટકા સુધી પહોંચ્યો છે. માત્ર મે મહિનામાં જ ગેસના ભાવમાં 12 ટકાનો વધારો થયો છે અને તે એક વર્ષ પહેલાની સરખામણીમાં

48 ટકા વધ્યો છે. ખાદ્યપદાર્થોના ભાવો પણ ઉછાળા માટે એક મુખ્ય પરિબળ હતું. જેને કારણે પાછલા વર્ષ કરતાં કરિયાણાના બિલમાં 9.7 ટકાનો વધારો થયો છે. ખાદ્ય કેટેગરીમાં, ખાદ્ય ચરબી અને તેલની કિંમત 30 ટકાએ પહોંચી હતી, જે સૌથી ઝડપી વધારો સૂચવે છે. યુકેન ઉપર રશિયાનું આક્રમણ એ આ ભાવવધારાનું મુખ્ય પરિબળ છે, કારણ કે યુકેન સૂર્યમુખી તેલના વિચ્છાન અગ્રણી સાધાચરોમાંનું એક છે અને યુદ્ધને કારણે એની અછત ઊભી થઈ છે. ટોરોન્ટો રેસ્ટોરન્ટ બર્ગર્સ એન ફાઈસ ફોરએવર ચલાવતા જમીલ ભુયા પણ આ વધારો અનુભવી રહ્યા છે.

કેનેડામાં પ્લાસ્ટિક શોપિંગ બેગ્સ, સ્ટ્રો અને અન્ય સિંગલ-યુઝ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકાશે

ઓન્ટેરિયો
કેનેડા સરકારે દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાની સમયરેખા જાહેર કરી છે. નિશ્ચિત ઉત્પાદનોમાં તબીબી ઉપરાંત અમુક અપવાદો સિવાય પ્લાસ્ટિક ચેકઆઉટ બેગ્સ, કટલરી, પીણાની બોટલો વહન કરવા માટે પ્લાસ્ટિક રિંગ્સ, ખોરાક વહેંચવા માટે રિસાયકલ કરવા મુશ્કેલ હોય એવાં કન્ટેનર અને સ્ટ્રોનો સમાવેશ થાય છે. આમાંનાં ઘણાં પ્લાસ્ટિકનાં ઉત્પાદન અને આયાત પરનો પ્રતિબંધ ડિસેમ્બર 2022થી અમલમાં આવશે. તેમના વેચાણ ઉપરનો પ્રતિબંધ એક



વર્ષ પછી ડિસેમ્બર 2023માં અમલમાં આવશે, જેથી રિટેલરોને તેમના સ્ટોક ખાલી કરવા માટે સમય આપવામાં આવે, એમ સરકારે જણાવ્યું હતું. ઉત્પાદન અને આયાત માટે જૂન 2023 સુધી અને વેચાણ માટે જૂન 2024 સુધી કંપનીઓને તેમની મેન્યુફેક્ચરિંગ

લાઈનમાં સંક્રમણ કરવાની મંજૂરી આપવા માટે પીણાની બોટલ ફરતે પ્લાસ્ટિકની રીંગ અને જ્યુસ બોક્સ સાથે જોડાયેલી સ્ટ્રો થોડો લાંબો સમય સુધી જોવા મળશે. પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી સ્ટીવન ગિલ્બેલ્ટે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “અમે કેનેડિયનોને વચન આપ્યું હતું કે, અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવીશું. આજે અમે એ કરી બતાવ્યું છે,” તેમણે આ પગલાંને પ્લાસ્ટિક પ્રદુષણ ઘટાડવા અને સમુદાયો અને ગમતાં સ્થળોને સ્વચ્છ રાખવા માટેનું એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.

ખંડની સંરક્ષણ સુવિધા અપગ્રેડ કરવા માટે કેનેડા \$ 5 બિલિયનનો ખર્ચ કરશે

આગામી બે દાયકામાં ખંડમાં અને ઉત્તરીય ભાગનાં સંરક્ષણમાં \$ 40 બિલિયનથી વધુ રોકાણ કરાશે

ટોરોન્ટો
કેનેડા આગામી છ વર્ષમાં ખંડનાં સંરક્ષણને આધુનિક બનાવવા માટે \$ 4.9 બિલિયનનો ખર્ચ કરશે, એમ સંરક્ષણ પ્રધાન અનિતા આનંદે સોમવારે જણાવ્યું હતું. મંત્રીએ ધ્વજ અને જૂના CF-18 જેટ ફાઈટરની પુષ્ટભૂમિમાં કહ્યું હતું કે, ઓન્ટેરિયોનાં ટ્રેન્ટનમાં કેનેડિયન સૈન્યના મુખ્ય એરબેઝ ઉપર NORAD અપગ્રેડ કરવાની લાંબા સમયથી રાહ જોવાતી હતી. હવે તે અંગે નક્કર નિર્ણય કરાયો છે. NORAD નવા જોખમોની સામે સતત અનુકૂળન સાધીને વિકસિત થયું છે. આજે અમે બીજું પૃષ્ઠ ખોલી રહ્યા છીએ અને NORADનું નવું પ્રકરણ શરૂ કરીએ છીએ,” ખર્ચનો આંકડો દાયકાઓ જૂના

સંયુક્ત દ્વિ-રાષ્ટ્રીય એર ડિફેન્સ કમાન્ડને ઓવરહોલ કરવાના ખર્ચમાં કેનેડાના હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે, જે મૂળરૂપે સોવિયેત બોમ્બર્સ પર નજર રાખવા માટે રચાયેલ છે. આ પ્રોજેક્ટ લિબરલ સરકારના 2017 સંરક્ષણ નીતિ દસ્તાવેજનો ભાગ ન હોવા છતાં યુનાઈટેડ સ્ટેટ્સ NORAD માટે ખર્ચના લગભગ 60 ટકાને આવરી લે છે. આ રકમ તાજેતરના ફેડરલ બજેટમાંથી બહાર આવવાની ધારણા છે, જેમાં સંરક્ષણ વિનિયોગમાં વધારા ઉપરાંત નવા ભંડોળમાં \$ 8 બિલિયન સુધી અલગ રાખવામાં આવ્યું છે, જેના માટે લિબરલ સરકાર પહેલેથી જ સંમત હતી. આ નાણાંમાંથી \$ 6 બિલિયન સુધી NORAD આધુનિકીકરણ સહિત વિવિધ યોજનાઓ માટે ફાળવવામાં આવ્યા હતા. અનિતા આનંદે વધુમાં જણાવ્યું હતું કે, આગામી બે દાયકામાં ખંડમાં અને ઉત્તરીય ભાગનાં સંરક્ષણમાં સરકારનું એકંદર રોકાણ \$ 40 બિલિયનનો આંકડો વટાવી જશે.

ટોરોન્ટોમાં મંકીપોક્સના 10 નવા કેસ મળ્યા

એક અઠવાડિયામાં ટોરોન્ટો શહેરમાં નોંધાયેલા 18 કેસમાં તમામ દર્દી પુરુષ

ઓન્ટેરિયો
ટોરોન્ટોમાં પબ્લિક હેલ્થ ઓન્ટેરિયોએ મંકીપોક્સના 10 નવા કેસ નોંધ્યા છે. એજન્સીએ કહ્યું હતું કે, સોમવાર સુધીમાં આ વિસ્તારમાં વાયરસના કુલ 33 કેસની પુષ્ટિ થઈ છે, અને તેમાંથી 28 કેસ ટોરોન્ટોમાં છે. શુક્રવારથી કેસમાં વધારો થયો છે, જ્યારે ટોરોન્ટો પબ્લિક હેલ્થ

શહેરમાં 18 કેસની પુષ્ટિ કરી છે. આ તમામ પુરુષ દર્દીઓ છે, જેની સરેરાશ ઉંમર 40 છે. પુરુષો સાથે જાતિય સંબંધ માણનારા પુરુષો સહિત વધુ જોખમ ધરાવતી વ્યક્તિઓને રોગપ્રતિરક્ષા આપવા માટે શહેર રસીકરણ ક્લિનિક્સનું આયોજન કરી રહ્યું છે. સામાન્ય રીતે મંકીપોક્સ લોકોમાં સરળતાથી ફેલાનારો રોગ નથી. એડ્રોપલેટ્સ દ્વારા, લાંબા સમય સુધી નજીકના સંપર્ક દ્વારા, ચામડીના જખમ અથવા શારીરિક પ્રવાહી સાથે સીધા સંપર્કને કારણે અથવા દૂષિત કપડાં કે પથારી દ્વારા ફેલાય છે.

THINKING OF BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ ની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.
મોર્ટગેજ જોઇએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER - TEAM LEADER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH
REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX
CROSSROADS REALTY INC.

#1 with ABOWATH your Local REALTOR

રોગચાળાના સમય દરમિયાન ઘરેથી કામ કરવાની તક મળતાં નાગરિકોને પરા વિસ્તારમાં ફાવટ આવી

પરા વિસ્તારમાં મકાનની માંગ વધવી ચિંતાજનક બાબત

રહેવા માટે મોટી જગ્યાની ઇચ્છાને કારણે ઘણા કેનેડિયનો પરાઓમાં મિલકતો શોધવા લાગ્યા

ઓન્ટેરિયો

કોવિડ-19 રોગચાળા દરમિયાન ડાઉનટાઉન રિયલ એસ્ટેટ અને ઉપનગરોમાં ઘરો વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઓછું થયું છે, જે શહેરોની આસપાસનાં બજારોની મંદી માટે વધુ સંવેદનશીલ બની શકે છે.

બેંક ઓફ કેનેડા દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા વિશ્લેષણમાંથી તે મુખ્ય ઉપાયોમાંનો એક છે, જેણે રોગચાળા પહેલા અને હવે દેશભરના 15 શહેરોમાં હાઉસિંગ વેલ્યુએશન ઉપર ધ્યાન આપ્યું છે. ઐતિહાસિક રીતે, ડાઉનટાઉનમાં

રિયલ એસ્ટેટનું બજાર ઊંચું હોય છે. કારણ કે, લોકો શહેરની સેવાઓ, સુવિધાઓથી આકર્ષાઈને જોબ માર્કેટની નજીક રહેવા માંગે છે. સેન્ટ્રલ બેંકના નીતિ સલાહકાર લુઈસ મોરેલે સોમવારે બહાર પાડેલી વિશ્લેષણાત્મક નોંધમાં જણાવ્યું હતું કે, આ પેટર્નમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન ફેરફાર થયા હોવાનું શક્ય છે. સામાન્ય રીતે પરા વિસ્તારમાં જીવતા લોકો માટે મોંઘું પરિવહન અને એને લગતી અસુવિધાઓ નુકસાનદાયી છે. પણ રોગચાળા દરમિયાન ઘરેથી કામ કરવાની સામૂહિક ચળવળ કારણે



ડાઉનટાઉનના રહેવાસીઓ વધુ ખૂલ્લી જગ્યા માટે પરાઓમાં જવા લાગ્યા હતા. મોરેલ નોંધે છે કે, ડાઉનટાઉનના

રહેવાસીઓ માટે ઘણી સેવાઓ, જેમ કે કોન્સર્ટ, રેસ્ટોરાં અને મનોરંજન, એક યા બીજા સ્વરૂપે બંધ કરવામાં આવી

હતી. “ઘરેથી કામ કરવું અથવા અભ્યાસ કરવું અને જાહેર આરોગ્ય પ્રતિબંધો વચ્ચે, લોકો પહેલા કરતાં વધુ સમય ઘરે વિતાવતા હતા. તેમણે કહ્યું કે, રહેવા માટે મોટી જગ્યાની ઇચ્છાને કારણે ઘણા કેનેડિયનો પરાઓમાં મિલકતો શોધવા લાગ્યા છે, જ્યાં મકાનો મોટા અને સસ્તા હોય છે.” રોગચાળા દરમિયાન ઘરની કિંમતો લગભગ બધે જ વધી ગઈ હતી, પરંતુ પરાઓમાં મકાનોની કિંમતમાં ખાસ વધારો થયો નહોતો, જેનો ફાયદો થતાં પહેલાં કરતાં ઓછી કિંમતે મકાનો ઉપલબ્ધ છે.

યુનાઇટેડ સિનિયર ગુજરાતી પરિવારની પિકનિક : ફિલ્મી ગીત-સંગીત ગૂંજ્યા



ઓન્ટેરિયો

ગત તારીખ ૧૮/૬/૨૨ના રોજ યુનાઇટેડ સિનિયર ગુજરાતી પરિવારની ત્રીજી પિકનિક ચિંકુધી પાર્કમાં યોજાતા ૬૫ સભ્યો જોડાયા હતા. આ વખતે પ્રથમ વખત જાતે ખીચડી બનાવવાની જાહેરાત ગ્રુપ સંચાલક અશ્વિન શાહ દ્વારા કરાઈ હતી.

જે માટે ગોપાલભાઈ પરીખ દ્વારા સંપૂર્ણ ખર્ચ સ્પોન્સર કરવા જાહેરાત કરાઈ હતી. પિકનિકની શરૂઆતમાં પ્રાતઃ સ્મરણ અને મંગલા ચરણનું ગાન થયા બાદ અશ્વિનભાઈ પટેલ અને દિલીપભાઈ પાઠક દ્વારા બનાવેલ મસાલા ચા અને કોફી સાથે શીલાબેન અગ્રવાલ, વિક્રલભાઈ શાહ, અને કંચન બેન પટેલ દ્વારા સ્પોન્સર ચેવડો, સમોસા, ચટણી

અને મોરી પાપડીનો નાસ્તો આપવામાં આવ્યો હતો. જે બાદ ફિલ્મી ગીત-સંગીત અને ડાન્સ તેમજ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરના લંચમાં પુરી, શાહી પનીર, રીંગણનું ભરથું, ગુલાબ જાંબું અને કટલેશ પીરસવામાં આવી હતી. અશ્વિનભાઈ પટેલ દ્વારા ગ્રુપમાં મ્યુઝિક સિસ્ટમ લાવવાનો પ્રસ્તાવ મુકાતા જ સભ્યોએ ફાળો નોંધાવવાની વ્યવસ્થા ગોઠવવા અપીલ કરાઈ હતી. બાદમાં ખીચડી અને છાસ તૈયાર કરાયા હતા. આ સાથે ગીતાબેન પરીખ દ્વારા લાવવામાં આવેલી પાપડ, પાપડી અને ખારેકનું અથાણું પીરસવામાં આવ્યું હતું. અશ્વિન શાહે કાર્યક્રમમાં સહયોગ આપનારા તમામનો આભાર માની ૩૦/૬ના કાર્યક્રમ અંગે વિગતો આપી હતી.

IFAનો માતૃભૂમિ પ્રેમ, આરોગ્ય સુવિધા અને શાળા માટે 2.50 લાખ ડોલરનું દાન

ચોટીલામાં શાળા માટે 12 લાખનું દાન અપાયું, બ્રામ્પ્ટનમાં 11,505 કેનેડિયન ડોલર એકત્ર

બ્રામ્પ્ટન

ઈન્ડિયન ફેમિલી એસોસિએશન ઓફ કેનેડાની સ્થાપના બ્રેમ્પ્ટનના નિવાસી જયેશભાઈ બ્રહ્મભટ્ટના પ્રયાસોથી જાન્યુઆરી-2018માં થઈ હતી. જે IFA તરીકે પણ ઓળખાઈ છે. સંસ્થાના હાલમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલા આગેવાન ચંદાએ ગણેશ સ્તુતિ તથા સરસ્વતિ વંદના કરી, જ્યારે અજીત પટેલે શરૂઆતમાં મીમીક્રીથી મહેમાનોને આનંદિત કર્યા હતા.

વધુમાં બ્રેમ્પ્ટન સીટીના રીજીયોનલ કાઉન્સેલર ગુરપ્રિત ધીલ્લોન ખાસ હાજર રહ્યા હતા. આ સાથે IFAને સ્મૃતિ ચિહ્ન તરીકે પ્રમાણપત્ર આપવા સાથે સંસ્થાની અદભૂત સામાજિક સેવાને તેમણે બિરદાવી હતી. નવલ બજાજે પણ પ્રવચન કરી IFAને અભિનંદન આપ્યા હતા. જે બાદ જયેશભાઈએ જણાવ્યું હતું કે, મહામારી દરમિયાન સંસ્થાએ જરૂરિયાતમંદોને અનાજ અને ખોરાકની સુવિધા પૂરી પાડી હતી. 2021ની 1લી જુલાઈએ હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદીના Facebook Page ઉપર ચોટીલાના નાવાગામ ખાતે મદારીઓના આવાસોમાં રહેતા બાળકોને શિક્ષણ લેવા માટે નવી શાળા માટે ટહેલ નંખાઈ હતી. જે બાદ જયેશભાઈ બ્રહ્મભટ્ટ અને IFA દ્વારા પ્રયત્નોથી 13 દિવસમાં 26,000 કેનેડિયન ડોલરનો ફાળો ભેગો થયો હતો. જગદીશભાઈ ત્રિવેદીએ 50મા જન્મદિવસથી પોતાની તમામ કમાણી જરૂરિયાત વિસ્તારમાં સ્કૂલો માટે તથા આરોગ્ય સુવિધા માટે માટે ઊર્મિ સરોજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખર્ચ કરવાની શરૂઆત કરી છે. આ વર્ષે ડૉ. જગદીશભાઈ ત્રિવેદીના નોર્થ અમેરિકાના પ્રવાસ દરમિયાન



30 કાર્યક્રમો નક્કી થયા છે. તા. 10-6-2022ના રોજ પ્રથમ કાર્યક્રમ બ્રામ્પ્ટન (કેનેડા)માં યોજાયા બાદ અન્ય 2 કાર્યક્રમ ગલ્ફ અને ક્રીકેટ (બંને કેનેડામાં) યોજાનાર છે. બ્રામ્પ્ટનમાં યોજાયેલા કાર્યક્રમની 11,505 કેનેડિયન ડોલરની આવક INR Rs. 7 લાખ ચાઈલ્ડ માલવ્યુટીશન ટ્રીટમેન્ટ સેન્ટર, પાટડી (દશાડા) ખાતે ખર્ચાશે. તે સાથે અન્ય IFAના સભ્ય પૂર્વેશ પટેલ (પેડી) એ ડાંગ વિસ્તારમાં જ્યાં તેઓની માતાએ શિક્ષિકા તરીકે ફરજ બજાવેલી, ત્યાં તેમના નામે સ્કૂલ બાંધવા મધર્સ ડેના દિવસે રૂ. 20 લાખનું દાન જાહેર કર્યું હતું. આ સાથે જ ભવિષ્યમાં જયેશભાઈ બ્રહ્મભટ્ટના માતા-પિતાની નામની શાળા માટે જાહેરાત કરાઈ છે. આઈફા અને કેરોકે ક્લબ કેનેડાના પ્રયત્નોથી ટૂંક સમયમાં 1,70,000 કેનેડિયન ડોલર સાથે ઊર્મિસરોજ ચેરીટેબલ ટ્રસ્ટના 80,000 કેનેડિયન ડોલર થકી કુલ 2,50,000 કેનેડિયન ડોલર (રૂ. દોઢ કરોડ) 4 શાળા અને 1 આરોગ્યપ્રદ સેવા માટે ખર્ચાયા છે. કાર્યક્રમનું સંચાલન પથિક શુક્લાએ કર્યું હતું.

કામદારોની તંગીની સમસ્યા : અનુભવ વિનાના યુવાનોને પણ રાખવા નોકરીદાતાઓની તૈયારી

ઉમેદવારનું જ્ઞાન અને કૌશલ્યોને બદલે તેના શીખવાનાં વલણને ધ્યાનમાં રખાશે

ટોરોન્ટો

કેનેડામાં કામદારોની તંગીને કારણે કેનેડિયન નોકરીદાતાઓ હવે અનુભવ વિનાના કામદારોને પણ નોકરી પર રાખવા તૈયાર થઈ રહ્યા છે તેવું તારણ તાજેતરના એક સરવેમાં નોંધાયું છે. હાલમાં બહાર પાડવામાં આવેલો અહેવાલ સૂચવે છે કે, અનુભવ અને શિક્ષણ એ એક સમયે ઘણા હોદ્દાઓ માટે જરૂરી ગણાતા હતા. પરંતુ મજૂરની અછતને કારણે એનું મહત્વ ઘટી રહ્યું છે. આ તારણો સમગ્ર કેનેડામાં 1,000 એમ્પ્લોયરોનાં ઓનલાઈન સર્વેક્ષણ ઉપર આધારિત છે, જે મે મહિનામાં સેન્સસવાઈડ દ્વારા ઈન્ડીડ, જોબ લિસ્ટિંગ માટેની એમ્પ્લોયમેન્ટ વેબસાઈટ દ્વારા કરવામાં



આવ્યું હતું. સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, 77 ટકા કેનેડિયન નોકરીદાતાઓ સંબંધિત જ્ઞાન અને કૌશલ્યોને બદલે ઉમેદવારના હળવાં કૌશલ્યો અને શીખવાનાં વલણના આધારે ઉમેદવારની ભરતી કરવા ઈચ્છે છે. છે. પાંચમાંથી ચાર એમ્પ્લોયરો કહે છે કે, તેમની કંપની નોકરી સંબંધિત ડિગ્રી અથવા પ્રમાણપત્ર ધરાવતા ન હોય, તેવા અરજદારોને નોકરી ઉપર રાખવાનું

વિચારશે. ઉપરાંત નવા કામદારોને નોકરી ઉપર તાલીમ પણ આપશે. સર્વેક્ષણ સૂચવે છે કે, નોકરીદાતાઓ ઉમેદવારોને શોધવાના પડકારોમાં સંબંધિત અનુભવની જરૂરિયાતને છોડવા પણ તૈયાર છે. ઈન્ડીડના રિરેક્ટર મિશેલ સ્લેટરે જણાવ્યું હતું કે, “અમે અત્યાર સુધીમાં સૌથી મોટા પ્રમાણમાં કામદારોની તંગીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ.” કેનેડાનો બેરોજગારી દર મે મહિનામાં ઘટીને 5.1 ટકા થયો હતો, સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો. તે ઓછામાં ઓછા 1976 પછીનો સૌથી નીચો દર છે, જે તુલનાત્મક રીતે ઘણો ઓછો છે.

ડાઉનટાઉન મોન્ટ્રીયલમાં પાસપોર્ટ મેળવવા મોડી રાતથી જ લાંબી કતાર

લીડ ઉપર કાબુ મેળવવા માટે પોલીસને બોલાવવામાં આવી

ટોરોન્ટો

મંગળવારે મોન્ટ્રીયલમાં પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો રાતથી જ લાઈનો લગાડીને ઊભા રહી ગયા હતા. આ ભીડ ઉપર કાબુ મેળવવા પોલીસને બોલાવાઈ હતી.

કેટલાક લોકો માટે પાસપોર્ટ મેળવવા માટેની પ્રતિક્ષા કલાકોથી લંબાઈને દિવસો સુધી પહોંચી ગઈ છે. સોનિયા બાસિલીએ એપ્રિલમાં પોતાના પુત્રની પાસપોર્ટની અરજી પડતી મૂકી હતી. મંગળવારે મોન્ટ્રીયલ ઓફિસની બહાર બેઠેલી સોનિયાએ કહ્યું હતું કે, તે અને તેનો પરિવાર સાંજે 6 વાગ્યાથી બીજા દિવસ સુધી લાઈનમાં ઊભા હતા. પણ એમની પાસે એના સિવાય કોઈ વિકલ્પ નહોતો.

તેની ફાંસની ફ્લાઈટ બુધવારે રાતની હતી. બાસિલીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, “મારી મમ્મી અહીં બેઠી, પછી મારા પતિ અહીં સૂઈ ગયા હતા. અમે આજે સવારે અંદર ગયા, ત્યારે અંદર બધું ખૂબ જ અવ્યવસ્થિત હતું. અમે લાંચ ન આપી, તેથી અમારે પાછા આવી જવું પડ્યું. હવે અમે રાત્રે અહીં જ સૂઈ જઈશું અને કાલે સવારે જઈશું.” તે સકારાત્મક છે અને કહે છે કે તે ભાગ્યશાળી છે કે તેના પરિવારના સભ્યો જરૂર પડ્યે તેમને સાથ આપે છે. બીજાઓને આ ફાયદો મળતો નથી. બેસિલી કહે છે કે તેણે લાઈનમાં ઊભા રહેવા માટે કામમાંથી રજા પણ લેવી પડી હતી. બેસિલી એમ પણ કહ્યું કે, “જ્યારે આપણે અંદર જઈએ ત્યારે શું થાય છે? શું આપણું કામ થશે કે પછી આજે પણ આપણે બહાર અટકી જઈશું અને બીજા દિવસે પણ આપણે ફરીથી બહાર સૂવું પડશે?”

તંત્રી સ્થાનેથી

શિંદેના બળવા સાથે મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારને માથે મહાસંકટ

ભારતીય રાજકારણમાં છેલ્લાં દોઢ-બે દાયકામાં આમૂલ પરિવર્તન આવ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ આમ તો સિદ્ધાંતો અને આદર્શોની વાતો કર્યા કરે છે. પરંતુ મોટાભાગની રાજકીય પાર્ટીઓએ આજે તેના આદર્શો સિદ્ધાંતોને કારણે મુકી દીધા છે.



તંત્રી - પ્રકાશક સ્વદેશ

કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતા ભાજપમાં જ આજે અનેક કોંગ્રેસીઓ સામેલ થઈ ગયા છે. શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે ખરા અર્થમાં હિન્દુ હૃદયસમ્રાટ હતા. હિન્દુત્વનાં મોજાં પર સવાર થઈને તેમણે શિવસેનાને સત્તાના સિંહાસન સુધી પહોંચાડી હતી. તેનું ભાજપ સાથેનું ગઠબંધન પણ હિન્દુત્વના પાયા પર હતું.

2019માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે શિવસેના અને ભાજપ યુતિને બહુમતિ મળી. પરંતુ તે પછી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ જેવા મુસ્લિમતરફી પક્ષો સાથે ગઠબંધન કર્યું તેને કારણે જૂના શિવસૈનિકો સખત નારાજ હતા. તે વખતે ઠાકરેનું કહેવું હતું કે, ભાજપે શિવસેનાના વિજેતા ઉમેદવારને મુખ્યમંત્રી બનાવવા વચન આપ્યું હતું. પરંતુ ચૂંટણી જીત્યા બાદ ભાજપ તેના વચનથી ફરી ગયો છે. આ ઘટના બાદ સતત અઢી વર્ષથી ઉદ્ધવ ઠાકરેની સરકાર ચાલી રહી હતી.

પરંતુ ઠાકરેના આ વલણથી શિવસૈનિકો અને ખાસ કરીને શિવસેનાના ધારાસભ્યો નારાજ હતા. તેમને પ્રતીતિ થઈ ગઈ હતી કે જો આ ગઠબંધન ચાલુ રહ્યું તો આગામી ચૂંટણીઓમાં શિવસેનાનું ધોવાણ થઈ જવાનું છે. આ કારણે બાળ ઠાકરેને પોતાના ભગવાન માનતા નેતા એકનાથ શિંદેના બળવાથી મહાવિકાસ અઘાડી સરકાર હચમચી ગઈ છે.

શિવસેનાની નેતાગીરી સામે બળવો કરીને 44 વિધાનસભ્યોનો સાથ મેળવી લેનારા એકનાથ શિંદે થાણેના ગ્રાસરૂટ સ્તરના નેતા છે. એક શિસ્તબદ્ધ સૈનિકની જેમ તેમણે ક્યારેય નેતાગીરી સામેનો પોતાનો અસંતોષ જાહેરમાં વ્યક્ત કર્યો નહોતો. ઓટો રીક્ષા ડ્રાઈવરથી મહારાષ્ટ્રના શહેરી વિકાસ ખાતાના પ્રધાન તરીકેની કારકિર્દી વિકસાવનારા એકનાથ શિંદે થાણેના પ્રખર મરાઠી નેતા આનંદ દિવેના વિશ્વાસુ હતા. તેમને રાજકારણમાં લાવનારા પણ આનંદ દિવે જ હતા. એકનાથ શિંદે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પણ વિશ્વાસુ હોવાથી તેમને કમાઉ દીકરા જેવું શહેરી વિકાસ ખાતું ફાળવવામાં આવ્યું હતું. તેઓ શિવસેનાના ખજાનચીની ભૂમિકા ભજવી રહ્યા હોવાથી ઘણા વિધાનસભ્યો તેમના સંપર્કમાં હતા, જેનો ઉપયોગ કરીને તેમણે બગાવતનું બ્યૂગલ ફૂંક્યું હતું.

એકનાથ શિંદે પ્રામાણિકતાથી માનતા હતા કે, શિવસેનાએ શરદ પવારના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષ સાથે ગઠબંધન કર્યું ત્યારથી તેના ભાતીગળ મતદારો તેનાથી નારાજ છે. તેનો પડઘો તાજેતરમાં યોજાયેલી રાજ્ય સભાની અને વિધાનપરિષદની ચૂંટણીઓમાં જોવા મળ્યો હતો. આ બંને ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો હતો અને શિવસેનાની બાજી ઊંધી વળી ગઈ હતી. તેને પગલે મહાવિકાસ અઘાડીની સરકાર લઘુમતીમાં મૂકાઈ ગઈ હતી. એકનાથ શિંદેએ અનેક વાર ઉદ્ધવ ઠાકરેને મળીને પોતાની આ ચિંતા ખાનગીમાં વ્યક્ત કરી હતી. જો કે, ઠાકરે શિંદેની વાત સાંભળવા તૈયાર નહોતા.

એકનાથ શિંદેને બીજો વાંધો એ વાતનો હતો કે પર્યટન ખાતાના પ્રધાન અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે તેમના ખાતામાં વધુ પડતો હસ્તક્ષેપ કરતા હતા. તેમણે અધિકારીઓને કહી રાખ્યું હતું કે મોટા બજેટની ફાઈલો મને પૂછ્યા વિના સાઈન કરવી નહીં. ઘણો વહીવટ બારોબાર કરવામાં આવતો હતો. ઘણા વિધાનસભ્યો શિંદેના ઘરની બહાર ભંડોળની ફાળવણી માટે લાઈન લગાવતા, પણ તે સત્તા તેમને આપવામાં આવતી નહોતી. ભંડોળ તેઓ એકઠું કરતા, પણ ફાળવણી બીજા કોઈને જ સોંપવામાં આવી હતી.

રાજ્ય સભાની અને વિધાનપરિષદની ચૂંટણી માટે ઉમેદવારો ઊભા રાખવાની પ્રક્રિયાથી પણ તેમને દૂર રાખવામાં આવ્યા હતા. એકનાથ શિંદે માનતા હતા કે, આવનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં અને 2024ની લોકસભાની ચૂંટણીઓમાં સારો દેખાવ કરવો હશે તો ભાજપ સાથે ગઠબંધન કરવું પડશે. આ કારણે જ તેમણે પહેલી વખત નેતાગીરી સામેના બળવાની આગેવાની લીધી છે. એકનાથ શિંદેના રાજકીય ગુરુ અને મેન્ટર આનંદ દિવે ઠાણેના બેતાજ બાદશાહ હતા. તેઓ બાળ ઠાકરે જેવું આક્રમક વ્યક્તિત્વ ધરાવતા હતા. ઠાણેમાં તેઓ સમાંતર સરકાર ચલાવતા હતા. તેમના ઘરમાં જનતા દરબાર ભરાતો હતો, જેમાં લોકોના પ્રશ્નો ચપટી વગાડતાં હલ કરવામાં આવતા હતા. આનંદ દિવેની નજર યુવાન એકનાથ શિંદે પર પડી હતી. તેમણે શિંદેને 1997માં થાણે મહાનગરપાલિકાની ચૂંટણી લડાવી હતી. તેઓ પહેલાં નગરસેવક બન્યા અને પછી ગૃહમાં શિવસેનાના નેતા બન્યા હતા. 2004માં તેમને ઠાણેના પાંચપખાડી વિસ્તારમાંથી વિધાનસભાની ટિકિટ આપવામાં આવી હતી. જે બાદ તેઓ સતત ત્રણ સત્રથી વિધાનસભામાં ચૂંટાતા આવ્યા છે. 55 પૈકી 44 વિધાનસભ્યોના બળવાને કારણે ઠાકરે સરકાર લઘુમતીમાં મૂકાઈ ગઈ છે. જો કે, શરદ પવાર અને કોંગ્રેસ તરફથી હજી પણ ઠાકરેને તેમના ધારાસભ્યોને મનાવવા તક અપાઈ છે.

પરંતુ બીજી તરફ એકનાથ શિંદેની ભાજપ સાથે ગઠબંધન કરવાની છે. તેથી ઠાકરેનો સ્વભાવ જોતાં તેઓ કોઈ પણ સંજોગોમાં ભાજપના શરણે જવાનું પસંદ કરશે નહીં. આવા સંજોગોમાં લઘુમતીમાં મુકાયેલી ઠાકરે સરકારને રાજ્યપાલ તરફથી ફ્લોર ટેસ્ટ માટે કહેવાઈ શકે છે. આ ઉપરાંત બીજી શક્યતા ઠાકરે ગવર્નરને વિધાનસભાનું વિસર્જન કરવાની સલાહ આપી શકે છે. જો કે, ભાજપ પોતાના 106 ઉપરાંત શિવસેનાના બળવાખોર 44 અને બીજા અપક્ષ સભ્યોનો ટેકો લઈને સરકાર રચવાનો દાવો પણ કરી શકે છે. જો તેમ થાય તો એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન પણ બની શકે છે. વિધાનસભાની ચૂંટણીને બે વર્ષ કરતાં વધુ સમય બાકી હોવાથી ભાજપ ચૂંટણી ઈચ્છતો નથી. ગુરુવારે દિવસ દરમિયાન પણ શિવસેનાના બાગી નેતાઓને મનાવવા સાથે ઠાકરે જૂથ દ્વારા રાજકારણ ખેલાતુ રહ્યું પરંતુ સાંજ સુધી સ્થિતિ થાણે પડી ન હતી. શિંદે અને તેના સમર્થક સભ્યો ગોહાટીની હોટલમાં રાકાયા છે ત્યાં બીજી બાજુ ઠાકરે જૂથે શિવસેનાના ધારાસભ્યોની તાકીદની બેઠક બોલીવી છે અને તેમાં ગેરહાજર રહેનાર સભ્યો સામે કાર્યવાહીની ચીમકી પણ આપી છે. ઠાકરે જૂથની ચીમકી બાદ શિંદે જૂથે પણ એક ચીટ્ટી લખીને ઠાકરે સરકારના વહિવટ પર આક્ષેપો કર્યા હતા.

જોગ ગાંધી

manoj1968@yahoo.ca

ARISTO PEST CONTROL

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com

✓ Mice

✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL

✓ Cockroach

✓ Bedbug

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI

✓ Animal Control

✓ Bird Control

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates

CALL SANKET TRIVEDI - 647.339.3926

Government Licensed Structural Exterminator

DIVINE YOGA

By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!

: Classes Available :

One to One Individual and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta

14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરનાર હેવાનને 10 વર્ષની સખત કેદની સજા

ક્રિષ્ના છોટેલાલે બદનામ કરવાની ધમકી આપી કિશોરી પર બે-ત્રણ વાર અત્યાચાર ગુજાર્યો હતો : રૂપિયા 1 લાખ વળતર આપવા નિર્દેશ

સુરત

આજથી ત્રણ વર્ષ અગાઉ 14 વર્ષની કિશોરીની ઈચ્છા, સંમતિ વિરુદ્ધ શરીર સંબંધ બાધી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસ સુરતની પોક્સો કોર્ટમાં ચાલી જતા વિશેષ ન્યાયાધીશ દિલીપ પી. મહિડાએ આરોપી ક્રિષ્ના યાદવને દસ વર્ષની સખત કેદની સજા અને રૂ.20 હજારનો દંડનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે સુરત નજીકના વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 14 વર્ષની સગીર વયની દિકરી ઘરે એકલી હતી. ત્યારે આરોપી ક્રિષ્ના છોટેલાલ યાદવ (ઉ.વ.27) ઘરે આવ્યો હતો. અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાધી

ધમકી આપી હતી કે કોઈને વાત કરતી નહીં. અને તું જો તારા માતા પિતાને વાત કરશે તો હું તમને બદનામ કરી દઈશ. આવી ધમકી આપી બેથી ત્રણ વખત તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાધ્યા હતા. આ અગે તેણે પિતાને જાણ કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બચાવ અને ફરિયાદ પક્ષની દલીલો બાદ કોર્ટે આરોપી ક્રિષ્ના યાદવને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.20 હજારનો દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. સાથે જ અપીલ પીરીયડ બાદ ભોગ બનનાર તરૂણીને રૂ.1 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને નિર્દેશ આપ્યો છે.

કતારગામના રત્નકલાકારના અંગદાનથી 5 વ્યક્તિને નવજીવન અને રોશની મળી

સુરત

ભાવનગરના વલ્લભીપુરના મોણપુર ગામનો વતની કતારગામમાં અવધુતનગર પાસે હરી કિષ્ન એપાર્ટમેન્ટમાં રહેતો 36 વર્ષીય પૃથ્વીરાજસિંહ રાયસંગભાઈ ચૌહાણ ગત તા. 15મી મિત્ર સાથે ઢાંડી ખાતે ફરવા ગયા હતા. જોકે તે બાઈક પર ઘરે આવવા નીકળ્યો હતો. તે સમયે જહાંગીરપુરાના સિલ્વર સ્ટોન વિલા પાસે બાઈક સ્લીપ થતા પૃથ્વીરાજસિંહને ઈજા થતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં સીટી સ્કેનમાં તેમના મગજમાં લોહીનો ગટ્ટો જામી ગયો હોવાનું નિદાન તથા બાદ તા.17મી ઊંચન

ડેડ જાહેર કરાયા હતા. ડોનેટ લાઈફના સંપર્ક બાદ તેમના પરિવારે અંગદાનની સંમતી આપી હતી.

કિડની નવસારીમાં રહેતો 19 વર્ષીય યુવતીને, બીજી કિડની સુરતમાં રહેતા 22 વર્ષીય યુવાનને તથા લીવર સુરતમાં રહેતા 67 વર્ષીય વડિલને સુરતની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. દાનમાં મળેલા ચક્ષુ બે જરુરીયાતમંદને ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. પૃથ્વીરાજસિંહ કતારગામની ડાયમંડ ફેક્ટરીમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. પરિવારમાં પત્ની સોનલબેન, સંતાનમાં બે પુત્રમાં ભવદીપસિંહ (ઉ.વ-15) ધો. 10માં અને હિરેનસિંહ (ઉ.વ-13) ધો.8માં અભ્યાસ કરે છે. તેમના પિતા રાયસંગભાઈ ખેતીકામ કરે છે.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

1 Spray Services 2 Fogging Services 3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets

First Time Customer gets
10% Off
on your first home service
*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા કચોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)
\$9.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)
\$7.50 +Tax



CATERING SPECIAL

\$ 14.99 10 items
+Tax
Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise Opportunity in GTA

Call us for details

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

વડોદરામાં જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે રાતે ઘરે આવતા પરિવાર ચોંકી ઉઠ્યો

લાશની ઓળખમાં પરિવારજનો મોટી થાપ ખાઈ જતા ગોટાળો, પોલીસ દોડતી થઈ

વડોદરા

દુમાડ ચોકડી અને જીએસએફસી વચ્ચેથી મળેલી અજાણી લાશની ખોટી ઓળખ થતા તેના સગા સંબંધીઓને લાશનો કબજો સોંપી દેવામાં આવ્યો હતો. સંબંધીઓએ અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ ગયા હતા. તે જીવિત પરત આવતા ચક્રચાર મચી ગઈ છે.

ગત તા. ૧૬ મી એ છાણી પોલીસને એક અજાણ્યા પુરૂષની લાશ દુમાડ ચોકડીથી જી. એસ. એફ. સી. તરફ

જતા નેશનલ હાઈવે પર સર્વિસ રોડના થાંભલા પાસેથી મળી આવી હતી. તેના શરીર પર ઈજાના કોઈ નિશાન નહતા. પોલીસે ૪૫ વર્ષના અજાણ્યા મૃતકની લાશ પી. એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. અજાણ્યા પુરૂષની લાશની ઓળખ માટે પોલીસે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. તે દરમિયાન વાઘોડિયાના સોમેશ્વરપુરા ગામમાં રહેતા શનાભાઈ સોલંકીએ છાણી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

અને અજાણી લાશને જોઈને પોલીસને કહ્યું હતું કે, આ લાશ મારા પુત્ર સંજય (ઉ. વ. ૪૯) ની છે. પોલીસે આધાર કાર્ડ ચેક કર્યા પછી તેમજ મૃતકના આ કહેવાતા પિતા તથા અન્ય સંબંધીઓને આ લાશ સોંપી હતી. અને સંબંધીઓએ લાશના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. સંજય સમજીને જેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. તે સંજય રાતે ઘરે પરત આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. અને તરત છાણી પોલીસનો સંપર્ક કર્યો હતો.

પાટણ ખાતે ડિરેક્ટરની બેઠક ઉપર BJPના સ્નેહલ પટેલની 4 મતથી જીત

પાટણ

શરૂઆતથી જ વિવાદોમાં રહેલી ગુજકોમાસોલની પાટણ જિલ્લાની ડિરેક્ટરની બેઠક માટે યોજાયેલી ચુંટણીમાં ભાજપના સ્નેહલ પટેલનો વિજય થતાં ભાજપના આગેવાનો, કાયકરોમાં ખુશી છવાઈ જવા પામી હતી. ગુજકોમાસોલની પાટણ જિલ્લાની બેઠક માટે યોજાયેલી ચુંટણીમાં ભાજપ દ્વારા સ્નેહલ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું તેની સામે ભાજપના જ રાજુ કટારીયા દ્વારા પાર્ટીની ઉપરવટ જઈને પોતાની ઉમેદવારી નોંધાવતા તેઓને તાત્કાલિક અસરથી પાર્ટી માંથી બરતરફ કરવામાં આવ્યા હતા.



ત્યારે રવિવારનાં રોજ યોજાયેલી ગુજકો મા સોલની પાટણ જિલ્લાની ડિરેક્ટર માટેની ચુંટણીમાં ભાજપનાં મેન્ડેટ પરથી ઉમેદવારી નોંધાવેલ સ્નેહલ પટેલને ૧૬ મતો પ્રાપ્ત થયા હતા. જ્યારે રાજુભાઈ કટારીયાને ૧૨ મતો મળતા સ્નેહલ પટેલનો ૪ મતોથી વિજય થયો હતો.

આબુ શાંતિવન ખાતે અખિલ ભારતીય સંત સંમેલન યોજાયું

ડીસા

આબુ તળેટી શાંતિવન ખાતે યોજાયેલ ત્રિદિવસીય અખિલ ભારતીય સંત સંમેલનમાં બ્રહ્માકુમારીજના વડા દાદી રતન મોહીનીજીએ અનુયાયીઓને આશીર્વાચન આપ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, માનવ માત્રના પિતા પરમાત્મ શક્તિ દ્વારા એક વિશ્વ એક પરિવારની ભાવનાને સાકાર કરવા દેશ ભરના સંતો, ધાર્મિક વડાઓ, યોગીઓ ભેદભાવ ભૂલી એક પરમાત્મ મહાશક્તિના ઝંડા નીચે ભારતને ફરી વિશ્વ ગુરૂ બનાવવા અનુરોધ કર્યો હતો. આ સંત સંમેલનમાં દેશભરના મહામંડલેશ્વરો ધર્મ પીઠાધીશો, સંતો મહાત્માઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનને પ્રધાનમંત્રી તથા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા શુભ સંદેશ પાઠવ્યો હતો.

દુધસાગર ડેરીના વિવાદમાં ભાજપનો બહિષ્કાર કરવાની ચેતવણી, પૂર્વ વાઈસ ચેરમેનના સમર્થનમાં બેનર લાગ્યા

મહેસાણા


મહેસાણાની દૂધ સાગર ડેરીની 14 જૂને યોજાયેલી સાધારણસભા અગાઉ ડેરીના ગેટ ઉપર પૂર્વ વાઈસ ચેરમેનના પ્રવેશ મુદ્દે ઘર્ષણ થયું હતું. જેમાં સિક્યુરીટી હેડને ગોળી વાગતા હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે હત્યાની કલમ દૂર કરવા પૂર્વ વાઈસ ચેરમેન મોંઘજીભાઈના સમર્થનમાં વિસનગર તાલુકામાં ભાજપનો વિરોધ કરતા બેનરો લગાવવામાં આવ્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના મત વિસ્તાર ખરવડા ગામમાં બેનરો લગાવી સીધી ભાજપ સાથે બાથ ભીડતા હોય તેમ ચેતવણી ઉચ્ચારી છે. આ બેનરમાં ભાજપ પાર્ટીનો ઉલ્લેખ કરી સ્પષ્ટતા



કરી છે કે, 20 વર્ષથી આ ગામે 90 ટકાથી વધુ વોટ ભાજપને આપતું આવ્યું છે. અને દૂધ સાગર ડેરીમાં મોંઘજીભાઈ ઉપર હુમલો કરનારાની ધરપકડ નહી થાય તેમજ તેમના પુત્ર હર્ષદ ઉપર લગાવેલી આઈપીસી 307ની કલમ રદ નહી થાય

તો સમસ્ત ગામ ભાજપનો બહિષ્કાર કરશે અને તેનું પરિણામ આવનારી ચુંટણીઓમાં ભાજપને ભોગવવાનો વારો આવશે.

ડેરીની ચુંટણી બાદ વિપુલ ચૌધરીએ જામીન પર છૂટીને અર્બુદા સેનાની રચના કરી ડેરીના વહિવટ મામલે જાહેરસભાઓ શરૂ કરી હતી. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને નિશાન બનાવી રાજકારણમાં સક્રીય થયા હતા. વિધાનસભાની ચુંટણીમાં ઋષિકેશ પટેલને હરાવવા માટે વિપુલ ચૌધરીએ તૈયારીઓ શરૂ કરી હોય તેમ એક પછી એક કાર્યક્રમો આપીને ડેરીના ચેરમેન અશોક ચૌધરી બાદ ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં ગાબડું પાડવાનું કામ કરી રહ્યા છે.



UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW

ZIVASA
Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana
Broker

આધ્યાત્મિક - સાંસ્કૃતિક ધરોહર ફરી જીવંત થશે : મોંઘી

પાવાગઢના કાલીકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણ, 700 ખેલૈયાઓએ પીએમનું સ્વાગત કર્યું

હાલોલ

શક્તિપીઠ પાવાગઢમાં કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, સદીઓ પછી મા કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણને સૌને નવી પ્રેરણા અને ઊર્જા તો આપે છે, પરંતુ સાથે સાથે આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમપત ભાવથી જીવવા પ્રેરિત પણ કરે છે. અયોધ્યા, કાશી કે કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે.

આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે અનેક વર્ષો બાદ પાવાગઢનું સૌભાગ્ય

મળ્યું છે. મારું જીવન ધન્ય થઈ ગયું. સપનું સંકલ્પ બનતું હોય અને તે સિદ્ધ થતું હોય તો આનંદ થાય છે. ઊર્જા આપે છે, અને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમપત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. આજથી થોડા દિવસ બાદ આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢમાં મહાકાળીનું મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની આ જ વિશેષતા છે. ગુપ્ત નવરાત્રિ છે, પણ શક્તિ સુખ અને લુપ્ત થતી નથી. જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે. પાવાગઢમાં મા કાળીના આશીર્વાદથી આ જ શક્તિનું પ્રાગટ્ય જોઈ રહ્યાં છીએ.

સદીઓ બાદ મહાકાળીનું આ મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે આપણા મસ્તિષ્કને ઉચ્ચ કરે છે.

પાવાગઢ કાલીમાંના દર્શન, મહિલા લાભાર્થીઓની પ્રશંસા, ગુજરાતની સંસ્કૃતિ અને વિકાસ ગાથા દરમિયાન લોકો દેશભક્તિના ગીતો, ધાર્મિક ભજનો તેમજ ગરબામાં લીન બની ગયા હતાં. આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં મુખ્ય પ્રવેશદ્વાર પર વડાપ્રધાનને આવકારવા માટે નૃત્ય રાગિની પેર્ફોમંગ કોલેજના ૭૦૦ ખેલૈયા દ્વારા એક સાથે નૃત્ય રજૂ કર્યું હતું. આ સિવાય ૭ ગરબા આર્ટિસ્ટ સ્ટેજ પર લાઈવ ગરબા દરેક ગીત સાથે પર્ફોર્મ કર્યા હતા.



આણંદમાં સિવિલનું કામ શરૂ નહીં થાય તો મામલો હાઈકોર્ટ જશે

આણંદ

આણંદ શહેરની વ્યાયામ શાળા ખાતે સિવિલ હોસ્પિટલના નિર્માણ અંગે છેલ્લા ઘણા સમયથી અનેક સંકટો ઉભા થયા બાદ હજી પણ સિવિલ હોસ્પિટલનો મુદ્દો ટલ્લે ચઢ્યો છે ત્યારે આજે લોકહિત રક્ષક સમિતિ, આણંદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આણંદ જિલ્લામાં મંજૂર થયેલ સિવિલ હોસ્પિટલના નિર્માણ કાર્યને વેગ આપી ગરીબ-મધ્યમવર્ગને આરોગ્યની સેવાઓનો લાભ મળે તેવા પ્રયત્નો કરવા અપીલ કરાઈ છે. સાથે સાથે આ અંગે લોકહિતમાં સત્વરે કાર્યવાહી કરવામાં નહિ આવે તો આ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

PMને મળવા કોર્પોરેટરોની બાદબાકી મુદ્દે મેયર-પક્ષના નેતા વચ્ચે તુંતું મેમે

વડોદરા

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સંગઠનના વોર્ડ પ્રમુખોને મળવાની વ્યવસ્થા કરવામાં આવી તો કોર્પોરેટરોની બાદબાકી થતા કોર્પોરેટરોમાં કચવાટ શરૂ થયો હતો જેનો પડઘો કોર્પોરેશન દ્વારા યોજાયેલી સત્યનારાયણની કથા બાદ પડ્યો હતો. જેમાં મેયર અને પક્ષના નેતા વચ્ચે તુંતું મે મે પણ થઈ હતી.

શનિવારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન સભા સ્થળે મેયર, ધારાસભ્યો, સંસદ સભ્યો અને સંગઠનના હોદ્દેદારો મળ્યા હતા. સંગઠનના વોર્ડ નં.૧ થી ૧૨ ને લેપ્રસી ગ્રાઉન્ડ અને ૧૩ થી ૧૯ ના વોર્ડ પ્રમુખોને એરપોર્ટ ખાતે લાઈનમાં ઉભા રાખી પોતાની

ઓળખ પ્રધાનમંત્રીને આપવાનો લાભ મળ્યો હતો. સંગઠનના તમામ હોદ્દેદારોને વી.વી.આઈ.પી. પાસ આપવામાં આવ્યા અને સ્ટેજની આજુબાજુમાં પણ જઈ શકે તેવી છૂટછાટ સાથેના પાસ હતા. જ્યારે કોર્પોરેટરોને માત્ર વીઆઈપી પાસ આપ્યા હતા. જેથી તેઓ વી.આઈ.પી.ના એન્કલોઝર સિવાય બીજે જઈ શકે નહીં તેવી સ્થિતિ સર્જાઈ હતી. એસટી બસમાં કાર્યકર્તાઓ અને અન્ય લોકોને લાવવાની વ્યવસ્થા કોર્પોરેટરોએ કરી હતી છતાં તેઓને પ્રધાનમંત્રી સાથે મુલાકાત નહીં કરાવતા તેનો પડઘો વડોદરા કોર્પોરેશન દ્વારા યોજાયેલી સત્યનારાયણની કથાના સમયે પડ્યો હતો.

કાર પલટી મારી જતાં અમુલના એમડી સોઢી અને ડ્રાઈવરને ઈજા

આણંદ

ભારતમાં જાણિતી અમૂલ ડેરીના એમડી આર એસ સોઢીને કાર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત આણંદના બાકરોલ રોડ પર સર્જાયો છે. જેમાં આર એસ સોઢી અને તેમના ડ્રાઈવરને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, તેને સામાન્ય ઈજા પહોંચી છે, અને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. આ દુર્ઘટના ગુજરાતના આણંદમાં બાકરોલ રોડ નજીક ઘટી હતી. મળતી માહિતી પ્રમાણે, અમુલના એમડી આરએસ સોઢી કાર લઈને જઈ રહ્યાં હતા. એ દરમિયાન આણંદના બાકરોલ રોડ પર તેઓની કારનું ટાયર ફાટ્યું હતું. જેના કારમે તેમને ઈજાગ્રસ્ત થઈ પહોંચી હતા.

SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES

CANADA
IMMIGRATION

SPOUSAL SPONSORSHIP
SPECIALIST (98 percent success ratio)

Last minute student admission

Please contact us on
416-745-2466 or 91-9428973911

- Conestoga
- Seneca
- Humber
- Lambton
- Fanshawe
- Georgian
- Algoma
- Canadore
- Algoma polytechnic
- Mohawk

ONLINE IELTS
SPOKEN ENGLISH CLASSES
ON ZOOM

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS /
- DETENTION REVIEWS /
- CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS

CANADA	94- 499 Main Street South, Shoppers World Mall, Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855
VADODARA	101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817
AHMEDABAD	139 Iscon Emporio, Beside Star Bazaar Satellite Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

: Specialized in :

Job Offer & LMIA

Entrepreneur

Investor Business

Self Employed

Farm Investor

Email.: info@siis.ca / Website.: www.siis.ca

બોટાદ પાલિકાનાં બાગી પ્રમુખ પાસેથી અંતે સત્તા છીનવી લેવાઈ

પ્રમુખ લઘુમતીમાં મુકાયા, તમામ સમિતિઓ ભાજપે કબ્જે કરી

બરવાળા

બોટાદ નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં જુથ બંધીનાં કારણે છેલ્લાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભાજપમાંથી બળવો કરી અલ્પાબેન સાબવા પ્રમુખ તરીકે તો ચૂંટાયા અને ભાજપ પક્ષે તમામ બળવાખોર સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા.

ત્યારબાદ પ્રમુખપદ હાંસલ કર્યા બાદ અલ્પાબેન સાબવાએ વિવિધ સમિતિની બહુમતીનાં જોરે રચના કરવા સામાન્ય સભા બોલાવેલી. બપોરે ૪ વાગ્યે નગરપાલિકા હોલમાં યોજાયેલ સામાન્ય સભામાં ૪૪ સભ્યોમાંથી ૩૨ સભ્યો હાજર રહેલ અને ૧૨ સભ્યો ગેરહાજર રહેતા પ્રમુખની ખુરશી હાલક ડોલક થવા લાગી હતી. સમિતિ રચનાનાં મુદ્દો આવતા જ સમિતિની રચનામાં ભાજપ પક્ષે કારોબારી સમિતિ, બાંધકામ, આરોગ્ય, ગટર, લાઈટ, ફાયર અને ટી.પી. સમિતિ

સહીતની તમામ સમિતિઓ બહુમતી ઓનાં જોરે કબ્જે કરી હતી. ભાજપની તરફથી મુકાયાના નામોની તરફેણમાં ૨૦ મતો પડ્યા હતા. જ્યારે પ્રમુખ દ્વારા સુચવાયેલ નામો તરફી માત્ર ૧૨ મત પડ્યા હતા. જેમાં ૪ કોંગ્રેસનાં સભ્યોએ પ્રમુખ તરફી રજુ કરાયેલ નામોમાં મતદાન કર્યું હતું. આમ મતદાન થતા બળવો કરી ચૂંટાયેલા પ્રમુખ પાસે માત્ર ૮ સભ્યોનું જ સમર્થન રહ્યું હતું. આમ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો હતો અને બોટાદ નગરપાલિકાનાં બળવાખોર પ્રમુખ લઘુમતીમાં મુકાયા હતા. બળવાખોરો સામે બદલો લેવા માટે જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલાએ છેલ્લા ત્રણ દિવસથી મોરચો માંડી દીધો હતો અને તેઓ પોતાનાં પ્રયત્નો કારણે ૧૨ સભ્યોને ગેરહાજર રાખવામાં સફળ રહ્યાં હતાં. જેને કારણે બોટાદ નગરપાલિકાની તમામ સમિતિઓ ભાજપે કબ્જે કરી લીધી હતી.

મોટી જાગધારમાં વીજળી પડતાં કાકા-ભત્રીજાના મોત

ભાવનગર

મહુવા પંથકમાં રવિવારે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ હતી. આ સાથે જ આકાશમાંથી વરસાદની સાથે વીજળીની આફત ત્રાટકી હતી.

મહુવાના મોટી જાગધાર ગામે રવિવારે સવારે ૧૧ કલાક આસપાસ સંજયભાઈ ભુપતભાઈ મકવાણા (ઉ.વ.૨૬), રવિ રાજુભાઈ મકવાણા (ઉ.વ.૧૧) અને બાલુબેન ભુપતભાઈ મકવાણા (ઉ.વ.૫૨) રહે, ત્રણેય મોટી જાગધાર)મનરેગાના કામ સબબ મજૂરી કરીને ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે જોરદાર ધડાકા સાથે આકાશમાંથી વીજળી તેમના પર ત્રાટકી હતી. જેથી ત્રણેયને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં કાકા-ભત્રીજા સંજયભાઈ અને રવિભાઈનું મૃત્યુ થયું હતું. જ્યારે બાલુબેન મકવાણાને સારવાર માટે હનુમંત હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પંજાબી સિંગર સિધ્ધુના હત્યારા શાર્પ શૂટર કચ્છમાંથી ઝડપાયા



ભુજ

પંજાબમાં જાણીતા સિંગર સિધ્ધુની હત્યા કરનાર લોરેન્સ બિશ્નોઈ ગંગના ત્રણ શાર્પશૂટર કચ્છના મુંદ્રા નજીક બારોઈ ગામમાંથી ઝડપી લેવાયા હતા. દિલ્હી સ્પેશિયલ ટાસ્ટ ફોર્સે કચ્છ પોલીસની મદદ લઈને સિંગર સિધ્ધુ મુસેવાલા ઉપર ગોળી છોડનાર મુળ હરિયાણાના પ્રિયવર્ત ઉર્ફે ફૌજ અને કશિષ ઉપરાંત તેમને મદદ કરનાર પંજાબના કેશવકુમાર નામના સાગરિતને ઝડપી લીધા હતા. બિશ્નોઈ ગંગના ત્રણેય શસ્ત્રોએ કચ્છમાં કામની તલાશમાં આવ્યા હતા અને

રૂમ ભાડે રાખીને રહેતા હતા તેવી કેફિયત આપી છે. ઉલ્લેખનિય છે કે, ગત તા. ૧૩ના રોજ લોરેન્સ બિશ્નોઈ ગંગનો શાર્પશૂટર સંતોષ જાધવ અને સાગરિતને કચ્છના માંડવીથી પૂણે પોલીસ દ્વારા ઝડપી લેવાયાં હતાં.

જાણીતા પંજાબી લોકગાયક સિધ્ધુ મુસેવાલાની ગત તા. ૨૮ મે ના દિવસે હત્યા કરનારાં શાર્પશૂટર પ્રિયવર્ત ઉર્ફે ફૌજ (ઉ.વ. ૨૬) અને કશિષ (ઉ.વ. ૨૪) ઉપરાંત તેમના મદદગાર કેશવકુમાર (ઉ.વ. ૨૮)ને દિલ્હી સ્પેશિયલ ટાસ્ટ ફોર્સની ટીમે મુંદ્રાના બારોઈ ગામેથી ઝડપી લીધા છે.

અન્ય રાજ્યો સાથે વેપારમાં રાજકોટનાં વેપારીઓનાં રૂપિયા 50 કરોડ ફસાયા

ગૃહ મંત્રી સમક્ષ ચેમ્બર- ઓધોગિક એસો.એ 300થી વધુ પ્રશ્નો રજૂ કર્યા

રાજકોટ

રાજકોટ સૌરાષ્ટ્રનું વેપાર - ઉધોગનું હબ બન્યું છે ત્યારે અન્ય રાજ્યોનાં વેપારીઓ સાથેનાં વ્યવહારમાં પેમેન્ટની મોટી રકમ ફસાઈ છે. એક અંદાજ મુજબ રાજકોટનાં વેપારીઓનાં આશરે 150 કરોડ જેવી રકમની ઉધરાણી આ રીતે ફસાઈ હોય તે વહેલી તકે છુટી થાય તે માટે ગુજરાત પોલીસ મદદ કરે તેવી રજૂઆત આજે ગૃહ રાજ્ય મંત્રીને રાજકોટનાં વેપારીઓ - ઉધોગકારોએ કરી હતી જેના જવાબમાં નાણાંકીય ગેરરિતી કે આર્થિક ક્રોડનાં મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરવાની ખાતરી ગૃહ રાજ્ય મંત્રીએ આપી હતી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સમક્ષ રાજકોટ ચેમ્બર, ગ્રેટર ચેમ્બર અને આસપાસનાં

ઓધોગિક સંગઠનનાં હોદ્દેદારો અને વ્યક્તિગત મળીને આશરે 300 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તેમાં મોટા ભાગનાં અન્ય રાજ્યો સાથેના વેપારમાં જેમનાં નાણાં ફસાયા હતા તે મુખ્ય હતા. આ ઉપરાંત નવા વિસ્તારોમાં પોલસ સ્ટેશન આપવા, બજારોમાં દારૂ સહિતની બદી, ટ્રાફિકની સમસ્યા, અશાંત ધારો સહિતનાં પ્રશ્નો રજૂ કરાયા હતા. રાજકોટ ચેમ્બરનાં પ્રમુખનાં જણાવ્યા મુજબ રાજકોટનાં વેપારીઓનાં આશરે 150 કરોડ જેવી રકમનાં પેમેન્ટનાં ફસાયા છે. રાજકોટનો વેપાર મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યો સાથે છે. અનેક કેસોમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. દસ્તાવેજો સાથે રજૂઆતો કરાઈ હતી.

પોરબંદરનું વહાણ સલાલામાં ડુબ્યું, આખા કિનારે ગાડીઓ જ ગાડીઓ

પોરબંદર

શહેરના રાજ સાગર નામના માલવાહક વહાણો ઓમાનના દરિયામાં જળસમાધી લીધી હતી. આ ઘટનામાં જહાજના કેપ્ટન અને એક કુ મેમ્બરનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 8 મેમ્બર્સને સ્થાનિક સુરક્ષા એજન્સી દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જળસમાધિ લેનારા વહાણ સલાલા બંદરથી જુના વાહનો ભરીને યમન ખાતે જઈ રહ્યું હતું. જો કે ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણમાં લાગી રહ્યું છે.

પોરબંદરનું રાજસાગર નામનું વહાણ ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઈલ દૂર પહોંચ્યા બાદ દરિયામાં ડુબવાની ઘટના સામે આવી છે. જળસમાધિ લેનારા વહાણ રાજસાગર



બે-ચાર દિવસ પહેલા જ દુબઈથી જુના વાહનો ભરીને યમન જવા માટે નિકળ્યું હતું. આ વહાણ ગત મોડીરાત્રીના ચાર વાગ્યાના અરસામાં ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઈલ દુર જળ સમાધી લીધી હતી. વહાણે જળ સમાધિ લઈ લેતા વાહનોનો કાટમાળ અને ગાડીઓ મીરબાટ બંદર નજીક તણાઈ આવી હતી.

First Flight
FFCL Couriers Inc.

દુનીયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

1 LB \$20 વધુ દર LB ના \$6 11 LB \$55 વધુ દર LB ના \$6 23 KG \$185, વધુ દર KG ના \$10 30 KG \$230, વધુ દર KG ના \$10	ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)
---	---

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

Brampton (West)	Scarborough WE ARE RE-OPENING	Mississauga WE MOVED TO
519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, ATN Wireless Board Door Open Last Unit Ours Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 7.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM	880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-THU : ----- 2.00 PM to 7.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 11.00 AM to 6.00 PM	6800 REXWOOD ROAD, UNIT - D : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 ---: SAT-SUN :--- 11.00 AM to 5.00 PM -----: MON-FRI : ----- 9.30 AM to 5.00 PM

૬૪૭-૭૬૧-૧૩૧૭ www.firstflightcanada.com

સ્વદેશ
CANADA

Registration # 869127209
 Publication Mail Agreement /
 Email : info@swadesh.news

WWW.SWADESH.NEWS

Return Undeliverable Canadian Address To :

Shree Balaji Inc.
MAILING ADDRESS
 23 Lyric Road,
 Brampton ON L6S 0B4.
 416-996-7755

Registered Address
 713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi
 Director : Nilesh Tailor
 Sub Editor : Chhaya Gandhi
 Montreal Bureau : Vijay Patel (514-826-7442)

Designed By
 Sabir Daroga
 Mevada Piyush
 Firoz Shaikh

GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT (INDIA)



આલિયા હોલીવૂડ ડેબ્યુ ફિલ્મમાં એક્શન દ્રશ્યો ભજવશે

મુંબઈ : આલિયા ભટ્ટ પણ હોલીવૂડમાં કામ કરનારી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. તે હાર્ટ ઓફ સ્ટોન નામની ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ તે ગેલ ગૅડેટ અને જેમી ડોર્નન સાથે કરી રહી છે. આલિયા આ હોલીવૂડ ફિલ્મમાં ખેરદાર એક્શન દ્રશ્યો કરતી ખેવા મળવાની છે. આલિયા ગયા મહિને જ આ ફિલ્મના શૂટિંગ માટે લંડન જવા રવાના થઈ હતી. ત્યારે થોડી નર્વસ થઈ ગઈ હતી. આલિયાએ શેર કર્યું હતું કે, મને પ્રથમ વખત એક બ્યુકમર જેવી લાગણી થાય છે.



સ્પર્દેશ

FRIDAY, 24 JUNE, 2022

09

નો એન્ટ્રીની સિક્વલમાં સલમાનખાન સાથે સામંથા નજરે પડશે



મુંબઈ : હિંદી ફિલ્મોમાં સાઉથના સ્ટાર્સને પણ લઈ હિંદી અને સાઉથની બંને માર્કેટ સર કરવાનો ટ્રેન્ડ આગળ વધી રહ્યો છે. સલમાન ખાનની નો એન્ટ્રી ની સિક્વલમાં સાઉથની અન્ય હિરોઈનો સાથે હવે સામંથાનું નામ પણ ઉમેરાયું છે. એન્ટ્રી સિક્વલમાં સલમાન ખાન સાથે સાઉથની હિરોઈન સામંથા પ્રભુના સાઈન કરવાનું નક્કી થઈ ચૂક્યું છે. સામંથા અને સલમાન આ ફિલ્મમાં રોમાન્સની સાથેસાથે કોમેડી કરતા જોવા મળે તેવી શક્યતા છે. સામંથા દક્ષિણ ભારતીય ફિલ્મોનો લોકપ્રિય અને જાણીતો ચહેરો છે, તેથી આ ફિલ્મ સાથે ફિલ્મસર્જકે તેને બોક્સઓફિસને ધ્યાનમાં રાખીને લીધી છે.

આ ફિલ્મમાં સામંથા ઉપરાંત, રશ્મિકા મંદાના, પૂજા હેગડે, તમન્ના ભાટિયા પણ જોવા મળવાના છે. આમ, ફિલ્મમાં સાઉથની હિરોઈનોનો એક મોટું ગૂંપ જોવા મળવાનું છે.

એક્ટર અનુ કપૂર ફ્રાન્સમાં લૂંટાઈ ગયો



મુંબઈ : પીઠ અભિનેતા અનુ કપૂરને ફ્રાન્સની ટૂરમાં બહુ માઠો અનુભવ થયો છે. તેમની કિંમતની ચીજોની ચોરી થઈ ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો આઘાતજનક અનુભવ શેર કર્યો હતો. અનુ કપૂરે એક વીડિયો પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે હું આજકાલ યુરોપની ટૂર પર છું. દુઃખની વાત એ છે કે મારાં કિંમતી ગેજેટ્સ અને રોકડ તથા મારી બેગની ફ્રાન્સમાં ચોરી થઈ ગઈ છે. અભિનેતાના જણાવ્યા અનુસાર તેઓ ત્યાં ટ્રનમાં પ્રવાસ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની બેગ ચોરાઈ ગઈ હતી. તેમાં ફેંક અને યુરો બંને ચલણની બહુ બધી નોટો હતો. આ ઉપરાંત તેમાં આઈપેડ, ડાયરી, કેડિટ કાર્ડ સહિતની કેટલીય કિંમતી ચીજવસ્તુઓ હતી. બધું મેં ગુમાવી દીધું છે.

જાહ્નવી કપૂર દક્ષિણની ફિલ્મોમાં કામ કરવા તબક્કાપડ છે!

જાહ્નવી કપૂરના સોશયલ મીડિયા પર નજર નાખો તો તેમાં જિમ અને પ્રવાસને લગતાં ફોટા સૌથી વધુ જોવા મળે. તે ઘણા અંશે તેની દિવંગત માતા શ્રીદેવી જેવી છે. તેના અભિનયમાં પણ તેની ઝલક વત્તાઓછા અંશે સ્વાભાવિક રીતે આવી જતી દેખાય છે. આમ છતાં તેણે ક્યારેય પોતાના માતાની નકલ કરવાનો પ્રયાસ નથી કર્યો. તેણે પોતાનું આગવું વ્યક્તિત્વ વિકસાવ્યું અને જાળવ્યું છે. તે ફિલ્મોની પસંદગી પણ સમજીવિચારીને કરે છે. તેની આગામી ફિલ્મો 'મિલી' અને 'બવાલ' તેનો વધુ એક પુરાવો છે. ઓર એક આગામી મૂવી 'ગુડ લક જેરી' ઉપરાંત 'મિલી' દક્ષિણ ભારતીય ફિલ્મોની રિમેક છે. છેલ્લા કેટલાક સમયથી સાઉથની ફિલ્મોને જે સફળતા મળી રહી છે તે જોતાં તેની આ મૂવીઝ પણ સારી ચાલશે. જાહ્નવી કહે છે, 'હું માત્ર આ ફિલ્મોથી જ નહીં, મારી કારકિર્દી જે રીતે આગળ વધી રહી છે તેનાથી ખુશ છું. જોકે મને એમ પણ લાગે છે કે હજી મારે લાંબી મજલ કાપવાની છે. આ તો મારી કારકિર્દીનો આરંભ માત્ર છે. હું મારી આ બંને ફિલ્મો માટે બહુ ઉત્સાહિત છું. મેં તેમાં કાંઈક નોખું કરવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર તો હું દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા ઈચ્છું છું. ચાહે તે તમિળ હોય કે પછી તેલુગુ. હું ત્યાંની ફિલ્મોની જબરી પ્રશંસક છું. મને સારી ઓફર મળે તેની હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું.'

પિતા બોની સાથે કમર્શિઅલ પ્રોજેક્ટમાં સ્ક્રીન શેર કરશે જાહ્નવી

મુંબઈ : જાહેરખબરોમાં સ્ટાર ફેમિલીને સાથે સાર્થન કરવાનો ટ્રેન્ડ પ્રચલિત બન્યો છે. તેના ભાગરૂપે હવે એક જાહેરખબરમાં જાહ્નવી કપૂર પિતા બોની કપૂર સાથે જોવા મળવાની છે. પિતા સાથે તે આ રીતે પહેલીવાર સ્ક્રીન શેર કરશે. જાહ્નવી કપૂર હાલ પોતાની આગામી ફિલ્મ ગુડ લક જેરીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઉપરાંત અન્ય પ્રોજેક્ટ્સ પણ પાછપલાઈનમાં છે. આ જાહેરખબરનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે. હાલ વિજ્ઞાપનોમાં બોલીવુડ ફેમિલીમાંથી માતા-પુત્ર, પતિ-પત્નીને સાથે લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ રણબીર કપૂર અને નીતુ કપૂર એક વિજ્ઞાપનોમાં સાથે જોવા મળ્યા હતા.

સિક્વલની હોડ વચ્ચે શ્રદ્ધા કપૂરનો સ્ત્રી ફિલ્મની પ્રિક્વલ બનાવવા નિર્ણય

મુંબઈ : હિંદી ફિલ્મ જગતમાં સિક્વલ બહુ બધી બની છે પરંતુ પ્રિક્વલ પર બહુ જુજ કેસમાં હાથ અજમાવાયો છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હિટ હોરર કોમેડી સ્ત્રીની પ્રિક્વલ બનાવવાની જાહેરાત થઈ છે. તેમાં આ બધાં પાત્રો ચંદેરી ગામમાં પહોંચ્યાં પહેલાં ક્યાં કઈ સ્થિતિમાં હતા તેની કથા કહેવામાં આવશે એવો દાવો કરાઈ રહ્યો છે. નવી ફિલ્મો માટે સ્ટોરીઓનો દુકાળ પ્રવર્તે છે. નવા સ્ટોરી આઈડિયા સાથે ફિલ્મ હિટ થશે કે કેમ તેવો આત્મવિશ્વાસ સર્જકોએ ગુમાવી દીધો છે. આથી તેઓ પોતાના જુના સ્ટોરી આઈડિયાને જ જુદી જુદી રીતે રિસાઈકલ કરીને તેના પરથી ફિલ્મો બનાવી રહ્યા છે. સ્ત્રી, ભેડિયા અને રુહી ફિલ્મોનું એક યુનિવર્સ રચવા પ્રયાસ થઈ રહ્યો છે. મતલબ કે આ ફિલ્મોનાં પાત્રો એકબીજાની ફિલ્મોમાં એન્ટ્રી કરશે. હોલિવુડમાં આ પ્રકારનાં યુનિવર્સના પ્રયાગો થયા છે. હિંદી ફિલ્મોમાં સૂર્યવંશીમાં સિંઘમ અને સિંબા બંનેના પાત્રોની એન્ટ્રી થઈ હતી. હવે શાહરુખ ખાનની પટાણમાં પણ સલમાન ખાનના ટાઈગરના રોલની એન્ટ્રી હશે. આ જ લાઈન પર સ્ત્રી, ભેડિયા અને રુહીના પાત્રોનું હોરર કોમેડીનું યુનિવર્સ બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે. તેની સાથે એક અલાયદા ટ્રેક પર સ્ત્રીની પ્રિક્વલ બનશે. તેમાં સારા અલી ખાન ચંદેરી પહોંચી તે પહેલાં તેની જિંદગીમાં શું શું બન્યું હતું અને ફિલ્મના અન્ય પાત્રોની પણ તે પૂર્વેની વાત કહેવામાં આવશે.



કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશનો સર્જરી બાદ બગડ્યો ચહેરો



મુંબઈ : કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશની સાથે જે થયું તે ભયાવહ છે. જે રીતે રુટ કેનાલ સર્જરી બાદ તેમનો ચહેરો સૂજી ગયો છે, અભિનેત્રીની તસવીર જોઈ દરેક પરેશાન છે. સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતા સ્વાતિએ કહ્યું- તે 28 મે એ રુટ કેનાલ ટ્રીટમેન્ટ માટે ગઈ હતી. મારી રુટ કેનાલ યોગ્ય રીતે થઈ નથી. મારા ચહેરા પર આવેલા સોજાના કારણે આ અધૂરી રહી ગઈ છે. સૌથી પહેલા ડોક્ટરે મને સોડિયમ હાઈપોકલોરાઈટનું ઈન્જેક્શન આપ્યું. જ્યારે મે મોટેથી બૂમ પાડી. જે સમયે તે ઈન્જેક્શન આપ્યું તે સમયે હું રડવા લાગી. જે બાદ મને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું. બીજા ડોક્ટરના જણાવ્યા અનુસાર સૌથી પહેલા એનેસ્થેસિયાનું ઈન્જેક્શન લગાવવું જોઈએ પછી સોડિયમ હાઈપોકલોરાઈટ. હા ડોક્ટરની ભૂલ હતી.

શિલ્પા શેટ્ટી બહુ બિઝી હોવાથી અપને ટૂ માં કામ નહીં કરે



મુંબઈ : શિલ્પા શેટ્ટીની હાલ રીલિઝ થયેલી નિકમ્મા બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ છે પરંતુ, તેમ છતાં તે એટલી બધી વ્યસ્ત છે કે તેણે દેઓલ ખાનદાનની અપને ટૂ ફિલ્મ માટે તારીખો ફાળવવાનો ઈનકાર કરી દીધો છે. ૨૦૦૭માં રજૂ થયેલી અપને ફિલ્મમાં શિલ્પાએ સની દેઓલની પત્નીની ભૂમિકા ભજવી હતી. પરંતુ, હવે અપને ટૂ બનાવી રહેલા ડિગ્રેશનક અનિલ શર્માએ શિલ્પાનો ફરી સંપર્ક કર્યો તો તેણે એમ કહીને ઈનકાર કરી દીધો હતો કે પોતે બહુ વ્યસ્ત છે અને જોઈતી તારીખો ફાળવી શકે તેમ જ નથી. બોલીવુડ વર્તુળોને શિલ્પાનો આ દાવો વિચિત્ર લાગે છે.

આમીર અને અક્ષય વચ્ચે બોક્સ ઓફિસ પર ટકરાવ નિશ્ચિત

બોલીવુડના બે ટિગ્ગર સ્ટાર આમીર ખાન અને અક્ષય કુમાર વચ્ચે બોક્સ ઓફિસ પર ટકરાવ થવા જઈ રહ્યો છે. આમીરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્યા અને અક્ષયની રક્ષા બંધન એક જ દિવસે એટલે કે 11 ઓગસ્ટે રિલિઝ થવા જઈ રહી છે. લાલ સિંહ ચઢ્યાની રિલિઝ ડેટ બહુ પહેલા જાહેર કરી દેવાઈ હતી. જોકે એ પછી પણ રક્ષા બંધનના મેકર્સ પોતાની ફિલ્મ આ જ તારીખે રિલિઝ કરવાનું એલાન કર્યું છે. બંને ફિલ્મો વચ્ચેનો ટકરાવ કોઈ એક ફિલ્મને નુકસાન કરશે તે નિશ્ચિત છે. દરમિયાન રક્ષા બંધનના ડાયરેક્ટર આનંદ એલ રાયનું કહેવું છે કે, આ દિવસે ત્રણ ફિલ્મ રિલિઝ ના થાય તેનું ધ્યાન અમે રાખી



રહ્યા હતા. જ્યારે અક્ષય કુમારે કહ્યું હતું કે, આ કોઈ ટકર નથી પણ બે સારી ફિલ્મો એક સાથે રિલિઝ થવા જઈ રહી છે. જોકે ભૂતકાળમાં અક્ષય કુમારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પચાવત માટે પોતાની ફિલ્મ પેડમેનની તારીખો બદલી હતી. જેના માટે ભણસાલીએ અક્ષય કુમારનો આભાર પણ માન્યો હતો. તે વખતે અક્ષયકુમારે કહ્યું હતું કે, પચાવત ફિલ્મ માટે સંજય ભણસાલીએ ઘણી તકલીફો સહન કરી છે અને તેમણે ફિલ્મ પર લગાવેલો દાવ મારી ફિલ્મ કરતા ઘણો વધારે છે. આ બંને ફિલ્મો અલગ અલગ સમયે રિલિઝ થઈ હતી અને હિટ સાબિત થઈ હતી.



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા ક્લેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણેશાણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્વટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

બેરોજગારીનો અસંતોષ ડામવા સરકારની બે જાહેરાતો પૈકી અગ્નિવીર સામે વિરોધ વંટોળ

10 લાખ નોકરીનો વાયદો, સરકાર માટે પણ 'અગ્નિપથ'

8 વર્ષના સુશાસનનો દાવો કરતી મોદી સરકાર માટે દેશમાં બેરોજગારીનો પ્રશ્ન માથાનો દુખાવો બન્યો છે. ચૂંટણીની સભાઓમાં ભાજપી નેતાઓના જુમલા બાદ હવે વિપક્ષ આ જ મુદ્દે સરકારને ભીંસમાં લઈ રહ્યો છે. તાજેતરમાં જ સરકારે બે મોટા નિર્ણયો જાહેર કર્યા છે. જેમાં કેન્દ્ર સરકારના વિભાગો અને મંત્રાલયો દ્વારા દેશમાં દોઢ વર્ષમાં 10 લાખ નોકરીઓ આપવાનું વચન આપાયું છે.

આ ઉપરાંત અન્ય એક જાહેરાતમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે આર્મી, નેવી અને એરફોર્સમાં નોન-કમિશન રેન્ક પર ભરતી હવે અગ્નિપથ યોજના હેઠળ કરવાની વાત કરી છે. આ બે જાહેરાત પૈકી અગ્નિપથ યોજના સામે દેશમાં વિરોધવટોળ શરુ થઈ ગયો છે. અત્યાર સુધી પાંચેક દિવસના વિરોધ પ્રદર્શનમાં હજાર કરોડથી પણ વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. ખાસ કરીને યુપી, બિહાર, રાજસ્થાન જેવા રાજ્યોમાં તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આ યોજનાનો વિરોધ કરનારાઓની દલીલ છે કે, આ યોજનામાં સૈનિકોની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે. તેથી ચાર વર્ષ બાદ તે યુવાને નોકરી માટે ફરી ભટકવું પડશે. સેનાના ઘણા નિવૃત્ત અધિકારીઓએ પણ આ યોજના પર સવાલો ઉઠાવ્યા છે. સેનામાં ભરતીના નિયમોને લઈને આટલો અસંતોષ કદાચ પહેલી વાર જોવા મળ્યો છે. સેનામાં ભરતી ઘણાં સમયથી અટકી પડી હતી. વળી, મોદી સરકારે તેને કોરોનાને નામે ટલ્લે ચઢાવી રાખી હતી. ઘણા સમય બાદ સરકારે ત્રણેય સેનાઓમાં ભરતી માટે અગ્નિપથ યોજનાની જોરશોરથી જાહેરાત કરી હતી. ગ્રાફિક્સ અને પોસ્ટરો ડિઝાઇન કરીને ખૂબ પ્રચાર કર્યો હતો. સરકાર સાથે જોડાયેલા લગભગ દરેક નેતાઓએ સોશયલ મીડિયા દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે યોજનાનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે ત્યારે સરકારનો દાવો છે કે, સેનામાં આ ક્રાંતિકારી પરિવર્તન છે. જો કે, સરકારની આ યોજના સામે યુવાઓમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં તો તેઓ સૈન્યની પરીક્ષામાં પાસ થવા માટે 5 વર્ષની તાલીમ લેતા હોય છે. 5 વર્ષની તૈયારી પછી પણ તેમને નોકરી મળી જશે તેની ગેરન્ટી હોતી નથી. હવે જો નોકરી મળે તો તે માત્ર 4 વર્ષ માટે મળવાની હોવાથી પરીક્ષાની તૈયારી કરી રહેલા લાખો યુવાનો હતાશ થઈ ગયા છે. તેમની આ હતાશા ટાઈમ બોમ્બ જેવી છે. જો તેનો વિસ્ફોટ થશે તો નવનિર્માણ જેવું આંદોલન પેદા થશે. કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિવીર યોજના



માટે 17.5 થી 21 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી હતી. તેને કારણે પણ યુવાનો ગુસ્સામાં હતા. કોરોનાના 2 વર્ષ દરમિયાન સૈન્યમાં ભરતી બંધ રાખવામાં આવી હતી. તેને કારણે પરીક્ષાની તૈયારી કરી રહેલા લાખો યુવાનો 21ની વય વટાવી ગયા હતા. તેમના કોઈ વાંક - ગુના વગર તેઓ નોકરીની તકથી વંચિત રહી જતા હતા. તેમને ઠંડા પાડવા માટે સરકારે ચાલુ વર્ષ દરમિયાન ભરતીની વય 23 વર્ષની કરી છે. તેનાથી કેટલાક યુવાનો શાંત પડશે પણ તેમનો મૂળ પ્રશ્ન હલ થવાનો નથી. અલબત્ત સરકારે આ બાબતે પીછેહઠ કરવા સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. એટલે આગામી દિવસોમાં પણ તેનો વિરોધ થવો સંભવ છે. અત્યાર સુધીની વ્યવસ્થામાં 17 વર્ષની નોકરી પછી પેન્શન અને સસ્તા માલની કેન્ટીન ચલાવવાની સુવિધા તેમને મળતી હતી. જ્યારે અગ્નિપથ યોજના હેઠળ પ્રવેશ મેળવનારાઓમાંથી માત્ર 25%ને જ આ સુવિધા મળશે. વિવાદ વધતો

પ્રાસંગિક
ધવલ શુક્લ

સરકારના વિવિધ વિભાગોમાં જ 8 લાખથી વધુ જગ્યા ખાલી છે. પરંતુ સરકાર ભરતી પ્રક્રિયાને ટલ્લે ચઢાવી રહી છે. 2019માં આર્મી માટે યુવાનોએ ટેસ્ટ આપી અને હવે નવેસરથી પ્રક્રિયા શરૂ થતા વિવાદ થયો

જોઈને MPના CM શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે, MP પોલીસમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે. ગૃહ મંત્રાલયએ જાહેરાત કરી, તેમાં લખવામાં આવ્યું હતું કે, ગૃહ મંત્રાલયે આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. હવે આ વિવાદમાં બે જ બાબત જવાબદાર

છે. એક તો સરકાર તેમને અગ્નિપથ યોજના સમજાવી શકી નથી, અથવા તો યુવાનો યોજનાને સમજી ગયા છે પણ પસંદ આવી નથી. અગ્નિપથ યોજનાની જાહેરાતે યુવાનોના મનમાં આશંકાઓ ભરી દીધી છે. કારણ કે સરકારે એવું નથી કહ્યું કે ખુલ્લી ભરતી નહીં થાય, પરંતુ કહ્યું છે કે હવે જે પણ ભરતી થશે તે અગ્નિપથથી જ થશે. આવી સ્થિતિમાં યુવાનોની ચિંતા એ છે કે જે ઉમેદવારો 4 વર્ષ પછી નિવૃત્ત થઈને પાછા ફરશે ત્યારે તેમનું શું થશે? 4 વર્ષ પછી તેઓ બેરોજગાર થઈ જશે. આ પ્રશ્ન માત્ર યુવાનો જ ઉઠાવી રહ્યા નથી. ઘણા રાજકીય પક્ષો પણ સરકારની મનસા સામે સવાલો કરી રહ્યા છે. BJPના સાંસદ વરુણ ગાંધીએ પણ ટવીટ કરીને લખ્યું છે કે, સરકાર પણ 5 વર્ષ માટે ચૂંટાય છે. તો પછી યુવાનોને 4 વર્ષ જ દેશની સેવા કરવાનો મોકો કેમ મળે છે? તેજસ્વી યાદવે વિપક્ષ વતી ટવીટ કરીને લખ્યું છે કે, શું ભવિષ્યમાં BJPના મૂડીવાદી મિત્રોના

બંધાકીય પાયાની રક્ષા કરવા યુવાનો 4 વર્ષની શિક્ષણ અને કોન્ટ્રાક્ટની નોકરી કરશે? પ્રિયંકા ગાંધીએ સરકારને સવાલ કર્યો છે કે BJP સરકાર સેનાની ભરતીને પોતાની લેબોરેટરી કેમ બનાવી રહી છે? સૈનિકોની લાંબી નોકરીઓ સરકારને બોજરૂપ લાગી રહી છે? વિપક્ષના સવાલો વચ્ચે સેનામાંથી રિટાયર્ડ ઘણા ઓફિસરોએ પણ આ યોજના અંગે આશંકાઓ સેવી છે. નિવૃત્ત

લેફ્ટનન્ટ જનરલ વિનોદ ભાટિયાએ લખ્યું હતું કે, આ યોજનાથી સશસ્ત્ર દળો માટે ખતરો છે. TOD એટલે ટૂર ઓફ ડ્યુટીનો ટેસ્ટ, નો પાયલોટ પ્રોજેક્ટ, ડાયરેક્ટ અમલીકરણ. આનાથી સમાજના લશ્કરીકરણને પ્રોત્સાહન મળશે. લગભગ 40 હજાર યુવાનોને વર્ષ દર વર્ષે રિજેક્ટ કરવામાં આવશે. એટલે કે તેઓ 4 વર્ષ પછી નિવૃત્ત થશે. અગ્નિવીર શસ્ત્રોની તાલીમ સાથે નોકરી વિના બેરોજગાર. સારો વિચાર નથી. કોઈને ફાયદો થતો નથી. વિપક્ષના નેતાઓના પ્રશ્ન અને ઢિગ્ગજોની ચિંતામાંથી સૌથી મહત્વનો પ્રશ્ન એ બહાર આવે છે કે, 4 વર્ષ પછી બેરોજગાર થશે તો અગ્નિવીર શું કરશે? અગ્નિવીર યોજનાનો આ વિવાદ હજી પુરેપુરો શમ્યો નથી ત્યાં હવે હવે દોઢ વર્ષમાં 10 લાખ જગ્યાઓ પર ભરતી કરવાનું વચન સરકાર કેવી રીતે પૂર્ણ કરશે તે અંગે પણ સંશયો છે. સરકારી અહેવાલો પ્રમાણે રેલવેમાં જ સરકારી નોકરીઓ માટે 3 લાખ પદો ખાલી છે. સંરક્ષણ વિભાગમાં 2 લાખ 47 હજાર 502 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત ગૃહ મંત્રાલયમાં 1 લાખ 28 હજાર 842 જગ્યાઓ, ટપાલ વિભાગમાં 90 હજાર 50 જગ્યા તથા મહેસૂલ ખાતામાં 76 હજાર 327 જગ્યાઓ ખાલી છે.

જ્યારે એકાઉન્ટ વિભાગમાં 23 હજારથી વધુ જગ્યા ખાલી પડી છે. એટલે કે, 8 લાખથી વધુ પદ ખાલી છે. સરકારના જણાવ્યા અનુસાર આ જગ્યાઓ ભરવામાં આવશે પરંતુ શું આ જગ્યાઓ દોઢ વર્ષમાં ભરવામાં આવશે? વર્ષોથી લટકતી ભરતી પ્રક્રિયા દોઢ વર્ષમાં પૂર્ણ થશે? બીજી તરફ યુવાનોનું કહેવું છે કે તેઓ સરકારની જાહેરાતથી સંતુષ્ટ છે. પરંતુ તંત્રની પદ્ધતિ ઉપર વિશ્વાસ નથી અને આ માટે એક મજબૂત કારણ પણ છે.

યુવાનો કહે છે કે, જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં રેલવે ભરતીમાં ગેરરીતિ સામે આવ્યા બાદ અનેક રાજ્યોમાં બેરોજગાર યુવાનો રોષે ભરાયા હતા. બિહારમાં ઘણી જગ્યાએ ટ્રેનોને આગ ચાંપવામાં આવી હતી. પ્રયાગરાજમાં વર્ષો પછી રેલવે ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જાન્યુઆરીમાં યુવાનોના ગુસ્સાને પગલે પોલીસ તેમને માર મારીને દરવાજા ખોલી રહી હતી. 2019ની ચૂંટણી પહેલાં રેલવેમાં NTPC અને ગ્રુપ Dની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. 1 લાખ 35 હજાર જગ્યાઓ ભરવાની હતી પરંતુ હજુ સુધી તે ભરતી પણ પૂર્ણ થઈ નથી. જેથી હવે સરકારે આપેલું 10 લાખ નોકરીનું વચન તે કેવી રીતે પૂર્ણ થશે તે માટે સવાલ છે.

યોગ કરવા કમ્ફર્ટ રહેતા સ્પેશિયલ આઉટફિટ

તન અને મનને ફિટ રાખવા માટે આપણે જિમ કે યોગા સેન્ટરમાં જવાનું પસંદ કરીએ છીએ. યોગ કરવા માટે સૌથી પહેલાં તો અમુક બેઝિક વસ્તુઓની જરૂર પડે છે. એમાં સૌથી પહેલાં તો આઉટફિટ અગત્યના છે. આઉટફિટ જો પ્રોપર હશે તો તમે સંપૂર્ણ ધ્યાન યોગા પર આપી શકશો. નહીંતર કપડાંને કારણે સંકોચ અનુભવશો. વાત જ્યારે કમ્ફર્ટની થઈ રહી હોય ત્યારે એનો અર્થ એ નથી કે સ્ટાઈલને પાછળ છોડી દેવામાં આવે. હવે તો સ્ટાઈલ અને કમ્ફર્ટ બંને એક સાથે મળતાં થઈ ગયાં છે. ટ્રેન્ડી આઉટફિટ પહેરીને તમે યોગા કરી શકો છો.

મૂવમેન્ટને અટકાવતાં નથી. તમે ટેન્ક ટોપ્સ પણ પહેરી શકો છો, કારણ કે યોગમાં હાથની મૂવમેન્ટ વધારે કરવાની હોય છે. તેથી આ પ્રકારનાં ટોપ્સ તમારી હાથની મૂવમેન્ટને ફી રાખશે.

યોગા પેન્ટ્સ

યોગા કરવા માટે હવે સ્પેશિયલ યોગા પેન્ટ્સ ફેશનજગતમાં છવાઈ ગયાં છે. આ પેન્ટ્સ સ્ટ્રેચબલ હોય છે. તેથી યોગા પેન્ટ્સ તમારી ત્વચાને ખેંચતા હોય એવો અહેસાસ થતો નથી. પરિણામે તમે ધ્યાનપૂર્વક રિલેક્સ રહીને યોગા કરી શકો છો. યોગા પેન્ટ્સની સૌથી સારી વાત એ છે કે આ પેન્ટ્સ પરસેવાને જલદી શોષી લે છે તેથી ત્વચા સાથે સંકળાયેલી બીમારીઓ થતી નથી. તમે તમારા લુકને સ્ટાઈલિશ બનાવવા ઇચ્છો છો તો લેગિંગ્સ કે યોગા પેન્ટ્સની ઉપર શોર્ટ્સ ટી શર્ટ પહેરી શકો છો.

બેગી કોપ ટોપ્સ

દાયકાઓથી બેગી કોપ ટોપ્સનું ચલણ રહ્યું છે. તે આજે પણ ઈન ટ્રેન્ડ છે. ફિટનેસ પ્રત્યેની અવેરનેસ વધવાને કારણે કોપ ટોપ્સનો ટ્રેન્ડ વધી ગયો છે. આ ટોપ્સ તમને કમ્ફર્ટ અને સ્ટાઈલ આપે છે. કોટન ફેબ્રિક્સમાંથી બનેલા આ આઉટફિટ તમારી



સ્લમ જોગર્સ

સ્લમ જોગર્સ તમને ટ્રેક પેન્ટની જેમ જ કમ્ફર્ટ આપશે. આ ઉપરાંત તે ટ્રેન્ડી પણ લાગશે. કમ્ફર્ટબલ, બ્રીધેબલ ફેબ્રિકવાળા જોગર્સ તમારા શરીરને ચોંટશે નહીં અને યોગા કરતી વખતે સાનુકૂળતા રહેશે.

સ્પોર્ટ્સ બ્રા

યોગા કરતી વખતે સ્પોર્ટ્સ બ્રા પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. જેથી બ્રેસ્ટને સંપૂર્ણ સપોર્ટ મળી શકે. સ્પોર્ટ્સ બ્રા પહેરીને યોગ કરવામાં કમ્ફર્ટબલ ન હોવ તો ઉપરથી ઢીલું ટેન્ક ટોપ કે કોપ ટોપ પહેરી શકો છો. આ બ્રા પર જેકેટ પણ કેરી કરી શકો છો.

સ્વેટ રેજિસ્ટ્રેટ ટી શર્ટ

આ પ્રકારના ટી શર્ટમાં પરસેવો નીકળે તો દેખાતો નથી. તેથી જિમમાં, એક્સરસાઈઝ અને યોગ કરતી વખતે તેને કેરી કરી શકો છો. સ્વેટ રેજિસ્ટ્રેટ ટી શર્ટ ટાઈટ પહેરવાને બદલે થોડાં ઢીલાં પહેરવાં જોઈએ. જેથી સ્કિન સાથે ચોંટી ન જાય.

ટ્રેક સૂટ

શિયાળાની ઠંડીમાં જ્યારે એક્સરસાઈઝ અથવા તો યોગા કરો ત્યારે ટ્રેક સૂટ



પહેરો. જેથી શરીરમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે. ગરમીમાં શોર્ટ્સ પણ એક સારો ઓપ્શન છે.

કોટન શોર્ટ્સ

માર્કેટમાં સારી ક્વોલિટીના શોર્ટ્સ ઉપલબ્ધ છે. રનિંગ, જોગિંગ, વર્કિંગ, જિમમાં વર્કઆઉટ અને યોગ કરતી વખતે શોર્ટ્સ કમ્ફર્ટબલ રહે છે. પરસેવો થતાં તે સ્કિન સાથે ચોંટતાં નથી.

યોગા પેન્ટ્સની સૌથી સારી વાત એ છે કે આ પેન્ટ્સ પરસેવાને જલદી શોષી લે છે તેથી ત્વચા સાથે સંકળાયેલી બીમારીઓ થતી નથી. તમે તમારા લુકને સ્ટાઈલિશ બનાવવા ઇચ્છો છો તો લેગિંગ્સ કે યોગા પેન્ટ્સની ઉપર શોર્ટ્સ ટી શર્ટ પહેરી શકો છો.

એક અત્યાધુનિક ચાઈનીઝ એડવાન્સ્ડ પર્સિસ્ટન્ટ ગ્રેટ (APT) દ્વારા અત્યંત-લક્ષિત એટેકના ભાગરૂપે અનામી દક્ષિણ એશિયન લક્ષ્યમાં ઘૂસણખોરી કરવા માટે આ વર્ષની શરૂઆતમાં પ્રકાશમાં આવેલા સોફોસના ફાયરવોલ પ્રોડક્ટમાં સુરક્ષાની ગંભીર નબળાઈનો ઉપયોગ કર્યો હતો.

એટેક્સ એક રસપ્રદ વેબ શેલ બેકડોર અમલમાં મૂકે છે. બેકડોરમાંથી મલ્ટીપલ વોર્મ્સ બને છે અને સીસ્ટમમાં ફેલાય છે અને અંતે એટેક શરૂ થાય છે. વોલેક્સિટીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે આ એટેકનો ઉદ્દેશ્ય સંસ્થાની જાહેર વેબસાઈટ્સને હોસ્ટ કરતા ક્લાઉડ-હોસ્ટેડ વેબ સર્વિસને વધુ ભંગ કરવાનો હતો.

પ્રશ્નમાં શૂન્ય-દિવસની ખામીને CVE-2022-1040 (CVSS સ્કોર: 9.8) તરીકે ટ્રેક કરવામાં આવે છે. તે ઓથેન્ટિકેશન બાયપાસ કરી રિમોટ કોડ એક્ઝીક્યુશન પ્રક્રિયા શરૂ કરે છે. તે સોફોસ ફાયરવોલ વર્ઝન 18.5 MR3 (18.5.3) અને તેના પહેલાના વર્ઝનને અસર કરે છે.

સાયબર સિક્યુરિટી ફર્મ, જેણે 25 માર્ચ 2022 ના રોજ ખામી માટે પેચ જારી કર્યો હતો. તેણે નોંધ્યું હતું કે મુખ્યત્વે દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ચોક્કસ સંગઠનોના નાના સમૂહને લક્ષ્ય બનાવવા માટે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને તેણે અસરગ્રસ્ત સંસ્થાઓને સીધી સૂચના આપી હતી. હવે વોલેક્સિટી અનુસાર, ખામીના શોષણના પ્રારંભિક પુરાવા માર્ચ 5, 2022 ના રોજ શરૂ થયા હતા. જ્યારે તેને અનામી યુઝર્સના સોફોસ ફાયરવોલમાંથી ઉદભવતી વિસંગત નેટવર્ક પ્રવૃત્તિ શોધી કાઢવામાં આવી હતી. જે તે સમયના અદ્યતન સંસ્કરણને ચલાવે છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે એટેક્સ મેન-ઈન-ધ-મિડલ (MitM) એટેક કરવા માટે ફાયરવોલની એક્સેસનો ઉપયોગ કરી રહ્યો હતો. એટેક્સ એ આ MitM

સોફોસ ફાયરવોલ ઝીરો-ડે ફ્લો

દુમલાઓમાંથી એકત્ર કરાયેલ ડેટાનો ઉપયોગ નેટવર્કની બહાર જ્યાં ફાયરવોલ રહેતી હતી તે વધારાની સિસ્ટમ સાથે સમાધાન કરવા માટે કર્યો હતો. ફાયરવોલના ભંગ પછી એક્ટિવીટી કમમાં પાછળના ભાગમાં સુરક્ષા સોફ્ટવેરના કાયદેસરના ઘટકને બેકડોરિંગ વેબ શેલ સાથે જોડવામાં આવે છે જે એટેક્સની પસંદગીના કોઈપણ URL પરથી રીમોટ એક્સેસ કરી શકાય છે. નોંધનીય



છે કે Behinder વેબ શેલનો પણ આ મહિનાની શરૂઆતમાં ચાઈનીઝ એપીટી ગ્રુપ દ્વારા એટલાસિયન કન્ફ્લુઅન્સ સર્વર સિસ્ટમ્સ (CVE-2022-26134) માં શૂન્ય-દિવસની ખામીનો ઉપયોગ કરીને ઘૂસણખોરોના અલગ સેટમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એટેક્સ ખાસ લક્ષિત વેબસાઈટ્સ - મુખ્યત્વે પીડિતની કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) user credentials અને session cookies ને અટકાવવાના ધ્યેય સાથે DNS સર્વરને સંશોધિત કરવા આગળ વધતા પહેલા રીમોટ એક્સેસની સુવિધા માટે VPN વપરાશકર્તા એકાઉન્ટ્સ બનાવ્યા હોવાનું કહેવાય છે. Session cookies ના એક્સેસ પછીથી દૂષિત પક્ષને વર્ડપ્રેસ સાઈટ પર નિયંત્રણ

મેળવવા અને આઈસસ્કોર્પિયન તરીકે ઓળખાતા બીજા વેબ શેલને ઈન્સ્ટોલ કરવા માટે સજ્જ કરે છે. જેમાં એટેક્સ તેનો ઉપયોગ વેબ સર્વર પર ત્રણ ઓપન-સોર્સ ઈમ્પ્લાન્ટ્સ જમાવવા માટે કરે છે, જેમાં PupyRAT, Pantegana અને Sliverનો સમાવેશ થાય છે.

ડ્રિફ્ટિંગક્લાઉડ એક અસરકારક, સુસજ્જ અને સતત જોખમી એટેક છે. જે five-poisons સંબંધિત લક્ષ્યોને લક્ષ્યાંકિત કરે છે. તેઓ તેમના લક્ષ્યોને હાંસલ કરવા માટે શૂન્ય-દિવસના શોષણ વિકસાવવા અથવા ખરીદવા માટે સક્ષમ છે. જ્યારે લક્ષ્ય નેટવર્ક્સ પર પ્રવેશ મેળવવાની વાત આવે છે ત્યારે તેમની તરફેણમાં બેકડોરને એક્ટીવ કરી રીમોટ એક્સેસ લઈ શકે છે.

સોફોસે ખામીનો લાભ લઈને કેટલાક ઘૂસણખોરોની સ્વતંત્ર તપાસમાં બે અનામી એડવાન્સ્ડ પર્સિસ્ટન્ટ ગ્રેટ (APT) ગ્રુપ તરફ આંગળી ચીંધી છે. જે બંનેએ GoMet અને Ghost RAT જેવા રિમોટ એક્સેસ ટૂલ્સને છોડવા માટે એક મેલીસિયસ કોડ રચ્યો હતો. એટેક્સ એ બગનો ઉપયોગ ડીવાઈસમાં મેલીસિયસ ફાઈલો મૂકવા માટે કર્યો હતો. વધુમાં ડીવાઈસને બંધ કરવા, પુનઃપ્રારંભ કરવા, કેટલીક સેવાઓને ટ્રિગર કરવી જેવા કાર્ય રિમોટ એક્સેસ દ્વારા સંભવ હતા. સોફોસના મુખ્ય સંશોધક એન્ડ્ર્યુ બ્રાઉને જણાવ્યું હતું કે આ પગલાથી ઉપકરણને ત્યાં મૂકવામાં આવેલી ફાઈલોને એક્ઝીક્યુટ કરવા માટે કારણભૂત છે. અને અમારું માનવું છે કે એટેક્સ દ્વારા એક સમર્પિત હેન્ડ-ઓન-ક્રીબોર્ડ એટેક્સ કરવામાં આવ્યો હતો. જેણે ઉપકરણ ફર્મવેરને રિવર્સ-એન્જિનિયર કર્યું હતું.

beinghumanmj

અપનાવો આ ઘરેલું ઉપચાર

- લીમડાના પાનનો રસ નિયમિત લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થશે.
- ઘરથી પરના ડાઘાને દૂર કરવા ભીના કપડા પર બેકિંગ સોડા લગાડી ઘરથી પર રગડવું.
- કાચના વાસણ પરથી ડાઘા દૂર કરવા બે લિટર પાણીમાં કોસ્ટિક સોડા નાખી રાતે વાસણ પલાળવા સવારે પાણીથી ઘોંઘ નાખવું.
- રસોડામાંથી મસાલાની ગંધ દૂર કરવા એક ડિશમાં વિનેગાર રાખવાથી તે ગંધ ચૂસી લેશે.
- સંધિવાથી રાહત મેળવવા લવિંગના તેલથી હળવે માલિશ કરવું.

- મનીપ્લાન્ટમાં બરફ નાખવાથી તે ઝડપથી વધે છે તેમજ તાણે રહે છે.
- લાલ મરચું વાટતી વખતે તેમાં સહેજ સરસિયું ભેળવવાથી રંગ ઘેરો લાલ બને છે.
- સમોસા બનાવવાના મેંદાના લોટમાં થોડો ફ્લોરિડ ભેળવવાથી પડ કડક થાય છે.
- લોખંડની છરી પરનો કાટ દૂર કરવા થોડી વાર કાંદાના રસમાં ડૂબાડી રાખી પછી સાફ કરવું,
- સવારની કઠીને સાંજ સુધી તાજી રાખવા તેમાં

- એક ટેબલસ્પૂન લીંબુનો રસ ભેળવવો.
- છરી વાગી જતાં જખમ થાય કે તરત જ તેના પર ફટકડી લગાવવાથી લોહી વહેતું બંધ થશે તેમજ ઇન્ફેક્શન નહીં થાય.
- સાબુદાણાની ખીચડીમાં સીંગદાણા કચકચા રાખવાથી સ્વાદિષ્ટ સાથે દેખાવ સારો લાગે છે.
- લસણને છોલી તેમાં મીઠું ભેલવી શીશીમાં રાખવાથી લાંબા સમય સુધી તાજું રહેશે.
- અડધી બાલદી પાણીમાં ચાર ચમચા વિનેગાર ભેળવી જીન્સ ઘોવાથી જીન્સ જલદી ઝાંખુ પડતું નથી.

શીર્ષક : હરિ
કવચિત્રી : હિના મોદી

હરિ !
તમે વસ્ત્રા વાદળે
ને,
પંખી થાયે મારું મન.
હરિ !
તમે મલકાયા ગગને
ને,
ત્યાં પહોંચે મારું મન.
અંતરનાં પાનેતરે ભયાં
મબલમ મબલમ નવરંગ
નર્તન કરે હૈયું
હરિ !
તમારા સંગ.
પાનેતરની કોરે ટાંકી
મનહર મનહર ટીલડી
રેશમ ગાંઠે બાંધી
હરિ !
તમારી પ્રીતડી.
પવનનાં પગરવે પહેર્યા
ઝણા ઝાંઝર ઝણકાર
કિર્તન કરે હૈયું
હરિ !
તારા નામ તણા રણકાર.
વૃક્ષ -વૃક્ષની ડાળે ડાળે
ફાલ્યાં
મધૂર ફૂલડાં
સૌરભ સમાયાં હેચે
હરિ !
તારી લીલા તણાં હાલરડાં
સમીર સુંવાળાં સ્પર્શથી જઈ
પહોંચું
હરિ !
તારી પાસ.
રંગેરૂપે અદૃશ્ય તું
હરિ !
કેમ કરી સેવું તારી આશ !

સૌરાષ્ટ્રની બેઠકો પર ભાજપના પ્રભારી નીમાયા

રાજકોટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી અન્વયે સૌરાષ્ટ્રની 48 ધારાસભા બેઠકો માટે આજે પ્રદેશ ભાજપે બેઠક દીઠ પ્રભારીની નિયુક્તિ કરી છે સૂત્રો અનુસાર (1) રાજકોટ જિલ્લામાં રાજકોટ પૂર્વમાં પ્રદિપ વાળા, પશ્ચિમ બેઠક પર લાલજી સોલંકી, દક્ષિણમાં વસુબેન ત્રિવેદી, ગ્રામ્યમાં ચંદ્રેશ પટેલ, જસદણમાં ભગવાનજી કરગટીયા, ગોંડલમાં હર્ષદ દવે, જેતપુરમાં વિનું કથીરીયા, ધોરાજીમાં સંજય કોરડીયા (2) કાલાવડમાં નીલેશ ઉદાણી, જામનગર ગ્રામ્યમાં નિર્મળ સમાણી, જામનગર ઉત્તરમાં હિરેન પારેખ (મોરબી), જામનગર દક્ષિણમાં ચંદ્રેશ હેરમા, જામજોધપુરમાં સુરેશ

વસરા (3) મોરબીમાં દિલિપસિંહ ચુડાસમા, ટંકારામાં ઘનશ્યામ ગોહિલ, વાંકાનેરમાં લાલજી સાવલિયા (4) સુરેન્દ્રનગર જિ.ના દસાડામાં રજની સંઘાણી, લીંબડીમાં અનિલ ગોહિલ, વઢવાણમાં ગૌતમ ગોસ્વામી, ચોટીલામાં ગણપતસિંહ જાડેજા, ધ્રાંગધ્રામાં વલ્લભ દુધાત્રા (5) દારકામાં હસમુખ હિંડોયા, ખંભાળિયામાં નીલેશ ઓડેરાની (6) પોરબંદરમાં મહેન્દ્ર પીઠીયા, કુતિયાણામાં ચીમન સાપરીયા (7) જુનાગઢ જિ.માં માણાવદરમાં દિલિપસિંહ બારડ, જુનાગઢમાં ડો.વિનોદ ભંડેરી, વિસાવદરમાં બાપોદરા (પોરબંદર), કેશોદમાં વિજય કોરાટ, માંગરોળમાં ગૌરવ રૂપારેલિયાની (8) ગીર સોમનાથ

જિ.માં સોમનાથમાં વિક્રમ ઓડેરા, તલાલામાં જે.કે.ચાવડા, કોડીનારમાં વી.વી.વઘાસિયા, ઉનામાં કાળુ વિરાણી (9) અમરેલી જિલ્લામાં ધારીમાં હિંમત પડશાળા, અમરેલીમાં રાજુ બાંભણીયા, લાઠીમાં સી.પી.સરવૈયા, સાવરકુંડલામાં વિજય ભગત, રાજુલામાં ભરત મેર (10) ભાવનગર જિલ્લામાં મહુવામાં ભરતસિંહ ગોહિલ, તળાજામાં અમોહ શાહ, ગારીયાધરમાં સુરેશ ધાંધલિયા, પાલીતાણામાં મયુર માંજેરીયા, ભાવનગર ગ્રામ્યમાં વનરાજસિંહ ડાભી, ભાવનગર પૂર્વમાં રિતેશ સોની અને પશ્ચિમમાં દિલિપ સેટા (11) બોટાદ જિલ્લામાં ગઢડામાં યોગેન્દ્રસિંહ ગોહીલ અને બોટાદમાં દિલિપ પટેલ(સુ. નગરના)ની નિયુક્તિ કરાઈ છે.

આશારામના ભાણિયાએ ખેડતને જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ

મોટેરામાં આવેલી જમીનના મામલે અદાવત રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મોટેરામાં આવેલા પુજી વાસમાં રહેતા સંદીપ ઠાકોરે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે કમલ નંદવાણી (રહે.સુઘડ) એ હેતલ વોરા અને વિજય ઉર્ફે દીપુ ચૌહાણએ ગત ૧૮મી તારીખે વોટ્સએપ પર વિડીયો કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેને મારવા માટે શાર્પ શુટર

મોકલીને ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાનું કહ્યું હતું. કમલ નંદવાણી આશારામનો ભાણિયો હોવાનું જાણવા મળ્યું છે. સંદીપ ઠાકોરના પિતરાઈભાઈ લાલા ઠાકોરની જમીન મોટેરામાં આવેલી હતી. જેના પર તેણે ઓરડી બનાવીને ભાડે આપી હતી. જો કે લાલા ઠાકોરનું ગત વર્ષે કોરોનાને કારણે અવસાન થતા જમીન સંદીપ ઠાકોર સાચવતો હતો. જે જમીનના વિવાદને લઈને લાલા ઠાકોર પર અગાઉ ફાયરિંગ કરાયું હતું. બાદમાં સંદીપ ઠાકોરને આ બાબતને લઈને ધમકી આપવામાં આવતી હતી.

રથયાત્રાના રૂટ પર ડ્રોન અને ટીમ સાથે ચેકીંગ

અમદાવાદ

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. રથયાત્રાના રૂટ પર તેમજ મંદિર પરિસરમાં ચેકીંગ હાથ ધરાયુ છે. અમદાવાદ કાર્થમ બ્રાન્ચ તેમજ પોલીસ દ્વારા, 3 BDDS, 2 ડોગ સ્કોડની ટિમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું. સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન મારફતે ધાબા પોઈન્ટ પર ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસ પણ આ રથયાત્રામાં સુરક્ષા અંગે કોઈ ખામી ના રહી જાય તેની તકેદારી રાખી રહી છે.

અર્થતંત્રને પાંચ લાખ કરોડનું કરવા કેમિકલ ઉદ્યોગને પર્યાવરણની મંજૂરી અપાવવા માંગ

મનસુખ માંડવીયાની ગુજરાત ચેમ્બરમાં કેમિકલ ઉદ્યોગ સંચાલકો સાથે ચર્ચા

અમદાવાદ

દેશના અર્થતંત્રને ૫ લાખ કરોડનું કરવા માટે કેમિકલ ઉદ્યોગના નવા પ્રોજેક્ટ્સને મંજૂરી મેળવવામાં એટલે કે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ આપવામાં ૧૮થી ૨૪ મહિના લગાડવામાં આવે છે તે સમયગાળો ઘટાડીને ૬ મહિનાથી ઓછો કરી આપવાની માગણી ગુજરાતનું કેમિકલ ઉદ્યોગે ગુજરાત ચેમ્બરમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા સાથે થયેલી ચર્ચા દરમિયાન થઈ હતી. તેની સાથે જ દરિયામાં દૂષિત

પાણી છોડવા માટેની પાઈપ લાઈન નાખવાની મંજૂરી થયેલી યોજનાના અમલીકરણને ઝડપી બનાવવા રજૂઆત થઈ હતી. ડીપ દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડની ઊંચાઈ લજવા માટે કેન્દ્ર સરકારે તો સૌથી પહેલા ડીપ સી ડિસ્ચાર્જની વરસોથી અપાયેલી મંજૂરીનો અમલ ચાલુ કરવો જોઈએ. ૩૧મી માર્ચ ૨૦૨૧ના યોજાયેલી બેઠકમાં ડીપ સી ડિસ્ચાર્જની દરખાસ્ત મંજૂર થઈ ગયેલી છે. આ પાઈપલાઈન

બિછાવવાથી અમદાવાદ, વડોદરા વિસ્તારના કેમિકલ ઉદ્યોગોને ખાસ્સી રાહત થઈ જશે. એમ ગુજરાત ડાયસ્ટર્ક મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ યોગેશ પરીખે જણાવ્યું હતું. એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સની સમસ્યા હળવી કરવી જોઈએ. કેમેકસિલના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાતના કેમિકલ ઉદ્યોગની દરેક વસાહતોના પાણીના નિકાલ માટે દરિયાઈ પાઈપલાઈન નાખવા માટે આર્થિક સહાય મળવી પણ જરૂરી છે.

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૧૯૫ પિતાએ સંતાનને કિડની આપી નવજીવન આપ્યું

રાજ્યમાં 600થી વધુ પિતાએ કિડની આપી સંતાનને મોતના મુખમાં ધકેલાતા અટકાવી દીધું

અમદાવાદ

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૯૫ પિતાએ પોતાના સંતાનને કિડનીનું દાન આપીને નવજીવન આપ્યું છે. બાળકના જન્મની સાથે માતા-પિતા માટે તેમની પ્રત્યેક ક્ષણ સંતાનને સમર્પિત થઈ જાય છે. નાણાની ખેંચ હોય તો પણ બાળકની પ્રત્યેક જરૂરિયાત પૂર્ણ કરવા તેઓ કોઈ જ કસર બાકી રાખતા નથી. આ સાથે ગુજરાતમાં એવા પણ પિતાઓ છે જેમણે પોતાની કિડનીનું દાન કરીને દીકરા અને દીકરીને નવજીવન આપ્યું

છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૯૫ અને છેલ્લા ૮ વર્ષમાં કુલ ૬૩૦થી વધુ પિતા દ્વારા પોતાના સંતાનોને કિડનીનું દાન આપવામાં આવ્યું છે. જેમાં ૫૦૦થી વધુ પુત્ર અને ૧૦૦થી વધુ પુત્રીનો સમાવેશ થાય છે. કિડનીના દાન દ્વારા પિતાએ પોતાના સંતાનોને મોતના મુખમાં ધકેલાતાથી અટકાવ્યા છે. ડોક્ટરોના મતે જ્યારે બંને કિડની ફેઈલ થઈ જાય ત્યારે તેવા સંજોગોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એક ઉપાય હોય છે. જેમાં દર્દીને માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની પોતાની એક

કિડનીનું દાન કરીને નવજીવન આપતા હોય છે. અમદાવાદની આઈકેડીઆરસી ખાતે છેલ્લા પાંચ વર્ષમાં ૪૯૫ માતાએ તેમના સંતાનોને કિડની આપીને નવજીવન આપ્યું છે. આ પૈકી ગત વર્ષે ૮૭ માતાઓ દ્વારા તેમના સંતાનોને કિડનીનું દાન આપવામાં આવ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, 'સંતાનને કિડની આપવામાં માતા મોખરે છે પરંતુ પિતા પણ પાછળ નથી.

સંક્ષિપ્ત સમાચાર

અમદાવાદની યુવતી અમેરિકામાં જજ બની

અમદાવાદ : વિદેશની ઘરતી પર ભારતની વધુ એક ઈકરચીએ ભારત દેશનું નામ રોશન કર્યું છે. જાનકી વિશ્વમોહન શર્મા જે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શ્રી રામ દરબાર પરિવારમાં જન્મેલી ભારતીય મહિલા છે. જેણે અમેરિકામાં સાતમાં વ્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ તરીકે શપથ લીધા છે. રામ ચરિત માનસ પર હાથ મૂકીને જાનકી શર્માએ શપથ લઈને અમેરિકામાં ભારત દેશનું નામ કર્યું છે. જાનકી શર્માનો અમદાવાદ સાથે પણ નાતો જોડાયેલો છે. જાનકીના ભાઈએ કહ્યું શ્રી રામ દરબાર પરિવારમાં અમારો જન્મ થયો છે. મારા દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ પણ રામાયણના ગાયક હોવાથી જાનકી નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટી થઈ છે. જાનકી 1993થી રામાયણના પાઠ કરે છે. રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ ઉપર હાથ રાખીને શપથ લીધા હતા.



અડાલજમાં પૌત્રને મળવા માટે ગયેલા સસરાને પુત્રવધૂ અને પ્રેમીએ માર માર્યો

ગાંધીનગર : અંબાપુર ગામે રહેતા રણછોડભાઈ જોઈતારામ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પુત્ર મનીષનું ગયા વર્ષે અવસાન થયું હતું. તેની પત્ની નિલમ અને પૌત્ર પૂજન સાથે તેઓ અડાલજના શ્રીનાથ સોસાયટીમાં રહેતા હતા. જોકે પુત્રવધૂ જમવાનું આપતી નહોતી અને રાખવા માંગતી ન હોવાથી તે પુત્રી ના ઘરે રહેવા માટે ગયા હતા. આ દરમિયાન ગઈકાલે તેમને પૌત્ર પૂજનની યાદ આવતા તેમના જમાઈ તેમજ સગા સાથે અડાલજના શ્રીનાથ સોસાયટીના મકાનમાં ગયા હતા. જ્યાં ઘરમાં પૌત્ર પૂજન, પુત્રવધૂ નીલમ તેમજ અન્યપુત્રુ હાજર હતો. જેથી આ બાબતે રણછોડભાઈ પૂછતા નીલમએ કહ્યું હતું કે આ વ્યક્તિ સાથે કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા છે તેનું નામ નિલેશ રમેશભાઈ પટેલ છે. મારી મરજીથી મેં લગ્ન કર્યા છે. જેથી રણછોડભાઈએ તેણીને ઘર ખાલી કરી દેવા માટે કહ્યું હતું. જોકે નીલમ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે કહ્યું હતું કે આ ઘર મારા પિતાએ લીધું છે. હું ઘર ખાલી નહીં કરું અને તેમ કહી નીલમ અને તેની સાથે રહેલા નીલેશએ વૃદ્ધ રણછોડભાઈને ગડદા પાટુ માર માર્યો હતો. ફરિયાદ અહીં નહીં આવવા માટે પણ ધમકી આપી હતી.



વિશ્વ યોગ દિવસ: અમદાવાદમાં પ્રથમ વખત બાઈક પર યોગના પ્રયોગો કર્યા

અમદાવાદ: 21મીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં પહેલીવાર મોટરસાઈકલ ઉપર લોકોએ યોગ કર્યા હતા. મહિનગરની 'ધ થર્ડ આઈ' યોગાની ટીમે મોટરસાઈકલ પર યોગ-પ્રાણાયામ સેશનનું આયોજન કર્યું હતું. જેમાં શહેરીજનો આપુ વર્ષ આ યોગની પદ્ધતિને ફોલો કરીને સ્વસ્થ રહે તેવો મેસેજ અપાયો હતો. મહિનગરની 'ધ થર્ડ આઈ' યોગાની ટીમના 40 સભ્યોએ બાઈક-એક્ટિવા ઉપર યોગ કર્યા હતા. વિશ્વ યોગ દિન નિમિત્તે રામોલ રિંગરોડ, અદાણી સર્કલ, ગતરાણ ગામના રમતગમતના મેદાનમાં અનોખી રીતે યોગાના પ્રયોગો કર્યા છે. જેમાં 8 વર્ષથી લઈને 50 વર્ષના યુવક અને યુવતીઓ સાથે જ આદેડ વ્યક્તિઓએ વિવિધ યોગ કર્યા હતા.

સુરતમાં વરસાદ સાથે પાણીજન્ય બીમારી: ઝાડા-ઉલ્ટી થતા પાંડેસરાના યુવાનનું મોત

સુરત

ચોમાસાની તુ શરૂ થતા ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો જોવા મળે છે. ત્યારે પાંડેસરાના 21 વર્ષના યુવાનનું ઝાડા-ઉલ્ટીને લીધે મોત થયું છે. સિવિલ-સ્મીમેરમાં જુન મહિનામાં અત્યારસુધી ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, ગેસ્ટ્રોના 670 દર્દીએ સારવાર લીધી છે. નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં તેરનામ ચોકડી પાસે પુનિત નગરમાં રહેતો 21 વર્ષીય રોહિત રમેશ શર્માને શુક્રવારથી ઝાડા - ઉલ્ટી થવાની શરૂ થઈ હતી. જોકે મંગળવારે સવારે તેની તબિયત બગડતા સારવાર માટે પરિવારના સભ્યો નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

સૌરાષ્ટ્રના ખેડૂતો મોંઘવારીથી કંટાળ્યા: સરકારને સદ્બુદ્ધિ આવે અને મોંઘવારી ઘટે તે માટે યશ

રાજકોટ

ઘોરાજી ખાતે ખેડૂતોએ પેટ્રોલ-ડીઝલના સતત વધારા સામે હવન કર્યો હતો. જ્યારે અનિયમિત વીજળીને લઈને પૂજન કર્યું હતું. ખેડૂતો સતત વધતી મોંઘવારીથી કંટાળ્યા, ખેડૂતોએ ભાવ ઘટાડવાની માંગ કરી હતી. ખેડૂતોએ ખેતરમાં હવન કર્યો અને પેટ્રોલ-ડીઝલ અને ખાતરના ભાવ ઘટાડવા માટે અનોખી પુજા કરી હતી. રાજ્યમાં મોંઘવારીના મારથી લોકો પરેશાન થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને ખાતરના ભાવો સતત વધી રહ્યાં છે. જેથી ખેડૂતોને પણ ખેતી કરવી પરવડે તેમ નથી. તો બીજી તરફ સમયસર ખેતરમાં વીજળી પણ મળતી નથી. જેથી કંટાળીને

ખેડૂતોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ખેતરમાં હવન કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજરોજ રાજકોટ જિલ્લાના ઘોરાજીના ખેડૂતોએ અલગ જ અંદાજમાં વિરોધ પ્રદર્શન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેમા ખેતરમાં હવન કર્યો તેમજ વીજ પોલ પાસે પૂજન આરતી શ્રીફળ ફોડી સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા અને વાત પહોંચાડવા આ કીમિયો ખેડૂતોએ અપનાવ્યો હતો. ખેતરમા ખેડૂતો એકઠા થઈને પેટ્રોલ, ડીઝલ અને ખાતરના ભાવો ઘટાડો અને સમયસર ખેત વિજળી આપો તેવા સુત્રોચ્ચાર કર્યા

હતા.ગુજરાતમાં દિન પ્રતિદિન પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર અને ખાતરના ભાવો વધી રહ્યા છે ત્યારે આ મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ પરીવાર હેરાન પરેશાન થાય છે તો પરીવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ પણ એક મોટો પ્રશ્ન છે. મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. વાહન ચાલકો પણ ચિંતિત થયા છે તો ગુજરાતના ધરતીપુત્રો પણ બાકાત નથી. પેટ્રોલ ડીઝલ મોંઘુ થતુ જાય છે, ખાતરના ભાવો વધતા જાય છે ત્યારે ખેડૂતોને ખેતી કરવી પોસાય તેમ નથી. તનતોડ મહેનત કરી ખેડૂતો પાક ઊભા કરતા હોય છે ત્યારે મોંઘવારી તથા પેટ્રોલ ડીઝલના ભાવોમાં તોતીંગ થતા ખેડૂતો ચિંતિત થઈ ગયા છે.

ક્લાસીફાઈડ / CLASSIFIED
STUDENTS PART TIME OR FULL TIME
REQUIRED FOR THE PACKAGING
INDUSTRY IN SCARBOROUGH
- :: CONTACT ::-
tpparikh@hotmail.com

ગુજરાતના પદ તાલુકામાં આવી મેઘરાજાની સવારી

અમદાવાદ: ગુજરાતમાં બુધવારે પદ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌથી વધુ સુરતના કામરેજમાં ૩.૪૪ ઈંચ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના ડાંગ,વલસાડ, તાપી, સુરતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રપથી ૨૬ જૂને વરસાદનું જોર વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે.

નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ વે પર ફાર આઈસર પાછળ ઘૂસી જતાં ત્રણનાં મોત

નડિયાદ

સુરતના પુણા ગામ ખાતે ચંદ્રકાંત ડાયાભાઈ સુરતી પોતાના પરિવાર સાથે રહે છે. તેઓને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. શનિવારે સવારે ચંદ્રકાંતભાઈ પોતાના પરિવાર સાથે પોતાની કાર લઈ સુરતથી અમદાવાદ જવા નીકળ્યા હતા. તેઓની સાથે તેમના મિત્ર નરેશભાઈ રમેશભાઈ પટેલ (ઉંમર વર્ષ ૪૭) પણ અમદાવાદ આવવા ગાડીમાં બેઠા હતા. તેઓ સવારે ૧૧ વાગ્યાની આસપાસ નડિયાદ પસાર કરી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. તેઓની કાર સૂંઢા

વણસોલ ગામની સીમમાંથી પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે રોડ પર ઉભેલા એક આઈસર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા ગાડીના આગળના ભાગનો કચ્છરઘાણ વળી ગયો હતો. જેથી ગાડીના ચાલક ચંદ્રકાંતભાઈ સુરતી, નરેશભાઈ પટેલ તથા દક્ષ ચંદ્રકાંતભાઈ સુરતીને શરીરે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર સુખાબેન ચંદ્રકાંતભાઈ સુરતી, ત્રિશા બેન ચંદ્રકાંતભાઈ સુરતી તથા કિષ્નાબેન ચંદ્રકાંતભાઈ સુરતી ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ગુજકોમાસોલનું નેતૃત્વ નવાને ચહેરાને સોંપાય તેવી સંભાવના ગુજકોમાસોલની ચૂંટણી પછી ચેરમેન, વાઈસ ચેરમેનના હોદ્દા માટે ખેંચતાણ

અમદાવાદ

ગુજકોમાસોલની પૂરી થયેલી ચૂંટણીને અંતે ભાજપને ૩૨ બેઠકો પર વિજય મળ્યો તે પછી સંસ્થાના ચેરમેન અને વાઈસ ચેરમેનના હોદ્દા પરથી જૂના હોદ્દેદારોને ખસેડીને નવા હોદ્દેદારોને સ્થાન આપવામાં આવે તેવી સંભાવના રહેલી છે. અત્યારે તેના ચેરમેન તરીકે દિલીપ સાંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે ગોવિન્દસિંહ સેવા આપી રહ્યા છે. તેમને સ્થાને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. બીજીતરફ સુરતની બેન્ક સંભાળી રહેલા નરેશ પટેલ કદાચ વાઈસ ચેરમેનના હોદ્દા માટે દાવેદારી કરી શકે છે.

13 મંડળીઓને મતદાન સામે રસ્તે

ગુજકોમાસોલની મતદાર યાદીમાં ઉમેરવામાં આવેલી મંડળીઓને મતદાન કરવા દેવા પર બોર્ડ ઓફ નોમિનીમાંથી સ્ટે મેળવી લેવામાં આવતા તેઓ મતદાનથી વંચિત રહ્યા હતા. તેને કારણે ૧૧ ખેડાની બેઠક પરથી દીરુભા ચાવડાનો પરાજય થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેડા જિલ્લામાં ૧૩ સહકારી મંડળીઓને મતદાનથી વંચિત કરી દેવાઈ હતી. આ ૧૧ રીતે છોટા ઉંદેપુરની ૧૬ મંડળીઓને મતદાન કરવા સામે સ્ટે મેળવવામાં આવ્યો હતો. જામનગરની ૫, ભાવનગરની ૩ મંડળીઓને મતદાન કરવાથી દૂર રાખવા માટે બોર્ડ ઓફ નોમિનીમાંથી સ્ટે મેળવવામાં આવ્યો હતો.

ગુજરાતમાં ફરી માસ્ક ફરજિયાત : શાળાઓમાં બાળકો માટે પણ નિયમો

રાજકોટ

ભારતની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએથી સૌથી વધુ કેસ પકડાઈ રહ્યાં છે તેથી સરકાર અને સ્વાસ્થ્ય વિભાગો દ્વારા માસ્ક અવશ્ય પહેરવાનું સૂચન કરાયું છે પરંતુ હવે ગુજરાતની આ જિલ્લા અને શહેરમાં વિદ્યાર્થીઓને માસ્ક ફરજિયાત પહેરવા આદેશ કરાયો છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ કોરોના કેસ વધતા ઝડપી નિર્ણય કર્યો છે. આદેશ અનુસાર વિદ્યાર્થીઓ શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જ આવવા સૂચન કરાયું છે. કોરોનાના કેસ ઘટતા અગાઉ અમુક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ હવે ફરી કોરોનાની આશંકિત નવી લહેરને પગલે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે અને તેનું કડક અમલીકરણ કરાવવા પણ આદેશ કરાયો છે.

પાલિતાણા પાલિકામાં ભાજપના ત્રણ સભ્યએ રાજીનામા આપતા ખળભળાટ

પાલિતાણા

ભાવનગર જિલ્લાની પાલિતાણા નગરપાલિકાના ભાજપના ૩ નગરસેવકોએ આજે મંગળવારે અચાનક રાજીનામા આપી દેતા ખળભળાટ મચી જવા પામેલ છે. પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. પ્રમુખ તરીકે મહિલા શિલાબેન વસંતભાઈ શેઠ અને ઉપપ્રમુખ તરીકે મિલનભાઈ કે રાઠોડ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપના કોર્પોરેટરોમાં અંદોરો અંદર વિખવાદ ચાલી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર-૧ના ત્રણ કોર્પોરેટરો અજયભાઈ રાજુભાઈ જોષી, રોશનબેન રસુલભાઈ અબડા, કિરણબેન ગોવિંદમલ

કુકરોજા વગેરેએ અચાનક લેખીતમાં ચીફ ઓફિસરને રાજીનામા ધરી દેતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી અંદરોઅંદર ખટપટ ચાલી રહી છે. ભાજપના ત્રણ નગરસેવકે અચાનક રાજીનામ આપતા સંગઠનમાં દોડધામ મચી જવા પામી છે. એક જ વોર્ડના ત્રણ નગરસેવકે રાજીનામા આપ્યા છે પરંતુ રાજીનામા કયાં કારણોસર આપ્યા તે જાણવા મળેલ નથી. નગરસેવકોના વોર્ડમાં વિકાસના કામો ઓછા ફાળવવા તેમજ લોકોની ફરિયાદો હલ ના થતી હોય સહિતના કારણો હોય શકે છે તેવી લોકમુખે ચર્ચા છે.

વડાપ્રધાને ઉજવ્યો માતા હીરાબાનો 100મો જન્મદિવસ, પગ ધોઈને શાલ ઓઢાડી



ગાંધીનગર

હીરાબાના 100માં જન્મદિવસે ગાંધીનગર ખાતે સવારે ૦૬:૩૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના આશીર્વાદ લઈને તેમની પૂજા-અર્ચના પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ માતાના જન્મદિવસ પર તેમના પગ ધોઈને તેમને શાલ ઓઢાડી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા.

મહેસાણા જિલ્લાને સાંકળતા રેલવેના 4 કામોના મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ

મહેસાણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા જિલ્લાના રેલવે લગતા વિવિધ વિકાસ કામોનું શનિવારે ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જે અંગનો ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત રેલવેના કામોનો ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ મહેસાણા રેલવે સ્ટેશ ખાતે યોજાયો હતો. સાંસદ શારદાબેન પટેલ દ્વારા એપ્રિલ મહિનામાં ડીમાન્ડ ફોર ગ્રાન્ટ અંતર્ગત મહેસાણા જિલ્લાના ૪ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ ફાળવવા કરેલી રજૂઆતના અનુસંધાને રેલવે મંત્રાલયે મંજૂર કર્યા હતા. જે અંતર્ગત રૂપિયા ૫૩૭ કરોડના ૬૫

કિલોમીટર લંબાઈ ધરાવતી મહેસાણા-પાલનપુરની ડબલીંગ લાઈન, રૂપિયા ૪૧૫ કરોડનાખર્ચે ૪૧ કિલોમીટર લાંબી વિજાપુર-આંબલિયાસણ રેલવે લાઈનનું ગેજપરિવર્તન, રૂપિયા ૩૪૭ કરોડના ખર્ચે ૩૭ કિલોમીટરની કલોલ-કડી-કટોસણ લાઈનનું ગેજ પરિવર્તન, રૂપિયા ૪૧૭ કરોડના ખર્ચે ૩૮ કિલોમીટર લાંબી મોટીઆદરજ-વિજાપુર લાઈનનું ગેજ પરિવર્તન અને પાલનપુર-રાધનપુરની ૧૧૪ કિલોમીટર રેલવે લાઈનના ડબલીંગ પ્રોજેક્ટનો ઈ-શિલાન્યાસ વડોદરાથી વડાપ્રધાન દ્વારા કરાયો હતો.

ગુજરાત ચેમ્બરની ચૂંટણી યોજાયા વિના જ નવી ફારોબારી રચાવાની સંભાવના

જુનિયર વાઈસ પ્રેસિડન્ટ માટે યોગેશ પરીખ સામે પણ કોઈ જ ન ઊભું રહ્યું

અમદાવાદ

ગુજરાત ચેમ્બરની ફારોબારીના ૨૪ સભ્યો માટે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિને ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કના ચેરમેન અજય પટેલે સિનિયર વાઈસ પ્રેસિડન્ટપદ માટે ઉમેદવારી નોંધાવતા અને અને અન્ય સંભવિત ઉમેદવારોએ તેમની સિનિયોરીટીને ધ્યાનમાં લઈને ફોર્મ ન ભરવાનું પસંદ કરતાં તેઓ બિનહરીફ ચૂંટાઈ

આવ્યા છે. બીજીતરફ જુનિયર વાઈસ પ્રેસિડન્ટપદના ઉમેદવાર તરીકે યોગેશ પરીખ સામે પણ અન્ય કોઈ જ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યું નહોતું. જોકે છેલ્લા બે ત્રણ દિવસથી અજય પટેલ ચૂંટણી લડવાના છે તેવી વાતો વહેતી થઈ હતી, પરંતુ અજય પટેલે છેલ્લી ઘડી સુધી ફોર્મ પણ ન લીધું હોવાથી તેઓ ચૂંટણી લડશે કે કેમ તે અંગે નિશ્ચિતતા જણાતી નહોતી.

અજય પટેલે આ ગાળા દરમિયાન સિનિયર વાઈસ પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડવા ઈચ્છુકો સાથે તેમની વાતચીત પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ વાતચીત દરમિયાન સર્વસમંતિ સધાતા અન્ય ઉમેદવારોએ ફોર્મ ભર્યા જ નહોતા. તેમના નામ પર સર્વસમંતિ સધાઈ તે પછી જ તેમણે ઉમેદવારીપત્રક ભર્યું હતું. જુનિયર વાઈસ પ્રેસિડન્ટના હોદ્દા પર યોગેશ પરીખ બિનહરીફ થયા હતા.

ગુવાહાટીમાં શિંદેનું 42 ધારાસભ્ય સાથે શક્તિપ્રદર્શન

ગુવાહાટી

ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને નેતા એકનાથ શિંદેએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. એકનાથ શિંદેએ વીડિયો અને તસવીરો જાહેર કરીને તેમને 42 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. હાલ શિંદે સાથે મહારાષ્ટ્રના 42 બળવાખોર ધારાસભ્ય છે. જેમાં શિવસેનાના 35 ધારાસભ્ય અને સાત અપક્ષ ધારાસભ્ય સામેલ છે. તમામ ધારાસભ્યો હાલ ગુવાહાટીને રેડિસન બ્લૂ હોટલમાં છે.

એકનાથ શિંદે હવે સમર્થનમાં હોય તેવા ધારાસભ્યોની યાદી જાહેર કરશે. તેમણે 41 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. જોકે, પ્રથમ યાદીમાં 36 ધારાસભ્યના નામ છે. એકનાથ શિંદે કેમ્પ હવે શિવસેનાના સિમ્બોલ પર દાવો ઠોકવાની તૈયારીમાં છે.


શિવસેનાના MLAની હોટલ બહાર ટીએમસી કાર્યકરોએ ઘરણાં કર્યા

ગુવાહાટી ખાતે શિવસેનાના ધારાસભ્યો ગુવાહાટીની જે હોટેલમાં રોકાયા છે તેના સામે ટીએમસીના નેતાઓ તથા કાર્યકરો ઘરણા પર બેસી ગયા હતા. તેમના કહેવા પ્રમાણે આસામ હાલ ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે અને અહીં રાજકારણ ચાલી રહ્યું છે. આ બંધી રાજનીતિ મહારાષ્ટ્રમાં થવી જોઈએ. ટીએમસીના એક કાર્યકરે જણાવ્યું કે, આસામના આશરે ૨૦ લાખ લોકો પૂરથી પ્રભાવિત છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી મહારાષ્ટ્ર સરકારને પાડી દેવા પ્રયત્નો કરવામાં વ્યસ્ત છે.

MLA કેન્દ્રીય એજન્સીના રડાર ઉપર

ઠાકરેની સરકાર પર જે સંકટ ઘેરાયું છે તેના માટે શિવસેના સાંસદ સંજય રાઉત કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગને જવાબદાર ઠેરવી રહ્યા છે. જોકે તેમાં અમુક અંશે સત્ય જણાઈ રહ્યું છે કારણ કે, એકનાથ શિંદે સાથે મળીને બળવો પોકારનારા શિવસેનાના પ્રતાપ સરનાઈક તથા ચામિની જાદવ કેન્દ્રીય એજન્સીઓની રડાર પર છે. રાજકીય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કેન્દ્રીય એજન્સીઓના પ્રકોપથી બચવા માટે જ ધારાસભ્યોએ બળવાનો રસ્તો અપનાવ્યો છે. તેમને એવો વિશ્વાસ છે કે, રાજ્યમાં ભાજપ સાથે સરકાર બનાવવાથી તેઓ તપાસ એજન્સીઓની રડારમાંથી બચી શકે છે.

આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ નકલી ક્રિપ્ટો એક્સચેન્જથી ભારતીય રાષ્ટ્રપતિપદ માટે NDAનાં ઉમેદવાર

નવી દિલ્હી

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ પછી હવે ભાજપના નેતૃત્વમાં એનડીએએ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી માટે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડાએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હશે.

સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને

દ્રૌપદી મુર્મૂના નામ પર સંમતી સધાઈ હતી. ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાનું હતું. જેપી નડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. આ વખતે પૂર્વીય ભારતમાંથી કોઈને તક આપવા અંગે સંસદીય બોર્ડમાં સહમતી બની હતી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે દેશને હજી સુધી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. એવામાં બેઠક પછી દ્રૌપદી મુર્મૂના નામ પર બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી.

નકલી ક્રિપ્ટો એક્સચેન્જથી ભારતીય રોકાણકારોને રૂ.1000 કરોડનો ચૂનો

નવી દિલ્હી

વૈશ્વિક પરિબળોના પગલે ક્રિપ્ટોકરન્સીમાં હાલ ભારે મંદી ચાલી રહી છે અને રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે ત્યારે નકલી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પણ સામે આવ્યું છે, જ્યાં રોકાણકારો સાથે છેતરપિંડી આચરવામાં આવી અને આ એક્સચેન્જમાં ભારતીયોએ અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડ ગુમાવ્યા છે.

સાઈબર સિક્યોરિટી કંપની ક્વાઉડએસઈકેએ કહ્યું કે, નકલી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જના અનેક ડોમેન્સ

અને એન્ડ્રોઈડ આધારિત ફેક ક્રિપ્ટો એપની ઓળખ કરવામાં આવી છે, જ્યાં આ પ્રકારના નકલી કેમ્પેનમાં મોટાપાયા પર છેતરપિંડી કરાય છે. ક્રિપ્ટો એક્સચેન્જના નામે એક નવી નકલી વેબસાઈટ કોઈનએગ બનાવાઈ છે, જે યુકે આધારિત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ છે. રોકાણકારોને આ પ્લેટફોર્મ પર રોકાણ કરવા માટે અનેક પ્રકારની લાલચ અપાય છે.

ભોગ બનેલી એક વ્યક્તિએ ક્વાઉડએસઈકેનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેને નકલી

ક્રિપ્ટો કરન્સીમાં ૫૦ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ક્વાઉડએસઈકે સંસ્થાપક અને સીઈઓ રાહુલ સસીએ કહ્યું કે ક્રિપ્ટો કૌભાંડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ બાબતોમાં નકલી ડોમેન મારફત એકદમ અસલી જેવી વેબસાઈટ બનાવાય છે. ત્યાર પછી ક્રિપ્ટો ટ્રેડિંગ માટે આમંત્રણ અપાય છે. આ પ્રકારની બાબતોમાં હુમલાખોર પીડિતનો સંપર્ક કરે છે. ત્યાર પછી મિત્રતાનો સંદેશ મોકલવામાં આવે છે અને પછી ક્રિપ્ટો માર્કેટમાં રોકાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

બાયોકોન દ્વારા લાંચ આપવાના પ્રકરણમાં જોઈન્ટ ડ્રગ કન્ટ્રોલર સહિત 5ની ધરપકડ

ઇન્સ્યુલિન દવાના પરીક્ષણમાંથી મુક્તિ માટે રૂ. ચાર લાખની લાંચ અપાઈ

નવી દિલ્હી

સીબીઆઈએ જોઈન્ટ ડ્રગ કન્ટ્રોલર ઈશ્વર રેડ્ડીને બાયોકોન બાયોલોજિક્સની ઈન્સ્યુલિન દવાના પરીક્ષણને માફ કરવાને માફ કરવા માટે કથિત રીતે ચાર લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. આ કેસમાં સીબીઆઈએ બાયોકોન બાયોલોજિક્સના એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ એલ પ્રવીણ કુમારની પણ ધરપકડ કરી છે. રેડ્ડી પર ઈન્સ્યુલીન એસ્પાર્ટ ઈન્જેક્શનના ત્રીજા તબક્કાની



ક્લિનિકલ ટ્રાયલમાંથી મુક્તિ મેળવવા માટે લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ દવા ટાઈપ-૧ અને

ટાઈપ-૨ ડાયાબિટિસને અંકુશમાં લેવા માટે વપરાતી દવા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સીબીઆઈએ સિનર્જ નેટવર્ક ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર દિનેશ દુઆની ધરપકડ કરી છે. દિનેશ દુઆએ જ રેડ્ડીને ચાર લાખ રૂપિયાની લાંચ આપી હતી. આ ઉપરાંત આ કેસમાં બાયોકોન બાયોલોજિક્સના ગુલજિત સેદી અને આસિસ્ટન્ટ ડ્રગ ઈન્સ્પેક્ટર અનિમેશ કુમારની પણ ધરપકડ કરી છે.

કાનપુર હિંસા: જફરને ફંડ આપવાના આરોપસર બાબાને કસ્ટડીમાં લેવાયા

કાનપુર

કાનપુરમાં શુક્રવારના રોજ એટલે કે, જુમાના દિવસે થયેલી હિંસા મામલે પોલીસે પ્રખ્યાત રેસ્ટોરા બાબા બિરયાનીના માલિક મુખ્તાર બાબાને કસ્ટડીમાં લીધા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે મુખ્તાર બાબાએ હિંસાના મુખ્ય આરોપી જફર હયાત હાશમીને ફંડ આપ્યું હતું.

મુખ્તાર બાબા સામે અનેક ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. એસઆઈટી દ્વારા ટૂંક સમયમાં જ આ મામલે અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે,



તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પુછપરછ દરમિયાન હિંસાના માસ્ટરમાઈન્ડ જફર હયાત હાશમીએ અનેક મોટા નામ જાહેર કર્યા હતા. તેમાં બાબા બિરયાનીનું નામ કાઉન્ટરિંગમાં સામેલ હતું.

વડાપ્રધાન મોદી 26 થી 28 જુન સુધી જર્મની અને યુએઈના પ્રવાસે જશે

નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ની વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ જર્મનીના શોલ્સ એલ્માઉની મુલાકાત લેશે. આ શિબર સંમેલનમાં યુકેન કટોકટી અને ઈન્ડો-પેસેફિકની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. જર્મની પ્રવાસ પછી ૨૮ જૂને વડાપ્રધાન મોદી યુએઈ જશે અને ત્યાં મોદી યુએઈના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક રહેલા શેખ ખલીફા બિન જાયેદ અલ નાહ્યાનના અવસાન પર વ્યક્તિગત રીતે શ્રદ્ધાંજલિ આપશે. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્જના આમંત્રણ પર જી-૭ શિબર સંમેલનમાં ભાગ લેવા માટે શોલ્સ એલ્માઉ જશે.

બસની સ્પીડ વધુ હોવાથી ચાલક તેને કાબુમાં રાખી શક્યો નહીં બિહારથી પંજાબ જતી બસ ટૂક સાથે અથડાઈ, 4ના મોત, 10 અતિ ગંભીર

કુશીનગર

ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે હાટા કોતવાલી પાસે NH 28 પર એક બસ ત્યાં પાર્ક કરેલી ટૂક સાથે અથડાઈ હતી. આ જોરદાર અથડામણમાં બસમાં સવાર 4 મુસાફરોના તરત જ મોત થયા હતા જ્યારે 29 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને હાટા CHCમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં 10 મુસાફરોની હાલત ગંભીર

હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ બસ બિહારના મધેપુરા જિલ્લાના મજૂરોને લઈને પંજાબ જઈ રહી હતી. બસમાં સવાર કામદારોએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર બસને ખૂબ જ ઝડપથી ચલાવી રહ્યો હતો. હાટા કોતવાલીના બાધનાથ ચાર રસ્તા પાસે NH 28 પર એક ટૂક ઉભી હતી પરંતુ બસની સ્પીડ વધુ હોવાને કારણે તે બસને કાબુમાં રાખી શકી નહીં. આ કારણે બસ જોરદાર અથડાઈ હતી.

હવે અયોધ્યા, કાશી, મથુરા, તાજમહાલમાં સુરક્ષા કવચ સાથે કડક બંદોબસ્ત મુકાશે

લખનઉ

મુખ્ય ધાર્મિક સ્થળો, અયોધ્યા, મથુરા અને કાશી ઉપરાંત મુખ્ય પર્યટન કેન્દ્ર તાજમહાલની સુરક્ષા માટે સરકારે સુરક્ષા-ઓડીટ કરવા નિર્ણય લીધો છે. ગયા મહિને જ યોજાયેલી સુરક્ષા સંબંધી વ્યવસ્થા વિચારવામાં આવી હતી. જેમાં ડ્રોન હુમલા સહિત વિવિધ પ્રકારે આતંકીઓ દ્વારા થઈ શકે તેવા હુમલાઓ વિષે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ તમામ સ્થળોની સુરક્ષા ભવિષ્યમાં યુપી સ્પેશ્યલ સિક્યોરિટી ફોર્સને સોંપવામાં આવશે. આ ચારે સ્થળો નિશ્ચિત કરવા માટેનું કારણ તે છે કે કાં તો તે સ્થળોમાં ભૌગોલિક પરિવર્તન આવ્યું છે અથવા તો તે અંગે નવા વિવાદો ઉભા થયા છે.

સામૂહિક રેપ પ્રકરણમાં CISFના આઠ કોન્સ્ટેબલને બરતરફનો આદેશ અકબંધ

વર્ષ 2015માં ફરિયાદ થઈ હતી : કેસ સામે આવ્યા બાદ આરોપીઓને બરતરફ કરાયા હતા

બેંગલુરુ

સામૂહિક દુષ્કર્મ તથા બ્લેકમેલને લગતા એક ૭ વર્ષ જૂના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે સીઆઈએસએફના ૮ કોન્સ્ટેબલને સેવામાંથી બરતરફ કરવાના આદેશને અકબંધ રાખ્યો છે. આરોપી એવા સીઆઈએસએફના કોન્સ્ટેબલને તેમના સહયોગીની પત્ની સાથે ગેંગરેપ કર્યા બાદ તેને બ્લેકમેલ કરી હતી.

પીડિતાએ વર્ષ ૨૦૧૫માં આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને આ સમગ્ર કેસ સામે આવ્યા બાદ

આરોપીઓને બરતરફ કરી દેવામાં આવ્યા હતા.

પીડિતાના કહેવા પ્રમાણે પહેલા એક આરોપીએ તેના સાથે મિત્રતા કરી હતી. બાદમાં અન્ય સાથીઓ સાથે મળીને દુષ્કર્મ કર્યું હતું અને બ્લેકમેલ કરી હતી. સીઆઈએસએફ દ્વારા આવાતને ગંભીરતાથી લેવામાં આવી હતી તથા આરોપીઓને સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા.

સીઆઈએસએફ ડિસિપ્લિનરી ઓથોરિટીએ કહ્યું હતું કે, સંગઠનમાં અનુશાસન તથા નૈતિકતા સર્વોપરી

છે. આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગુનાને માફ ન કરી શકાય. જે ઘટના બની તેની નકારાત્મક અસર ડ્યુટી પર તૈનાત પીડિતાના પતિ પર પડશે.

ટ્રાયલ કોર્ટે આ કેસમાં તમામ ૮ આરોપીઓને ક્રિમિનલ ચાર્જસમાંથી મુક્ત કરી દીધા હતા. તે આદેશ બાદ હાઈકોર્ટમાં કોન્સ્ટેબલની બરતરફી મામલે અપીલ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓમાં સીઆઈએસએફ દ્વારા બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો તે ઉચિત છે.

અગ્નિપથમાં ફોર્મ ભરનારાનો બહિષ્કારની ખાપ દ્વારા ધમકી

રોહતક

ખાપ નેતાઓ અને ખેડૂત આંદોલનના પ્રતિનિધિઓએ બુધવારે કહ્યું કે જે કોઈપણ અગ્નિપથ ભરતી યોજનાનું ફોર્મ ભરશે અથવા તેમાં ભાગ લેશે તેઓનો 'સામાજિક બહિષ્કાર' કરવામાં આવશે. હરિયાણાના રોહતક જિલ્લાના એક ગામમાં બુધવારે પંચાયત બોલાવાઈ હતી જેમાં વિવિધ ખાપ પંચાયતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પંચાયતમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પંજાબની વિવિધ ખાપના પ્રતિનિધિઓ હાજર રહ્યા તેમજ ત્યાંના વિદ્યાર્થી સંગઠનોના સભ્યોએ પણ હાજરી આપી હતી. આ મીટિંગના અધ્યક્ષસ્થાને હાજર

રહેલા ઓમ પ્રકાશ ધાનકરે કહ્યું કે 'અગ્નિપથ યોજના મુદ્દે આંદોલન કરી રહેલા જે યુવકોની અટકાયત કરાઈ છે તેઓ સામેના કેસ પાછા ખેંચવામાં આવે તેવી અમારી માગ છે. તારીખ ૨૪મી જૂને આ નિવેદન સોંપવામાં આવશે. મહાપંચાયતે એ પ્રકારે પણ જાહેરાત કરી છે કે કૃષિ આંદોલનની માફક જાહેર તેમણે એવું પણ જણાવ્યું કે, આ પંચાયતમાં એ પ્રકારે પણ નિર્ણય લેવાયો છે કે મલ્ટિનેશનલ કંપનીમાંથી રૂપિયા ૧૦,૦૦૦ કે તેથી વધુ કિંમતની કોઈ ચીજવસ્તુ ખરીદવી નહીં. કારણકે, આ કોર્પોરેટ કંપનીઓ પોતાના પ્લાન મુજબ કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ જેવી યોજનાઓ લાવી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ, આસામમાં વધુ 9ના મોત

અસરગ્રસ્તોની સંખ્યા વધીને 55 લાખને પાર થઈ વરસાદ-પૂરને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ



જમ્મુ/ શ્રીનગર

જમ્મુ-કાશ્મીરમાં આજે ભારે વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ અને પૂરને પગલે ભૂસ્ખલનની ઘટનાઓ પર જોવા મળી હતી. ડોડા, કિશતવર અને રામબાણ સહિતના કેટલાક જિલ્લાઓમાં વહીવટી તંત્રને શાળાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેના પગલે આ વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. બીજી તરફ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે સતત બીજા દિવસે બંધ રહેતા અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતાં. બીજી તરફ આસામમાં પૂરને કારણે

વધુ ૧૨ લોકોનાં મોત થયા છે અને અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૫૫ લાખને પાર થઈ ગઈ છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સંગમમાં જેલમ નદી ભયજનક સ્તરને વટાવી ગઈ છે અને નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ચેનબ નદીના આજુબાજુના વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં બરફ વર્ષા થતાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. કિશતવાડ જિલ્લામાં બરફ વર્ષાને કારણે અટવાઈ ગયેલા ૫૦ વાહનચાલકોને પોલીસે બચાવ્યા હતાં. નદીમાં પાણીનું સ્તર ૨૧.૬૦ ફૂટ માપવામાં આવ્યું હતું.

યુપીમાં પીલીભીતમાં ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત: 10ના મોત, 6 ઈજાગ્રસ્ત

2ની હાલત અતિ ગંભીર, CM યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું

પીલીભીત

ઉત્તર પ્રદેશના પીલીભીત ભીષણ માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી પ્રમાણે હરિદ્વારથી ખોલા જઈ રહેલી પિકઅપ વૃક્ષ સાથે અથડાઈ હતી જેમાં 10 લોકોના મોત થઈ ગયા છે. ટોચના જિલ્લા અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડ્રાઈવરને ઝોકું આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પીલીભીતના ગજરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં



એક તેજ રફતાર પિકઅપ ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માત સવારે 4:00 વાગ્યાની આસપાસ થયો હતો. પિકઅપ ઝાડ સાથે અથડાયા બાદ પલટી

મારી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવરને ઝોકું આવી ગયો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10ના મોત અને 6 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 2 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માતનો શિકાર બનેલા મોટા ભાગના લોકો લખમીપુર જિલ્લાના રહેવાસી હતા જેઓ હરિદ્વારથી સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, માર્ગ અકસ્માતમાં થયેલા લોકોના મૃત્યુ ખૂબજ દુ:ખદ છે.

હરિયાણામાં અગ્નિપથ યોજનાથી 75% અગ્નિવીરોને નોકરીની ગેરંટી

રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું મોટું નિવેદન

ભિવાની

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ના અવસર પર, મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે રાજ્યના લોકોને અભિનંદન આપતા એક મોટું એલાન કરી. 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભિવાનીમાં આયોજિત રાજ્ય સ્તરીય સમારોહમાં મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે હરિયાણાના તમામ નિવૃત્ત 75% અગ્નિવીરોને અગ્નિપથ યોજનામાંથી નિવૃત્ત થયા બાદ નોકરી મળશે.

આ બધા યુવાનોને પોલીસમાં પસંદગી આપવામાં આવશે. અગ્નિપથમાંથી નિવૃત્ત યુવાનો ગ્રુપ Cમાં પણ ભરતી થઈ શકે છે. બીજી તરફ સીએમ ખટ્ટરે જણાવ્યું કે, આજે દરેક ભારતીયો માટે ગૌરવનો દિવસ છે. યોગ માત્ર શારીરિક ક્રિયા જ નથી પરંતુ તે અમારું મન માનસિક, બૌદ્ધિક શારીરિક વિકાસ બધુ તેનાથી જ થાય છે. એટલા માટે આજે અમે હરિયાણામાં દરેક બ્લોક અને જિલ્લા, સ્કૂલ, સંસ્થાઓમાં યોગ કાર્યક્રમ ચલાવી રહ્યા છે.

મનીષ સિસોદિયા સામે માનહાનિનો કેસ દાખલ થયો

ગુવાહાટી

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુયાન સરમાએ દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદિયા વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આપના નેતા મનિષ સિસોદિયાએ 4 જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, વર્ષ 2020માં કોરોના મહામારી ફેલાઈ રહી હતી તે સમયે આસામ સરકારના મુખ્યમંત્રીની પત્નીની કંપની અને પુત્રના બિઝનેસ પાર્ટનરને બજાર દરથી ઉપર PPE કીટ આપૂર્તિ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

નેશનલ હેરાલ્ડ કેસ: માંદગી મુદ્દે સોનિયા ગાંધીએ ઈડી સમક્ષ વધુ મુદત માગી

નવી દિલ્હી

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, સોનિયા ગાંધીને કોવિદ અને ફેફસામાં લાગેલા ચેપને લીધે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા તે પછી તેઓને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા છે તેમ છતાં તેઓની તંદુરસ્તી હજી પૂરી સુધરી નથી. તેથી તેઓએ ED ઓફિસમાં હાજર થવા માટે થોડા વધુ સમાહોની મુદત માંગી છે. તેઓને રજા પણ આપવામાં આવી હતી પરંતુ સાથે તેઓને કડક સૂચના આપવામાં આવી હતી કે તેઓએ ઘરમાં જ સંપૂર્ણ આરામ લેવો. આથી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ઈડી પાસે થોડા વધુ સમાહોની મુદત માગતા જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણ રીતે સાજા થશે પછી ઈડી સમક્ષ હાજર થશે.

આતંકીઓ પાસેથી પિસ્તોલ, બાઈક, એકે મેગિજિન જપ્ત કર્યા જમ્મુ-કાશ્મીરમાં LET સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરાઈ

બડગામ

જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓને માત્ર ઠાર મારવામાં જ નથી આવતા તે કાર્યવાહી તો માત્ર અનિવાર્ય હોય તો જ કરાય છે. હવે સુરક્ષા દળોનું ધ્યેય આતંકીઓની ધરપકડ કરી તેમની પાસેથી મહત્વની માહિતી કઢાવવાનું છે. તે સીલસીલામાં તેમણે LET સાથે સંલગ્ન તેવા ૩ આતંકીઓની ધરપકડ કરી છે. જમ્મુ અને કાશ્મીરની પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્ય

પોલીસ રાષ્ટ્રીય રાયફલ્સ અને CRPF દ્વારા સંયુક્ત રીતે ચલાવાઈ રહેલા અભિયાન દરમિયાન ૩ આતંકી આશિક હુસૈન, હાઝમ ગુલામ મોહીદીન ડાર અને તાહીર અહમદની ધરપકડ કરી પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા ના એક આતંકી મોડયુલનો ભંડારોડ કર્યો છે. ગઈકાલે પકડાયેલા આતંકીઓ પાસેથી એક ચાઈનીઝ બનાવટની પિસ્તોલ, એક AK મેગેજિન જેમાં ૩૦ રાઉન્ડ હતા તે તથા એક બાઈક પણ પકડાઈ છે.

આખરે યશવંત સિંહા રાષ્ટ્રપતિપદ માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બન્યા

કોલકાતા

રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૮મી જુલાઈએ છે ત્યારે બધાની નજર રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પર છે. ભાજપે હજુ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. પરંતુ વિપક્ષને ઉમેદવાર મળી ગયા છે. શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા અને ગોપાલકૃષ્ણ ગાંધીના ઈનકાર કર્યા પછી અંતે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બનવા તૈયાર થઈ ગયા છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ સહિતના વિરોધ પક્ષોએ મંગળવારે એક સંયુક્ત નિવેદનમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને સર્વસંમતિથી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી.

ગલબાભાઈ પટેલ : બનાસ ડેરીથી લોકોને સમૃદ્ધ કર્યા, બચપણમાં દલિત વિદ્યાર્થીઓને મિત્ર બનાવ્યા

બનાસકાંઠા એ ગુજરાતનો આખો જિલ્લો ગલબાભાઈ પટેલને યાદ કરે છે.

રાજસ્થાનના સૂકાભટ્ટ રણ ૧૯૬૦ના દાયકામાં દૂધ અને કચ્છની કોરીધાકોર જેવી રેતાળ બનાસકાંઠાની ભૂમિ પર પ્રકૃતિની કૃપા ઓછી છે પણ તેની માટીનું એક આગું બમીર છે. અહીંના લોકો પાણીદાર છે. કોઈ મુંબઈ જઈ ઝવેરી બન્યા છે તો કોઈ મોટા ઉદ્યોગપતિ. આ ભૂમિએ સાક્ષરો, કવિઓ અને શાયરો પણ આપ્યા છે. દલુભાઈ દેસાઈ જેવા ઉત્કૃષ્ટ નેતાઓ અને વિશાળ દિલના માનવી પણ આપ્યા છે. લોકોને વર્ષો સુધી યાદ રહે તેવા અને બનાસકાંઠાની માટીની સુગંધના પ્રતીક એવા ગલબાભાઈ પટેલ પણ આપ્યા છે.

પાલનપુર ખાતે આવેલી સુપ્રસિદ્ધ બનાસ ડેરી એ ગલબાભાઈ પટેલનું જીવન જાગતું સ્મારક છે. ઉત્તર ગુજરાતમાં ગલબાભાઈ પટેલ ગલબાકાકાના નામથી જાણીતા હતા. એ વખતે બનાસકાંઠા એ રાજસ્થાનના નજીકના રણ જેવી ભૂમિનો જિલ્લો હતો. લોકો ગરીબ હતા, પરંતુ બનાસ ડેરીની સ્થાપના બાદ આ વિસ્તારમાં સુખ અને સમૃદ્ધિ વધ્યા. આજે

આખો જિલ્લો ગલબાભાઈ પટેલને યાદ કરે છે.

૧૯૬૦ના દાયકામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ‘અમૂલ’ એક મોટું નામ હતું. એ સમયગાળા પછી ૧૯૬૯માં ગલબાભાઈ પટેલે બનાસ ડેરીના નામથી નાનકડી શરૂઆત કરી હતી. ૧૯૬૯માં નાના પાયે શરૂ થયેલી આ બનાસ ડેરી આજે દૂધ ઉત્પાદનમાં એશિયામાં મોખરાની ડેરીઓમાં સ્થાન ધરાવે છે. નોંધપાત્ર વાત એ છે કે, ૧૯૬૯માં બનાસ ડેરીનો પાયો નાખનાર ગલબાભાઈ પટેલ તેનાં ચાર જ વર્ષ બાદ એટલે કે ૧૯૭૩માં આ દુનિયા છોડી ગયા, પરંતુ આખાં જિલ્લાને સુખી કરતા ગયા.

એસ.ટી. બસમાં ફરતા ગલબાભાઈ પટેલનું જીવન નિષ્કલંક અને સાદગીભર્યું હતું. તેમણે ડેરીને પોતાની અંગત આવક વધારવાની સંસ્થા કદી બનવા દીધી નહીં. બનાસ ડેરીથી પોતાના વતન જવા માટે ઘણી વખત તેઓ ડેરીના વાહનના બદલે એસ.ટી. બસનો ઉપયોગ કરતા હતા. ગલબાભાઈ પોતાનું વાસણ જાતે માંજતા. ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ અને



જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા પછી પણ તેમણે સ્વાશ્રયની આ પ્રણાલિકા ચાલુ જ રાખી હતી. એમની નમ્રતા અને સાદગી જોઈ ઘણાંને આશ્ચર્ય થતું. અહંકાર, ધમંડ અને અભિમાનથી તેઓ જોજનો દૂર હતા.

ગલબાકાકાનું જીવન

ગલબાભાઈ પટેલનું જીવન સ્વયં એક નવલકથા જેવું છે. ગલબાભાઈ નાનજીભાઈ પટેલનો જન્મ ૧૯૧૮ની સાલમાં વડગામ તાલુકાના ગામમાં થયો હતો.

ગલબાભાઈના પિતા નાનજીભાઈ ખેતીની આવક ધરાવતા નળાસર ગામના મધ્યમ વર્ગના ખેડૂત હતા. અનેક બાધાઓ-માનતાઓ બાદ નાનજીભાઈના ઘરે પગલીનો પાડનાર જન્મ્યો પણ બાળક બે વર્ષનો થાય તે પહેલાં પિતા ચાલ્યા ગયા. પુત્રનું નામ ગલબો. માતાથી વૈધવ્ય સહન ના થતાં તેઓ પણ છ મહિનામાં જ પતિની પાછળ અનંતયાત્રાએ જ પતિની પાછળ અનંતયાત્રાએ ચાલ્યાં ગયાં. નિરાધાર બાળક ગલબાને ઉછેરવાની જવાબદારી કાકા દલુભાઈ પટેલે ઉપાડી લીધી. મેનાકાકીની હૂંફ મળી. ગામમાં સ્કૂલ નહોતી. છોકરાનું મન ના લાગતાં તે સીમમાં ઢોર ચારવા જતો.

ઢોર ચરાવતા હતા

એ વખતે આખા નળાસરમાં માત્ર એક જ છોકરો ભણેલો હતો અને તે ગલબાભાઈ. તે પોતાના મામાને ત્યાં રહીને ભણી આવેલો. તેણે બાળક ગલબાને ભણાવવાનું શરૂ કર્યું.

બાળક ગલબો અને ગલબાભાઈ ઢોર ચરાવવા હવે એક જ સીમમાં જાય અને ત્યાં ઢોરને છૂટાં જ મૂકીને બંને ઝાડની નીચે બેસી જાય. ઢોર ચરાવતાં બાળક ગલબાની પ્રવૃત્તિ

વિશે દલુભાઈ જાણી ચૂક્યા હતા. આખરે તેમણે બાળક ગલબાને સ્કૂલમાં ભણાવવાનું નક્કી કર્યું. જો બાળક ગલબો બે-ત્રણ ચોપડી ભણે તો સારું એમ વિચારી તેને નળાસરની બાજુમાં જ મજાદરની એક ગામઠી શાળામાં મૂકવામાં આવ્યો. ત્યાં બે ચોપડી સુધી અભ્યાસ ચાલતો હતો. તે અભ્યાસ પૂરો કર્યા પછી બાળક ગલબાને વાસણામાં મૂકવામાં આવ્યો. વાસણાથી દોઢ કિલોમીટર દૂર કાણોદરમાં મોટી શાળા હતી અને ત્યાં સાત ધોરણ સુધી અભ્યાસ ચાલતો હતો. તેથી બાર વર્ષની ઉંમરે કાકા અને કાકીની છત્રછાયા છોડીને હવે મૂળીમાસીને ત્યાં રહેવા આવવાનું થયું. માસીને સંતાન નહોતું તેથી તેમને બાળક ગલબામાં જીવવાનું આધારબિંદુ મળી ગયું. કાણોદરની પ્રાથમિક શાળામાં બાળક ગલબાએ અસ્પૃશ્યતાની પરવા કર્યા વિના કેટલાક દલિત વિદ્યાર્થીઓને મિત્ર બનાવી દીધા.

(ક્રમશઃ આવતા અંકે)

દેવેન્દ્ર પટેલ

સંપર્ક

+91 98792 07102

॥ શ્રીસ્વામિનારાયણો વિજયતે ॥

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

સમયનો સદ્પયોગ, મહાપુરુષોનું અનુસરણ કરો

સાધુ આત્મવૃમ્હાસ

‘મારી પાસે સમય જ ક્યાં છે?’ ‘સમય મળે તો ને!’ ‘સમય ક્યાંથી કાઢવો?’ આવા વિચારો સતત આપણા મનમાં રમ્યા કરે છે. ક્યારેક એ આપણા હોઠ ઉપર પણ ફૂટી નીકળે છે. આપણને બરેબર એવું લાગે છે કે, આપણે અત્યંત વ્યસ્ત છીએ. ન કેવળ આપણે પણ દુનિયાની લગભગ પ્રત્યેક વ્યક્તિ આવું જ માને છે. માલેતુજારથી લઈને મજૂર સુધી અને હળપતિથી લઈને ઉદ્યોગપતિ સુધી સૌની આ ફરિયાદ છે.


હવે જોવાની ખૂબી એ છે કે, સામાન્ય માણસ કરતા અનેક ઘણું મોટું અને વધુ કાર્ય કરનારા કેટલાક મહાપુરુષો એવા પણ છે કે જેમને સમયની ખેંચ ક્યારેય અનુભવાઈ નથી.

ગાંધીજી માટે એવું કહેવાય છે કે, તેઓએ દાતણ કરતાં કરતાં ભગવદ ગીતાનો મુખપાઠ કર્યો હતો. વળી, જ્યારે તેઓને મુલાકાતીઓ મળવા આવતા ત્યારે એક મુલાકાતી વિદાય થાય અને બીજા મુલાકાતી એમની પાસે આવે, એની વચ્ચેના સમયના વપરાશ માટેનું પણ તેઓ આયોજન કરતા. મહાપુરુષો સમયની ખેંચ માટે ક્યારેય બૂમો નથી પાડતા, પણ એમાંથી રસ્તો કાઢવાનો પ્રયાસ કરે છે.

પ્રમુખસ્વામી મહારાજે પણ અનેકવિધ પ્રવૃત્તિઓની વચ્ચે પોતાના જીવનકાળ દરમિયાન ૭.૫ લાખથી વધુ પત્રો લખ્યા હતા. અતિ વ્યસ્ત દૈનિક ક્રમની વચ્ચે પણ તેઓ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા એનું મુખ્ય કારણ તેઓની સમયના ઉપયોગ સંબંધી નિપુણતા જ હતી. પ્રમુખસ્વામી મહારાજ ૧૨ જૂન ૧૯૮૦ના દિવસે ડૉ. દીક્ષિતની લેબોરેટરીમાં એક્સ-રે પડાવવા પધાર્યા હતા. ડૉક્ટર જ્યારે એક્સ-રે લેવા માટેની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે પ્રમુખસ્વામી મહારાજે હરિભક્તોએ મોકલેલા પત્રો પૈકી એક પત્ર વાંચવો શરૂ કર્યો. એક્સ-રે લેવાનો સમય થયો ત્યારે પ્રમુખસ્વામી મહારાજે એટલા સમય પૂરતો પત્ર બાજુ ઉપર મૂકી દીધો અને એક્સ-રે પડાવ્યો અને પછી પુનઃ પત્રપઠનમાં પરોવાયા. કુલ પાંચ એક્સ-રે પડાવવાના હતા.

દરેક એક્સ-રેની વચ્ચે મળતા કેટલીક સેકન્ડો કે મિનિટોના સમયખંડોમાં પ્રમુખસ્વામી મહારાજે આ જ સીલસીલો જારી રાખ્યો. વિશ્વના ઈતિહાસમાં બે એક્સ-રે વચ્ચે મળતા સમયના ટૂકડાઓનો ઉપયોગ પહેલી વખત આવો અસરકારક રીતે થયો હશે.

પ્રમુખસ્વામી મહારાજ આવા દરેક સમયખંડોનો ઉપયોગ ખૂબ ખૂબીથી કરી જાણતા. ભક્તોએ તેઓને પોતાની જ જન્મજયંતીના ભવ્ય મંચ ઉપર પણ પત્ર લખતા જોયા છે, તો ક્યારેક ચાલુ મુસાફરીએ ટ્રેન અથવા ગાડીમાં પત્ર વાંચતા



પણ જોયા છે. અરે, સવારે બાથરૂમમાં બ્રશ કરતા કરતા તો ક્યારેક ટ્રેનની રાહ જોતા પ્લેટફોર્મ ઉપર પણ પત્રવ્યવહારમાં પરોવાયેલા જોયા છે. આકાશમાં ફગાવેલો પાણો પાછો પૃથ્વી ઉપર આવ્યા વિના રહેતો નથી, તેમ પ્રમુખસ્વામી મહારાજને લખાયેલા પત્રનો ઉત્તર પત્ર લખનારને મળ્યા વિના રહેતો નહિ. આજે જ્યારે આપણને દિવસના ૫૦ જેટલા વોટ્સ-એપ મેસેજ લખવા માટે તો ઠીક પણ ફોર્વર્ડ કરવા માટેનો પણ સમય નથી

મળતો, ત્યારે તેઓ પોતાના ઉપર આવતા રોજના ૫૦ જેટલા પત્રોના ઉત્તરો વાળી દેતા. કોઈ એક પત્રનો અસરકારક જવાબ આપવા માટે તે પત્રને ધ્યાનથી વાંચી સમાજવો પડે. તેમાં પૂછાયેલી વિગતોના ઉત્તરો કાગળ ઉપર ટપકાવવા પડે અને અંતે તેને મોકલવા માટેની યોગ્ય કાર્યવાહી કરવી પડે. તેઓ દ્વારા થતાં અનેકવિધ દૈનિક કાર્યોમાં પત્રવ્યવહારનું કાર્ય તો એક હતું. આ સિવાય તેઓ રોજ સેંકડો લોકોને મુલાકાતો આપતા, દિવસની બે-ત્રણ સભાઓમાં કથા કરતા, નિત્ય સરેરાશ ૨૦-૨૫ હરિભક્તોના ઘરે પધરામણીઓ કરતા અને સંસ્થાની વહિવટી મિટિંગો કરતા. આટ-આટલી પ્રવૃત્તિઓ કરવા છતાં પણ તેઓએ ક્યારેય સમયના ખેંચ સંબંધી ફરિયાદ કરી નથી. કારણ કે, તેઓ પોતાને મળતી એક-એક સેકન્ડનો પૂર્ણ ઉપયોગ કરી જાણતા.

આપણે એક કલ્પના કરીએ. આપણને કહેવામાં આવે કે, તમને રોજ સવારે ૮૬,૪૦૦ રૂપિયા આપવામાં આવશે. તમે તે રૂપિયા તમારી રીતે વાપરી શકો છો. પણ શરત એટલી કે દિવસના અંતે ન વપરાયેલા રૂપિયા તમારી પાસેથી પાછા લઈ લેવામાં આવશે. રોજ મળતી આ માતબર રકમના વપરાશ માટે આપણે કેટલું સૂક્ષ્મ આયોજન કરીએ ?

બસ આવી જ રીતે આપણને પણ રોજ સવારે ૮૬,૪૦૦ રૂપિયા આપવામાં આવે છે અને તે સમયના રૂપમાં હોય છે. કારણ કે, કહેવાયું છે કે, **Time is money** જો આપણે આખા દિવસમાં મળતી સેકન્ડ્સની ગણતરી કરીએ તો એનો સરવાળો થાય છે - ૮૬,૪૦૦ થાય છે.

પૃથ્વી ઉપર વસતા તમામ લોકોને ભગવાન રોજ સરખો જ સમય આપે છે. એક સેકન્ડ પણ વધતી-ઓછી નહિ. કોઈને અન્યાય નહિ. જેટલી સેકન્ડ્સ પ્રમુખસ્વામી મહારાજને કે ગાંધીજીને મળતી હતી, એટલી જ સેકન્ડ્સ આપણને પણ મળે છે. નિર્ણય આપણે કરવાનો છે. આપણે સમયની ખેંચ માટેની ફરિયાદો કરતાં કરતાં જીવન પૂરું કરવું છે ? કે એના ઉપયોગનું યોગ્ય આયોજન કરીને જીવન પૂર્ણ બનાવવું છે ?

USAની સ્વિમર અનિતા બેભાન થઈને ડૂબી, કાંચે જીવ બચાવ્યાં

એક્વેટિક ચેમ્પિયનશિપમાં મોટી દુર્ઘટના: ફિના વર્લ્ડ એક્વેટિક ચેમ્પિયનશિપ દરમિયાન અનિતા અલ્વારેઝ સામે બની દુર્ઘટના

ફિના વર્લ્ડ એક્વેટિક ચેમ્પિયનશિપ દરમિયાન એક દુર્ઘટના બની હતી. અમેરિકાની પ્રોફેશનલ સ્વિમર અનિતા અલ્વારેઝ સોલો સિન્કોનાઈઝની ફાઈનલ દરમિયાન સ્વિમિંગ પૂલમાં જ અચાનક બેભાન થઈ ગઈ હતી અને તે ડૂબીને પૂલના તળિયા સુધી પહોંચી ગઈ હતી. તે શ્વાસ લઈ રહી નહોતી અને ઘટનાની ગંભીરતાને ગણતરીના સેકન્ડોમાં પારખીને તેની કોચ એન્ડ્રિયા ફ્યૂએન્ટેએ તાત્કાલિક પૂલમાં છલાંગ લગાવીને અનિતાને પકડીને ઉપર લાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકન સ્વિમિંગ ટીમને અન્ય એક મેન્સ સ્વિમરે પણ પૂલમાં જમ્પ લગાવીને કોચને મદદ કરી હતી. અનિતાને મેડિકલ ટ્રિટમેન્ટ અપાવવા માટે કોચ અને મેન્સ સ્વિમર બન્નેએ તેને પૂલના છેડા સુધી લઈને આવ્યા હતા. આ સમયે અનિતા સંપૂર્ણપણે બેભાન હતી. રસ્ક્યૂ તથા ઈમરજન્સી ટીમના સભ્યોએ અનિતાને સ્વિમિંગ પૂલની બહાર કાઢી હતી અને મેડિકલ ટ્રિટમેન્ટ આપી હતી. તેને સ્ટ્રેચર



ઉપર રાખીને સ્તબ્ધ થયેલી અમેરિકન સ્વિમિંગ ટીમ અને સમર્થકોની વચ્ચેથી મેડિકલ ટ્રિટમેન્ટ સેન્ટર લઈ જવાઈ હતી. સ્વિમર અનિતા ડૂબવા લાગતા કોચ એન્ડ્રિયાએ સમયસૂચકતા વાપરીને સ્વિમિંગ પૂલમાં જમ્પ મારીને તેને બચાવી હતી.

અમેરિકાની એક મેન્સ સ્વિમરે પણ અનિતાને પૂલની બહાર લાવવામાં મદદ કરી હતી. મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપી હતી પરંતુ એક કલાકની આ ખોફનાક ઘટનાથી અમેરિકન સ્વિમિંગ ટીમ સ્તબ્ધ થઈ ગઈ હતી. અનિતાએ શ્વાસ લેવાનું શરૂ કર્યા બાદ રાહત અનુભવનાર કોચ એન્ડ્રિયાએ જણાવ્યું હતું કે આ મોટી ઘટના હતી. અનિતાએ ડૂબતી વખતે શ્વાસ લેવાનું બંધ કર્યું હતું અને જ્યારે મેં લાઈફગાર્ડને બૂમો પાડીને બોલાવ્યા તો તેમણે ઘટનાને ગંભીરતાથી લીધી જ નહોતી. મારે સમયસૂચકતા વાપરીને સ્વિમિંગ પૂલમાં જમ્પ મારવો પડ્યો હતો.

વોર્મ-અપ મેચમાં ભારતનો ટોપ ઓર્ડર ફ્લોપ, ભરતે બાજી સંભાળી

લંડન

ઈંગ્લેન્ડ સામે પહેલી જુલાઈથી રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ પહેલાં લેસ્ટર સામે રમાઈ રહેલી ચાર દિવસીય વોર્મઅપ મેચમાં ભારતનો ટોચનો ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. મિડલ ઓર્ડરમાં શ્રીકાર ભરતે 111 બોલમાં અણનમ 70 રન બનાવીને ભારતની બાજી સંભાળી હતી. રમતને વહેલી બંધ કરવામાં આવી ત્યારે ભારતે 60.2 ઓવરમાં આઠ વિકેટે 246 રન બનાવ્યા હતા. ભારતના ચાર ખેલાડીઓ બુમરાહ, પ્રસિદ્ધ કિષ્ના,



પૂજારા અને રિષભ પંત લેસ્ટર તરફથી રમ્યા હતા.

ગિલે (21) પ્રથમ વિકેટ માટે 35 રન બનાવ્યા હતા. હનુમા વિહારી (3) અને શ્રેયસ ઐયર (0) ટૂંકી ઈનિંગ રમીને આઉટ થયા હતા. વિરાટ કોહલીએ 60 બોલમાં ચાર બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 33 રન બનાવ્યા હતા જે ભારત તરફથી બીજો સર્વશ્રોષ્ઠ સ્કોર રહ્યો હતો. ઉમેશ યાદવે 32 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. લેસ્ટર તરફથી રોમન વોકરે 24 રનમાં પાંચ વિકેટ ઝડપીને ભારતનો બેટિંગ ઓર્ડર વેરવિખેર કરી નાખ્યો હતો.

રોહિત શર્મા (25) અને શુભમન

ભારતની મજબૂત બોલિંગ સામે શ્રીલંકા ઘૂંટણિયે : ભારતીય ટીમની શાનદાર જીત

દાંબુલા

ભારત અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે મોટી જીત મેળવી હતી. ઓછા સ્કોર બનાવવા છતાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 મેચ 34 રને જીતી લીધી હતી.

દાંબુલામાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય મહિલા ટીમે મોટી જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ યજમાન શ્રીલંકાને 34 રને હરાવી ત્રણ મેચની T20 શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં મોટો સ્કોર કરી શકી ન હતી, પરંતુ તેમ છતાં સારી બોલિંગના દમ પર ટીમે 34 રનથી જીત મેળવી

હતી. 20 ઓવર રમ્યા બાદ પણ યજમાન ટીમ 104 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતને સારી શરૂઆત મળી ન હતી. ટીમે 17 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હરમનપ્રીત કૌરે શેફાલી વર્મા સાથે મળીને ઈનિંગ સંભાળી હતી, પરંતુ વિકેટો પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા હતા, જેમાં જેમિમા રોડ્રિગ્સે અણનમ 36 રન બનાવ્યા હતા. 139 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને પણ સારી શરૂઆત મળી ન હતી.

અફઘાનિસ્તાન ભૂકંપમાં સર્વસ્વ ગુમાવનાર માસૂમની મદદ કરવા રાશિદ ખાનની અપીલ

મુંબઈ

અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ભારે નુકસાન થયું છે. આ ભૂકંપમાં 1000થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. રિક્ટર સ્કેલ પર 6.1ના આ ભૂકંપના કારણે અફઘાનિસ્તાનમાં 3000થી વધુ કાચા અને પાકાં મકાનો ધરાશાયી થયા છે. પહેલાથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના લોકો માટે ભૂકંપના કારણે મુશ્કેલી વધી છે. આ મુશ્કેલ સમયમાં દુનિયાભરના દેશો અફઘાનિસ્તાનની મદદ માટે આગળ આવ્યા છે. અફઘાનિસ્તાનના ટિગ્ગજ ક્રિકેટર રાશિદ ખાને પણ આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનના લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે. રાશિદ ખાને આ ભૂકંપમાં સર્વસ્વ ગુમાવનાર માસૂમ બાળકની તસવીર



ટિવટર પર શેર કરી છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું હતું કે, આ નાનકડી પરી પોતાના પરિવારની એકમાત્ર જીવિત સભ્ય છે. સ્થાનિક લોકોને ભૂકંપ બાદ આ બાળકની પરિવારના અન્ય કોઈ સભ્ય મળ્યા નથી. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે અને દૂર દૂરના વિસ્તારોમાં લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે.

ICC T20 રેન્કિંગ: દિનેશ કાર્તિકની મોટી છલાંગ, ઈશાન કિશન ટોપ-10માં

દુબઈ

ICCની તાજેતરની જાહેર કરાયેલી T20 ઈન્ટરનેશનલ બેટ્સમેન રેન્કિંગમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે. દિનેશ કાર્તિકે 108 સ્થાનની છલાંગ લગાવી છે, જ્યારે ટોપ-10માં ઈશાન કિશન એકમાત્ર ભારતીય ખેલાડી છે. લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર દિનેશ કાર્તિકે આઈસીસીની તાજેતરની જાહેર કરાયેલી T20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. બીજી તરફ ઈશાન કિશન છટ્ટા સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચોની શ્રેણીના પ્રદર્શનના આધારે

આ બંનેને T20 બેટિંગ રેન્કિંગમાં ફાયદો થયો છે. દિનેશ કાર્તિકે 87માં સ્થાને પહોંચી ગયો છે જ્યારે ઈશાન કિશન છટ્ટા સ્થાને છે. ઈશાન કિશને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની શ્રેણીમાં બે અડધી સદી ફટકારી હતી અને 41ની એવરેજથી 206 રન બનાવ્યા હતા. આ ફોર્મના કારણે ઈશાન કિશને તાજેતરમાં જ જાહેર થયેલી T20 બેટિંગ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ T20 બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે અને કિશન ટોપ-10માં એકમાત્ર ભારતીય છે. બોલરોની T20 રેન્કિંગમાં યુઝવેન્દ્ર ચહલે સૌથી લાંબી છલાંગ લગાવી છે.

કેનેડાના કેલેડ્રન કન્ટ્રી ક્લબમાં નિતાંશી પટેલે રાજ પટેલ સાથે પ્રભુતામાં પગલા માંડ્યા

કેનેડામાં રહેતા રાજ પટેલ સાથે પોતાની દિકરી નિતાંશી પટેલના લગ્નની મધ્યમાં પુરી કરવા તેમના માતા-પિતા સુરત, ઈન્ડિયાથી કેનેડા આવ્યા હતા. મામા-મામીના મામેરા સાથે રંગે-ચંગે લગ્નની વિધી સગા-સંબંધી મિત્ર મંડળની હાજરીમાં ૧૯ જૂન ૨૦૨૨ના રોજ કેલેડ્રન કન્ટ્રી ક્લબ (કેનેડા) ખાતે સંપન્ન થઈ હતી.

છેલ્લા 30 વર્ષમાં ઈંગ્લેન્ડમાં સૌથી મોટી રેલ હડતાળ, આખું ટ્રાવેલ નેટવર્ક ખોરવાયું

વધતા જતાં ફૂગાવો-ભાવ વધારાને લીધે સ્ટાફે પગાર વધારો સાથે નોકરીની સલામતી માંગી

લંડન

મંગળવારથી છેલ્લા ૩૦ વર્ષમાં ઈંગ્લેન્ડમાં પડેલી સૌથી મોટી રેલ હડતાળ શરૂ થઈ ગઈ છે. તે સાથે લાખો કોમ્પ્યુટર્સ અને પેસેન્જર્સને પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે. આ સાથે ઉદ્યોગોને પણ મુશ્કેલી વધી છે, કારણ કે કોલસા અને ડીઝલથી શરૂ કરી કાચા અને પાકા બંને પ્રકારના માલની હેરાફેરી જ બંધ થઈ ગઈ છે.

ઉદ્યોગોને બીજી ભીતિ તો તે લાગે છે કે આ પ્રચંડ રેલ હડતાળને પગલે દેશના ઉદ્યોગોમાં પણ હડતાળનો વાયરો ન ફૂંકાય. ઈંગ્લેન્ડના ૪૦ હજાર જેટલા રેલ કર્મચારીઓ સતત વધી રહેલા ભાવ અને સતત ઉંચે જતા ફૂગાવાને લીધે પોતાને પડતી આર્થિક મુશ્કેલીઓ માટે પગાર વધારાની માગણી કરી રહ્યા છે. તેઓ મંગળવારે, ગુરુવારે અને



શનિવારે સવારથી એકઠા પણ થવાના છે, પરંતુ કામ ઉપર ચઢવાના નથી. ઈંગ્લેન્ડનાં દરેક સ્ટેશનો સૂમસાન બની ગયા છે. લંડનની અન્ડર ગ્રાઉન્ડ મેટ્રો પણ લગભગ બંધ છે.

બ્રિટનમાં પોલિયો વાઈરસ મળી આવતા આરોગ્ય વિભાગ એલર્ટ વાઈરસની ઓળખ વીડીપીવી-2 તરીકે કરવામાં આવી

લંડન

લંડનની ગટરમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં પોલિયો વાઈરસ મળી આવતા બ્રિટનના આરોગ્ય સત્તાવાળાઓએ માતાપિતાને પોતાના બાળકોને સમયસર વેક્સિન અપાવવાની અપીલ કરી છે. આ વાઈરસ મળી આવ્યા પછી આરોગ્ય વિભાગે અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું છે.

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (યુકેએચએસએ)એ જણાવ્યું છે કે ફબુરઆરી અને મે મહિનામાં લેવામાં

આવેલા સેમ્પલમાં પોલિયો વાઈરસ મળી આવતા આ સંદર્ભમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સેમ્પલ મળી આવેલા પોલિયો વાઈરસની ઓળખ વેક્સિન ડેરિવેડ પોલિયોવાઈરસ ટાઈપ ૨ (વીડીપીવી-૨) તરીકે કરવામાં આવી છે. આ વાઈરસથી રૂઆસામાન્ય સ્થિતિમાં પેરાલિસિસ જેવી ગંભીર બિમારી થાય છે. જે લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ નથી તેમનામાં આ પ્રકારની બિમારી થવાની શક્યતા છે.

અમેરિકાના મિયામી એરપોર્ટ પર લેન્ડિંગ ગિયર તુટતા વિમાનમાં આગ, ૩ ઈજાગ્રસ્ત

મિયામી

યુએસના મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 126 લોકોને લઈને જઈ રહેલા એક પ્લેનમાં આગ લાગી જ્યારે તેનું લેન્ડિંગ ગિયર રનવે પર તૂટી ગયું. માહિતી અનુસાર, ડોમિનિકન રિપબ્લિકના સેન્ટો ડોમિંગોથી રેડ એરની ફ્લાઈટમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લેવા માટે પ્લેન પર સફેદ કેમિકલનો ફોમનો ઉપયોગ કર્યો હતો. કેટલાક વીડિયોમાં



ગભરાયેલા મુસાફરો આગથી ભાગતા જોવા મળે છે, જોકે ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લીધી હતી. પ્લેન સાન્ટો ડોમિંગોથી લગભગ સાંજે 5.30 વાગ્યે (સ્થાનિક સમય) આવી રહ્યું હતું. રનવે પરથી ટેકઓફ કર્યા બાદ પ્લેન કેન

ટાવર અને નાની ઈમારત સહિત અનેક વસ્તુઓ સાથે અથડાયું હતું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એ જણાવ્યું હતું કે, એરોપ્લેન મેકડોનેલ ડગ્લસ MD-82 હતું અને તે ઘટનાસ્થળે તપાસકર્તાઓની એક ટીમ મોકલશે.

સયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા રાજદૂતપદે રૂચિરા કમ્બોજને નિયુક્ત કરાશે

લંડન

૧૯૮૭ બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી રૂચિરા કમ્બોજ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં નવા કાયમી રાજદૂત પદે નિયુક્ત થવાના છે. અત્યારે તેઓ ભૂતાનમાં રાજદૂતપદે છે યુનો સ્થિત વર્તમાન રાજદૂત ટી.એસ. તિરૂમૂર્તિ નિવૃત્ત થતાં તેમનાં સ્થાને તેઓ નિયુક્ત થશે. ૧૯૮૭ની IFSમાં તેઓ 'ટોપર' હતા. ભૂતાનમાં રાજદૂત બનતા પહેલા તેઓ ઈ. આફ્રિકામાં ભારતના હાઈ-કમિશનર પદે હતા. યુનેસ્કોમાં તેઓએ ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે પણ સેવા આપી છે. રૂચિરા ભૂતાનમાં સૌથી પહેલા મહિલા રાજદૂત છે. કેરિયરની શરૂઆતમાં તેઓ ફાંસમાં (પેરીસ)માં થઈ સેક્રેટરી તરીકે કરી હતી.

એક ઘરની ખરીદી માટે ડાઉન પેમેન્ટ 1,60,000 યુઆન ચીનમાં રિયલ એસ્ટેટ કંપનીએ ડાઉન પેમેન્ટમાં ઘઉં-લસણ લેવાનું શરૂ કર્યું

બીજિંગ

ચીનમાં એક રિયલ એસ્ટેટ કંપનીએ ઘર ખરીદદારોને લોભાવવા માટે અનોખી રીત શોધી છે. કંપનીએ ઘર ખરીદવાના ઈચ્છુક લોકો પાસેથી ડાઉન પેમેન્ટ તરીકે ઘઉં અને લસણને સ્વીકાર કરવાનું શરૂ કર્યું છે. આ રિયલ એસ્ટેટ કંપની હેનાન સ્થિત સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટ છે. જેણે એક જાહેરાત પણ આપી છે. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ઘર ખરીદવા માટે ઘઉં આપો. એક જાહેરાતમાં

કહેવામાં આવ્યું છે કે ખરીદદાર ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ તરીકે બે યુઆન પ્રતિ કૈટીના દરથી ઘઉંનો ઉપયોગ કરી શકે છે. કૈટી ચીનનું એક યુનિટ છે, જે લગભગ 500 ગ્રામ ભરાય છે. એક ઘરની ખરીદી માટે ડાઉન પેમેન્ટ 1,60,000 યુઆન છે. સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટના એક સેલ્સ એજન્ટે જણાવ્યું કે વિસ્તારના ખેડૂતોને મુખ્યરીતે આકર્ષિત કરવા માટે આ પ્રકારની જાહેરાત શરૂ કરી દેવાઈ છે.

પાક.માં હિન્દુ મહિલાના ગર્ભાશયમાં જ બાળકનું માથુ કાપી છોડી દેવાયું

લાહોર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક ગ્રામીણ સ્વાસ્થ્ય કેંદ્રની ઘોર બેદરકારી સામે આવી છે. સારવાર દરમિયાન એક ગર્ભવતી હિન્દુ મહિલાનું બાળક ધડથી અલગ થઈ ગયું હતું અને તેને ગર્ભમાં જ છોડી દેવામાં આવ્યું હતું. જેને પગલે ૩૨ વર્ષીય મહિલા હાલ જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છે.

આ સમગ્ર મામલાને લઈને ભારત અને પાકિસ્તાનમાં ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભીસમાં આવેલી પાક. સરકારે તપાસના આદેશ આપ્યા છે. સિંધ પ્રાંતના થારપારકર જિલ્લાના એક ગામની રહેલી ભીલ હિન્દુ

મહિલા પહેલા ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્ર (આરએચસી) પહોંચી હતી. જોકે કોઈ સ્ત્રી રોગ નિષ્ણાંત ત્યાં હાજર નહોતો. જેને પગલે બિનઅનુભવી સ્ટાફે આ મહિલાની સારવાર ચાલુ કરી હતી.

આ દરમિયાન જે સર્જરી કરવામાં આવી તેમાં મહિલાના બાળકનું માથુ કાપી નાખવામાં આવ્યું હતું અને તેને ગર્ભમાં જ છોડી દેવામાં આવ્યું હતું. જેને પગલે મહિલાનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ ગયું હતું. બાદમાં તેને અન્ય એક હોસ્પિટલમાં લઈ જવાઈ જ્યાં પણ તેની સારવાર માટે કોઈ જ સ્ટાફ નહોતો અંતે પરિવાર તેને એલ્યુએમએચએસ લઈ આવ્યો હતો.

પાકિસ્તાનના પંજાબમાં 'દૂષ્કર્મ'ના કેસમાં વધારો થતાં ઈમરજન્સી લાગુ કરવી પડી

દરોજ 4-5 કેસ નોંધાઈ રહ્યા છે, ચાર વર્ષમાં 14,456 મહિલાઓ સાથે દૂષ્કર્મની ઘટના

પંજાબ પ્રાંત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં દૂષ્કર્મ અને બાળ શોષણના મામલાઓ વધી રહ્યા છે, ત્યારબાદ પાકિસ્તાનની સરકારે મહિલાઓ અને બાળકો સામેના જાતીય શોષણના કેસોને રોકવા માટે રાજ્યમાં કટોકટી જાહેર કરી છે. પંજાબના ગૃહ પ્રધાન અતા તરારે રવિવારે જણાવ્યું હતું કે, વહીવટીતંત્રને "દૂષ્કર્મના કેસોનો સામનો કરવા માટે કટોકટીની સ્થિતિ જાહેર કરવાની" ફરજ પડી હતી. મંત્રીએ કહ્યું કે, પ્રાંતમાં મહિલાઓ અને બાળકો સામેના જાતીય શોષણના કેસોમાં ઝડપથી વધારો એ સમાજ અને સરકારી અધિકારીઓ માટે ગંભીર મુદ્દો બની ગયો છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના મુખ્યાલયમાં એક



પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મંત્રીએ કહ્યું, "પંજાબમાં દરરોજ દૂષ્કર્મના ચારથી પાંચ કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે સરકાર પર જાતીય સતામણી, દુર્વ્યવહાર અને તેના પર આરોપ મૂકવામાં આવ્યા છે.

પાક.ના સાંસદ અમિર લિયાકતનો મૃતદેહને બહાર કાઢવા કોર્ટનો આદેશ

ઈસ્લામાબાદ

પાકિસ્તાનના લોકપ્રિય ટીવી હોસ્ટ અને સાંસદ અમિર લિયાકતનું જીવન જેટલું વિવાદાસ્પદ હતું, તેટલું જ ચર્ચાસ્પદ તેમનું મૃત્યુ પણ બન્યું છે. લિયાકતના મોત અંગે સતત અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ત્યારેપાકિસ્તાનની એક અદાલતે લિયાકતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે. આ માટે લિયાકતના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવશે.

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે અબ્દુલ અહદ નામના વ્યક્તિની અરજીના

અનુસંધાને આ પ્રકારનો આદેશ આપ્યો છે.

ગત સપ્તાહે અબ્દુલ અહદ નામના વ્યક્તિએ એક અરજી દાખલ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, લિયાકતના મૃત્યુ માટેના કારણો જાણવા માટે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવું જ જોઈએ. ત્યારબાદ અદાલતે લિયાકતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો હતો. અદાલતના આ નિર્ણયની ખૂબ જ નિંદા કરવામાં આવી રહી છે. અનેક પાકિસ્તાની સેલિબ્રિટીઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

બાઈડન સરકારમાં ભારતીય મૂળની ડો. આરતી પ્રભાકરની મહત્વના હોદ્દા પર નિમણૂક

વોશિંગ્ટન

જો બાઈડન દ્વારા ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક ડો.આરતી પ્રભાકરની અમેરિકાના સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી વિભાગના ડાયરેક્ટર તરીકે નિમવા પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવને સ્વીકારનાર ડો. પ્રભાકર અમેરિકાના પહેલા મહિલા હશે. બાઈડને કહ્યું હતું કે, ડો.પ્રભાકર ઘણા વિદ્વાન અને સન્માનિય ઓન્જિનિયર તેમજ ભૌતિક વૈજ્ઞાનિક છે. તેઓ સાયન્સ અને ટેકનોલોજીમાં અમેરિકાની આગળ વધવાની શક્યતાઓનો વિસ્તાર કરવા માટે તેમજ આ ક્ષેત્રમાં જેટલા પણ પડકારો છે તેનો સામનો કરવા માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી વિભાગનું નેતૃત્વ કરશે.

ન્યૂયોર્કમાં સેલિબ્રેશનમાં ફાયરિંગ: એકનું મોત, પોલીસ અધિકારી સહિત 8ને ઈજા

ઉજવણી માટે જાણીતા સાઉથ સ્ટ્રીટ વિસ્તારમાં એકત્ર લીડ પર કરાયેલો ગોળીબાર

ન્યૂયોર્ક

ન્યૂયોર્કના હાલેમમાં ફાયર્સ ડેનું સેલિબ્રેશન ચાલતું હતું ત્યારે જ અંધાધૂંધ ગોળીઓ વરસી હતી. એ ફાયરિંગમાં એકનું મોત થયું હતું. આઠને ઈજા પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ગન કબજે કરી હતી. હુમલાખોર પકડાયો ન હતો. હુમલાખોરની શોધખોળ આદરી હતી. ફાયરિંગની વધતી ઘટનાઓથી લોકોમાં દહેશત ફેલાઈ હતી.

ન્યૂયોર્કના પોલીસ કમિશ્નર ક્રિચ્ટ સેવેલના કહેવા પ્રમાણે ફાયર્સ ડે વીકએન્ડ હોવાથી લોકો પરિવાર સાથે સમય વીતાવતા હતા. એવો જ એક કાર્યક્રમ હાલેમની એક ગલીમાં યોજાતો હતો. એ સંગીતમય કાર્યક્રમમાં અચાનક અંધાધૂંધ ગોળીઓ વરસવાનું શરૂ થયું હતું. લોકો કંઈ સમજે કે વિચારે તે પહેલાં નવ લોકો હુમલાખોરની ગોળીથી વિંધાયા હતા.



ચારને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. એમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એ પછી અન્ય પાંચ ફૂટપાથ પર ઘાયલ થયેલા મળી આવ્યા હતા. ઘાયલ થયેલા લોકોમાંથી બેને વધુ ઈજા પહોંચી હોવાનું પોલીસે કહ્યું હતું. હુમલાખોર વિશે વધુ જાણકારી એકઠી કરવામાં આવી રહી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ગન કબજે કરી હતી.

યુક્રેનનું બંદર ઓડેસા રશિયાના બોમ્બ ધડાકાઓથી ધૂણુ ઊઠ્યું

ખારકીવ

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુને વધુ ઉગ્ર થઈ રહ્યું છે. સોમવારે યુક્રેનના કાળા સમુદ્ર બંદર ઓડેસા પર રશિયન દળોએ આક્રમણ કર્યું હતું અને આ બંદર શહેર બોમ્બ ધડાકાઓથી ધૂણુ ઊઠ્યું હતું.

ક્રિમિયા ઓઈલ કંપનીના ગેસ ડ્રીલિંગ સ્ટેશન પર યુક્રેનિયન દળોના આક્રમણનો વળતો જવાબ હોવાનો રશિયન દળોએ દાવો કર્યો હતો. આ દરમિયાન યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમે એક ઉમેદવાર દેશ તરીકેના યુક્રેનના સ્ટેટસ બાબતે આ સમ્માહમાં યુરોપિયન યુનિયનના નિર્ણયની રાહ જોઈ રહ્યા

છીએ તે દરમિયાન રશિયન દળો હુમલો ઉગ્ર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન સોમવારે યુક્રેને સ્વીકાર્યું હતું કે તેમણે પૂર્વ યુક્રેનના ઔદ્યોગિક શહેર સેવરોડોનેસ્ક સાથે જોડાયેલા એક ગામ પરનું નિયંત્રણ ગુમાવી દીધું છે અને તે હવે રશિયન દળોના તાબામાં આવી ગયું છે. લગાન્કના રિજનલ ગવર્નરે જાહેરાત કરી હતી કે કમનસીબે અમે મેન્યોલકાઈન પરનો કબજો ગુમાવ્યો છે અને રશિયન દળોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે સ્વીકાર કર્યો હતો કે બંને પક્ષે ખૂબાર જંગ બાદ રશિયાએ આ ગામ આંચકી લીધું છે.

ઓસ્ટ્રેલિયન સંસદમાં હિજાબની એન્ટ્રી, ફાતિમા બની હિજાબ પહેરનારી પ્રથમ મહિલા

કેનબરા

ફાતિમા પેમાન અફઘાનિસ્તાન મૂળની મહિલા ઓસ્ટ્રેલિયાની સંસદમાં હિજાબ પહેરનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે. ઓસ્ટ્રેલિયાની એક ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર લેબરપાર્ટીની પેમાને વેસ્ટ ઓસ્ટ્રેલિયાની 6 મી સેનેટર હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં પેમાન સેનેટરના ઇતિહાસમાં ત્રીજા ક્રમની સૌથી નાની ઉંમરની સેનેટર છે. હિજાબ પહેરવા બાબતે તેને ખુલાસો કર્યો કે પહેલા તો એક અફઘાન કે મુસ્લિમ છે. બીજી બાજુ પોતે ઓસ્ટ્રેલિયાઈ સેનેટર છે જે તમામ ઓસ્ટ્રેલિયાઈ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. પેમાન 8 વર્ષની હતી ત્યારે અફઘાનિસ્તાન છોડીને પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા આવી હતી. પેમાન હિજાબ પહેરવાની પણ વકાલત કરે છે.

હોંગકોંગની તરતી રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી, કોરોના મહામારી પછી દેવામાં હતી



હોંગકોંગમાં તરતી રેસ્ટોરન્ટ હોટલ દરિયામાં સમાઈ ગઈ છે. આ રેસ્ટોરન્ટને પેરાસેલ નામના ટાપુની નજીક લાવવામાં આવતી હતી ત્યારે કાયમને માટે ઉડા દરિયામાં ઉતરી ગઈ હતી. આ રેસ્ટોરન્ટ કોરોના મહામારીના કારણે માર્ચ 2020માં બંધ કરવાની ફરજ પડી હતી. જે કે મહામારી પહેલા પણ મેનેજમેન્ટ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું હતું.

કેનેડિયન ફિલ્મ મેકર પૌલ હેગિસની જાતીય સતામણીના આરોપમાં ઈટાલીમાં ધરપકડ

શાંદાઈ

ઈટાલીમાં ફિલ્મમેકર પૌલ હેગિસની જાતીય સતામણીના આરોપ હેઠળ ધરપકડ થઈ હતી. દક્ષિણ ઈટાલીમાં રહેતી એક યુવતીએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમેકરે બે દિવસ સુધી તેનું જાતીય શોષણ કર્યું હતું. ઓસ્કર વિજેતા કેનેડિયન ફિલ્મમેકર પૌલ હેગિસ ઈટાલીમાં યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવ્યા હતા ત્યારે યુવતીનું જાતીય શોષણ કર્યું હોવાનો આરોપ ફિલ્મમેકર સામે લાગ્યો હતો. જોકે ફિલ્મમેકરના પ્રવક્તાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પોલીસે પૌલની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી. ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલી એક વિદેશી યુવતીનું તેની સહમતી વગર ૬૯ વર્ષના પૌલ હેગિસે જાતીય શોષણ કર્યું હતું.

HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.

CENTURY 21
Innovative Pinnacle Real Estate Group

- Free Staging
- Free Professional Photography & virtual tour
- Free Marketing, Flyers, Newspapers, Media Advertising
- Free Comparative Market Analysis
- Team of Professional for same price as hiring a single realtor
- Over 15 years of combined experience

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

JUST LISTED

23 Ventris Dr. Ajax

\$1,099,000

3+1 Bedrooms, 4 bathrooms

Welcome To 23 Ventris Dr. Beautiful Home In A Desirable Central West Community. Freshly Painted, Newer Kitchen With Quartz Countertop, Island With Breakfast Bar. W/O To Fully Fenced-In Oasis Backyard With 2 Tiered Deck & Beautiful Garden, Perfect To Entertain Guests.. Hardwood Flooring, Potlights (Inside And Outside Of The Home), New Kitchen In The Bsmt, Spacious Bedrooms. Sep. Ent To The Bsmt Thru The Garage To A 1 Bedroom In-Law Suite. Close To Hwy401, Plaza, Walking Distance To P.School.

JUST LISTED

1656 Major Oak Rd Pickering

\$1,599,000

Location!! Location!! Location!!

Freshly Painted, 4 Bed Room House With 2 Bed Room Finished Basement W/ Separate Entrance. Big Corner Lot, Grand Double-Door Entry Into 2-Storey Foyer. Spacious & Bright Principal Rooms. 3-Season Sunroom W/O From Family Room & Kitchen To Awesome 2-Tiered Deck & Fenced Backyard. New Garage Doors, Close To Schools, Places Of Worship, Public Transit & All Other Amenities.

JUST LISTED

2128 Saffron Dr. Pickering

1,899,000

Location Location*Don't Miss This Opportunity

To Own This Beautiful & Spacious, Builder Separate Entrance Detached Home In A Family Friendly Neighborhood With 5+1 Bedrooms, 4 Bathrooms, 10Ft Ceilings, Features Quartz Counter Top, Hard Wood Floors, Pot Lights, Backsplash & New Landscaping & New Paint Entire House, Oak Stair With Ion Pickets, Stainless Steel Appliances & Door Step Distance To Mosque, Near Highway 401&407, Public Transit, Parks, Schools Including French Immersion, Shopping Centre.

You have Nothing to Loose... Call us for a Free Consultation on How to Get Started.

Use The Advantage of a Team, Because... Teamwork Makes Your Dreams Work !

Shamim & Amin Kharodia

Broker of Record / Sales Representative

teamkharodia@gmail.com


300-2855 Markham Rd Toronto ON M1X 0C3

D: (647) 501-6786 | D: (647) 308-2941

F : (416) 298-8303 | P: (647) 666-8676

Grand Centurion Office

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.



CLUB CERAMIC

Porcelain Tiles : Premium Quality and Best Price

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking



TILES • BACKSPLASH • LAMINATE • VINYL • HARDWOOD

MONTREAL

3590, Rue Griffith, Saint Laurent,
QC, H4T 1A7
Phone: +1-514-260-2242 /
+1-514-813-3850

OTTAWA

Unit #4+5, 200
Colonnade Road,
Nepean, ON, K2E 7M1
+1-613-601-1474

MISSISSUAGA

5030 Maingate Drive, Unit#1,
Mississauga, L4W 1X5
Phone: +1 (647) 527-6030 /
+1-514-813-3850

CAMBRIDGE

15 Sheldon Dr, Cambridge,
ON N1R 6R8
+1-647-542-1508 ,
+1-647-527-6030

<https://clubceramic.com> Email : sales@clubceramic.com

MOTEL for SALE

NIRAJ PANCHOLI, REALTOR®

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

Cell: 647-866-2790

Email: ncpancholi@gmail.com

Website: <https://niraj-pancholi.c21.ca/>

Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...

Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings



MOTEL KING: Specializing in Selling Motels: LIST & SELL with confidence

Major Achievements: Among TOP 75 PRODUCERS IN CANADA AWARD & CENTURION PRODUCER AWARDS 2017-2021

NEW: 31 ROOM MOTEL IN SAULT STE. MARIE

With 3 BR house, main street of downtown, minutes away from all amenities such as shopping malls, schools, college, hospital, airport etc. & Close to USA border.

Asking Price: \$1.7M

(about 40% to 45% down payment required)

MOTEL OPERATOR / WORKING PARTNER REQUIRED

Good Salary + Partnership (20% to 50%)
Minimum \$200,000 investment required

URGENT LISTINGS REQUIRED MOTELS & HOTELS

Small Motels to Franchise Hotels anywhere in Ontario
Qualified Buyers are ready to close in 1 to 2 months

12 TO 45 ROOM MOTEL IN NORTHERN ONTARIO

Asking Price: \$900,000 To \$5,000,000
(40% to 50% down payment required)

RECENTLY SOLD MOTELS NEAR.....

Blind River, Welland, London, Sarnia, North Bay,
Cochrane, Pembroke, Ottawa, Thunder Bay

JOB AVAILABLE: For the Motel located in Northern Ontario

- **Housekeeper** for room cleaning and general work in the motel, accommodation available for the couple / small family
- **Working Partner** Willing to invest min \$200K, stay & operate/manage the motel offering Partnership + Salary to operate